

વર્ષ : ૬૮
અંક : ૬
જાન્યુઆરી : ૨૦૧૬
સાર્થગ અંક : ૧૩
વાર્ષિક લવાજમ
₹ ૧૫૦/-


કૃષિ વિદ્યા

આણંદ કૃષિ યુનિવર્સિટીનું પ્રકાશન



ગ્રનિકણું પરિસ્થિતિમાં ફળોની
પ્રેરણ

ગુજરાતની
સેન્ટ્રિય
કૃષિ નીતિ ૨૦૧૫
વિષે જાણીએ



પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કૃષિ વિષયક પુસ્તકો મંગાવી તેમાં આપેલ પેણાનિક માહિતીનો આપની ખેતીમાં ઉપયોગ કરી ખેતીને સમૃદ્ધ બનાવો

વૃક્ષોની ખેતી


સને નવેમ્બર ૨૦૧૫માં 'વૃક્ષોની ખેતી' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં વૃક્ષોનું મહત્વ, ખેતી સથે વૃક્ષ ઉછેર, કૃષિ વન, વિવિધ ૨૮ જેટલા વૃક્ષોની ખેતી પદ્ધતિ, વૃક્ષોના વિવિધ ઉપયોગો, વૃક્ષછીદન અંગેની કાયદાકીય જોગવાઈઓ, વન વિજ્ઞાન શિક્ષણ તેમજ તેને સંલગ્ન વિવિધ માહિતી ૧૬૦ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૭૦/- (રૂપરૂ) રૂ ૧૧૦/- (રૂણ. પોસ્ટવી)

કિંચન ગાર્ડન

સને ઓક્ટોબર ૨૦૧૫માં 'કિંચન ગાર્ડન' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં કિંચન ગાર્ડનના ફાયદાઓ, શાકભાજુનું ધરુ ઉછેર, શાકભાજુની જાતો, ખેતી પદ્ધતિ, પાક સંરક્ષણ, શાકભાજુ યોજનાના નકશાઓ, વર્મિકમ્પોસ્ટ, ટેરેસ ગાર્ડન, મૂલ્યવર્ધિત બનાવટો તથા અન્ય સંલગ્ન માહિતીનો ૮૮ પેજમાં સમાવેશ કરવામાં આવેલ છે.



કિંમત : રૂ ૪૦/- (રૂપરૂ) રૂ ૬૦/- (રૂણ. પોસ્ટવી)

જૈવિક નિયંત્રણા

સને ઓક્ટોબર ૨૦૧૫માં 'જૈવિક નિયંત્રણા' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ, પરજળી અને પરભક્તી ક્રીટકો, ઉપયોગી ક્રીટકો ઉપરાંત તેને સંલગ્ન માહિતી ૧૨૮ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૬૦/- (રૂપરૂ) રૂ ૧૧૦/- (રૂણ. પોસ્ટવી)

કૃષિ ક્ષેત્ર વપરાતા ક્રીટનાશકો


સને મે ૨૦૧૫માં 'કૃષિ ક્ષેત્ર વપરાતા ક્રીટનાશકો' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં ક્રીટનાશકોને અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે જેવી કે ક્રીટનાશકોનો વપરાશ, વર્ગીકરણ, વિવિધ સ્વરૂપો, પ્રોન્ટન્સેક્ટિસાઈડ, જીવાધૂનું-વિષાધૂનું-ફૂગ-કૃષિ - જૈવિક - વનસ્પતિજ્ઞન્ય ક્રીટનાશકો, ફેરોમોનનો ઉપયોગ તેમજ તેનો ઉપયોગ કાળજી અને તાંનિક-વ્યાપારી નામોની માહિતી ૮૪ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૪૦/- (રૂપરૂ) રૂ ૮૦/- (રૂણ. પોસ્ટવી)

ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેકનોલોજી

સને માર્ચ ૨૦૧૫માં 'ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેકનોલોજી' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં ગ્રીનહાઉસમાં કેપ્સીકમ મરચાં, ટામેટા, કાકડી, ગુલાબ, જર્બેરાનો ઉછેર, ગ્રીનહાઉસ પ્રોજેક્ટ્સ, અર્થકરણ, નિકાસના ધારાપારેણો, બજાર, પ્રોજેક્ટ અમલકરણ અને સરકારી સહાય તેમજ પ્રગતિશીલ જોડ્ટૂનોની સંખણાતાંઓની માહિતી ૨૬૦ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૧૦૦/- (રૂપરૂ) રૂ ૧૫૦/- (રૂણ. પોસ્ટવી)

પાક સંરક્ષણ

સને માર્ચ ૨૦૧૪ માં 'પાક સંરક્ષણ' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યમાં થતા ધાન્યપાકો, રોકીયા પાકો, તેલીબિયા પાકો, શાકભાજુ પાકો, કઠોળપાકો, ફળપાકો તથા અન્ય પાકોમાં આવતા રોગો અને જીવાતોની ઓળખ, નિયંત્રણ વગેરેની માહિતી ભલામણ કરેલ દવાઓના પ્રમાણ સહિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત જૈવિક નિયંત્રણ, કૃષિ નિયંત્રણ, ઉદર નિયંત્રણ, સંગ્રહેલ અનાજની જીવાતોનું નિયંત્રણ તથા ક્રીટનાશક / રોગનાશક દવાઓ અંગેની માહિતી ૩૦૪ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૮૦/- (રૂપરૂ) રૂ ૧૨૦/- (રૂણ. પોસ્ટવી)

શાકભાજુ પાકો

સને માર્ચ ૨૦૧૩માં 'શાકભાજુ પાકો' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાતમાં થતા શાકભાજુના તમામ પાકોની વેશાનિક ખેતી પદ્ધતિ તેમજ કિંચન ગાર્ડન, ગ્રીનહાઉસમાં શાકભાજુની ખેતી, સંરક્ષણાત્મક ખેતી, મૂલ્ય વર્ધન, નિકાસ ઉપરાંત સંલગ્ન સરનામા સહિતની વિસ્તૃત માહિતી ૨૧૨ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૬૦/- (રૂપરૂ) રૂ ૧૧૦/- (રૂણ. પોસ્ટવી)

ફળપાકો

સને માર્ચ ૨૦૧૩માં 'ફળપાકો' પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યમાં થતા તમામ મુખ્ય ફળપાકો તથા ગૌઢા ફળપાકોની સંપૂર્ણ વેશાનિક ખેતી પદ્ધતિ, મૂલ્ય વર્ધન, બનાવટો, નિકાસ, સહાય કાર્યક્રમો તથા સંલગ્ન સરનામા સહિતની વિસ્તૃત માહિતી ૨૧૨ પેજમાં આપવામાં આવેલ છે.



કિંમત : રૂ ૬૦/- (રૂપરૂ) રૂ ૧૧૦/- (રૂણ. પોસ્ટવી)

વધુ માહિતી માટે સંપર્ક સાધો

તર્તી, 'કૃષિગોવિદ્યા' પ્રકાશન વિભાગ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી યુનિવર્સિટી ભવન, આંધ્રપ્રદીપ ક્રિએટિવ આર્ટ્સ એન્ડ ટેકનોલોજીસ કેન્દ્ર, આંધ્રપ્રદીપ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૮૨) ૨૨૫૬૮૮/૨૬૧૫૨૧ Email : aaunews@aaun.in



કૃષિવન્તો રાષ્ટ્ર કૃષિસંપદનામ

કૃષિગોવિદ્યા

સ્થાપના : મે ૧૯૪૮

વર્ષ : ૬૮
અંક : ૬
જાન્યુઆરી : ૨૦૧૬
સંગ્રહ અંક : ૮૧૩

: તંત્રી મંડળ :

- ડૉ. પી. પી. પટેલ (અધ્યક્ષ)
- ડૉ. ડી. એમ. કોરાટ (સભ્ય)
- ડૉ. વી. આર. બોધરા (સભ્ય)
- ડૉ. એમ. વી. પટેલ (સભ્ય)
- ડૉ. એ. ડી. પટેલ (સભ્ય)
- ડૉ. એમ. જે. પટેલ (સભ્ય)
- ડૉ. એમ. એમ. ત્રિવેદી (સભ્ય)
- ડૉ. આર. આર. ગજેરા (સભ્ય)
- ડૉ. વાય. આર. ઘોડાસરા (સભ્ય)
- ડૉ. એન. વી. સોની (સભ્ય સચિવ)

: તંત્રી :

- ડૉ. એન. વી. સોની

લેખ અનુરૂપ ફોટો

: સૌજન્ય :

પ્રકાશન વિભાગ, આ.કુ.યુ.
આણંદ

વાર્ષિક લવાજમ : ₹ ૧૫૦

: સંપર્ક :

તંત્રી, 'કૃષિગોવિદ્યા' પ્રકાશન વિભાગ
વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી
યુનિવર્સિટી ભવન, આણંદ કૃષિ યુનિવર્સિટી
આણંદ જિ. આણંદ-૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૮૨) ૨૬૧૫૨૧/૨૨૫૮૮૭

E-mail : aaunews@aaun.in

સરનામા ફેરફાર / ફરીયાદ માટે
ફોન : (૦૨૬૮૨) ૨૨૫૮૮૮

ક્રમ	લેખ	લેખક	પૃષ્ઠ
૧	ગુજરાતની સેન્ટ્રિય કૃષિ નીતિ ૨૦૧૫ વિષે જાણીએ	ડૉ. એમ.વી. પટેલ	૫
૨	પાક ઉત્પાદનમાં પિયતની અગત્યતા	શ્રી જે. એચ. ગૌધરી	૧૦
૩	સજીવ ખેતે અંગે મનોમંથન જરૂરી છે	ડૉ. ડી. એમ. કોરાટ	૧૬
૪	પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફળોની ગુણવત્તા મુખ્યરવા ફળો ઉપર કોથળી ચથાવો	ડૉ. કે.પી. ક્રીકાણી	૧૮
૫	દૂધ ઉત્પાદન વધારવાની ચાવીઓ	ડૉ. નરેન્દ્રકુમાર એન. પંડ્યા	૨૨
૬	કપાસની સાંદીમાંથી વેજાનિક રીતે કર્મસ્થળ બનાવો	ડૉ. કે. એન. અકબરી	૨૮
૭	પશુપાલકો માટેનું વાર્ષિક કેલેન્ડર	ડૉ. એન.એ. જોધી	૩૩
૮	કૃષિમાં તાલીમની અગત્યતા અને તેના કાયદાઓ	ડૉ. કે. એસ. પટેલ	૩૬
૯	સાયબર કાઈમ	ડૉ. કૃષ્ણાલ સી. કમાણી	૩૮
૧૦	કૃષિ ક્ષેત્રે બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય	શ્રી જે.ડી. દેસાઈ	૪૨
૧૧	ખોરાકમાં થતી ભેણસેળથી બગીએ	શ્રી કમલેશ આર. જેઠવા	૪૭
૧૨	સમાચાર	અને શ્રી જગદીશ જે. ચાવડા ડૉ. વી. આર. બોધરા	૪૦

ગ્રાહકોને ખાસ સૂચના

'કૃષિગોવિદ્યા'ના દરેક ગ્રાહકોએ પોતાના સ્વીકર સરનામામાં પિનકોડ નંબર દર્શાવેલ ન હોય તો તાત્કાલિક પોસ્ટકાર્ડ દ્વારા ગ્રાહક નંબર સહિત પિનકોડ નંબર સાથેનું સરનામું અનેસી કચેરીએ તાત્કાલિક મોકલી આપણું, પોસ્ટના નિયમ મુજબ પિનકોડ નંબર દર્શાવવા આવશ્યક છે.

નોંધ : આમાં દર્શાવેલ અમિત્રાયો આણંદ કૃષિ યુનિવર્સિટીના નથી. 'કૃષિગોવિદ્યા' માં પ્રગટ થતા લેખો આણંદ કૃષિ યુનિવર્સિટીની માલિકીના છે. આંશિક અથવા પૂરેપૂરો ઉપયોગ લેખને અંતે 'કૃષિગોવિદ્યાના સૌજન્યથી' એમ ઉલ્લેખ સાથે કરી શકાશે. આ અંકમાં છૃપાયેલ જાહેરાત આણંદ કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે તેમ માનનું જરૂરી નથી.

ગ્રાહકોને...

- ૧ 'કૃષિગોવિદ્યા' દર માસની પહેલી તારીખે પ્રગત થાય છે.
- ૨ નવું વર્ષ મે માસથી શરૂ થાય છે પરંતુ કોઈપણ માસથી ગ્રાહક થઈ શકાય છે.
- ૩ વાર્ષિક લવાજમ રૂપિયા દોઢસો (૧૫૦) છે અને તેનો મનીઓર્ડર તંત્રીશ્રી, 'કૃષિગોવિદ્યા', પ્રકાશન વિભાગ, આંશંદ કૃષિ યુનિવર્સિટી, આંશંદ પિન : ૩૮૮૧૧૦ એ સરનામે કરવો. વી.પી.પી. થી અંકો મોકલવામાં આવતા નથી. બેંક ટ્રાફટ 'આંશંદ એચિકલ્યરલ યુનિવર્સિટી ફંડ એકાઉન્ટ, આંશંદ' ના નામનો સ્વીકારવામાં આવશે તેમજ ચેક બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં જેની નાંખ લેવા વિનંતી.
- ૪ ગ્રાહકોને અંક ચોકસાઈથી રવાના થાય છે એટલે અંક ખોવાઈ જાય તો તેની જવાબદારી કાર્યાલયની રહેતી નથી. આમ ઇતાં ગ્રાહકને પછીના માસની તારીખ ૧૦ સુધીમાં અંક ન મળે તો સ્થાનિક ટપાલ કચેરીમાં તપાસ કરી ત્યાં મળેલ જવાબ સાથે કાર્યાલયને જાણ કરવી જેથી તે અંગ ઘટતું કરવામાં આવશે.
- ૫ ગ્રાહકે સરનામું બદલાયાની જાણ તારીખ ૧૦ સુધીમાં કરવી. એક વખત અંક રવાના થયા પછી બીજો અંક મોકલવામાં આવતો નથી. આ અંગે (૦૨૬૬૨) ૨૨૫૮૮૮ ખાતે સંપર્ક સાધવો.
- ૬ પત્રવ્યવહારમાં ગ્રાહક નંબર સંપૂર્ણ રીતે લાખી જણાવવો જરૂરી છે. પેજ નં. ૫૨ ઉપર ચોટાડેલ સરનામાના સ્ટીકરમાં ગ્રાહક નંબર અને લવાજમ પૂરું થવાની વિગત (માસ-વર્ષ) જણાવેલ હોય છે. લવાજમ તાજું કરાવવા ઈચ્છનારે પેજ નં. ૫૨ ઉપર ચોટાડવામાં આવતા સરનામાના સ્ટીકરમાં છેલ્લે જણાવેલ માસ-વર્ષ દરમિયાન લવાજમ મોકલી આપવાનું રહેશે.

લેખકોને...

- ૧ લેખકશ્રી લેખ 'કૃષિગોવિદ્યા'માં છાપવા માટે આપવા માંગતા હોય તો તેઓએ તેના સભ્ય બનવું જરૂરી છે. લેખના મથાળે 'કૃષિગોવિદ્યા'નો ગ્રાહક નંબર જણાવવો જરૂરી છે. લેખક ગ્રાહક બને તેથી લેખ છાપવા માટે આંશંદ કૃષિ યુનિવર્સિટી બંધાયેલ નથી. યોગ્ય હશે તો લેખ છાપવામાં આવશે.
- ૨ 'કૃષિગોવિદ્યા'માં ખેતી, પશુપાલન, ડેરી, બાગાયત તથા તેને લગતા આનુસાંગિક વિષયોને આવરી લેવામાં આવે છે. સમયને અનુરૂપ પ્રકાશન માટે બે માસ અગાઉ લેખ મોકલવા જરૂરી છે. લેખકોએ પોતાના લેખ પ્રકાશન માટે મોકલે ત્યારે લેખ ટાઈપ કરીને એક નકલમાં તથા લેખનું મેટર ૪ થી ૫ પેજની મર્યાદામાં અને તેને અનુરૂપ ફોટો / ચિત્રોમાં સીડીમાં મોકલી આપવાના રહેશે. લેખની સાથે લેખકે પોતાનું નામ, સરનામું, પિનકોડ તથા ટેલિફોન નંબર, મોબાઇલ નંબર, ઈ-મેઈલ અવશ્ય દર્શાવવા. લેખ તથા ફોટો ઈ-મેઈલથી aaunews@aau.in ખાતે મોકલી શકાશે.
- ૩ લેખ છપાતાં 'કૃષિગોવિદ્યા'ની એક નકલ લેખક / સહલેખકને મોકલી આપવામાં આવે છે.
- ૪ ફોટગ્રાફરને ફોટો માટે 'કૃષિગોવિદ્યા'ની એક નકલ આપવામાં આવે છે.
- ૫ 'કૃષિગોવિદ્યા'માં પ્રસિદ્ધ થતા લેખની સંપૂર્ણ જવાબદારી તેના લેખકની રહેશે.
- ૬ વર્ષ દરમાન છપાયેલ લેખોમાંથી ઉત્તમ લેખ સમિતિ દ્વારા વિષય દીઠ લેખ પસંદ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તમ લેખ એવોઈ અંગેનું સર્ટિફિકેટ પ્રથમ લેખકને આપવામાં આવશે.

આ અમે નથી કહેતા...

'કૃષિગોવિદ્યા'માં ખેડૂતોપયોગી લેખોમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી ખેડૂતોને મળે છે. જેના લિધે વૈજ્ઞાનિક ટબે ખેતી કરતો થયો છું અને ખેતીના ઉત્પાદન અને આવકમાં પણ વધારો થયો છે.

- કનૈયાલાલ એસ. પંચાલ

નાવલી. તા.જી. આંશંદ

ગુજરાતની સેન્ટ્રિય કૃષિ નીતિ ૨૦૧૫ વિષે જાણીએ

ડૉ. એમ.વી. પટેલ ડૉ. કે.ડી. મેવાડા ડૉ. એસ. એન. શાહ
અગ્રોનોમી વિભાગ, બં. અ.કૃષિ મહાવિદ્યાલય
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૨૫૭૦૫



ભારતનો ખેડાણ લાયક જમીનનો ઓગ્રેનિક સર્ટિફિકેશન હેઠળના વિસ્તારની દાખિએ ૧૦ મો નંબર છે. ભારતમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ જમીનનો વિસ્તાર છે તેમાં ૧૫% એટલે કે ૭.૨ લાખ હેક્ટર જમીન ખેડાણ હેઠળના વિસ્તારની છે જ્યારે ૮૫% વિસ્તાર એટલે કે ૩૮.૮ લાખ હેક્ટર જમીન જેંગલ વિસ્તાર હેઠળની છે. ભારતમાં ૧૨.૪ લાખ ટન ઓર્ગેનિક પેદાશ ઉત્પન્ન થાય છે જેમાં મુખ્યત્વે શેરડી, કપાસ, તેલીબિયાં, પાકો, બાસમતી ચોખા, કઠોળ, તેજાના પાકો, ચા, કોઝી, ફળફળાઈ, સૂકો મેવો અને શાકભાજ પાકો મુખ્ય છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ભારતમાંથી ૧૩૫ સજીવ પેદાશ નિકાસ કરવામાં આવી હતી. સૌથી વધારે સોયાબીન ૭૦%, બાસમતી ચોખા સિવાય ધાન્યપાકો ૬%, પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ ૫%, ખાંડ ૩%, ચા ૨%, કઠોળ ૧%, સૂકો મેવો ૧% અને તેજાના પાકો ૧% ની નિકાસ થઈ રહી છે. મુખ્યત્વે અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા, સ્વિટઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફિકા અને મિડલ ઈસ્ટ દેશોમાં નિકાસ થાય છે.

ગુજરાત રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૮૯ લાખ હેક્ટર છે, જે પૈકી ૮૮.૦૧ લાખ હેક્ટર જમીન વાવેતર હેઠળ છે. વાવેતર ધનિષ્ઠના ૧૩૦%

ગુજરાત સરકાર દ્વારા એક વર્ષ સુધી નીતિ બનાવવા માથમણા, ચર્ચા અને બેઠકો કર્યા બાદ સને મે-૨૦૧૫ માં ગુજરાત સેન્ટ્રિય બેતી નીતિ-૨૦૧૫ જાહેર કરી. ભારત દેશમાં આઈ રાજ્યો જેવા કે કેરળ, આધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, મિજોરામ, મધ્ય પ્રદેશ અને નાગાલેન્ડ પદ્ધી ગુજરાત સજીવ બેતી નીતિ જાહેર કરનાર નવમું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સજીવ બેતીના પ્રોત્સાહન માટે ૧૦ કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

સાથે કુલ પાક વાવેતર વિસ્તાર ૧૨૮ લાખ હેક્ટર છે. ખેડાણલાયક વિસ્તારનો ૪૩% ભાગ પિયતની સુવિધા ધરાવે છે. કુલ જમીન ખાતેદારો ૪૭.૩૮ લાખ છે જે પૈકી મોટા ભાગના ખેડૂતો નાના અને સીમાંત છે. ખાતેદારો સરેરાશ ૨.૧૧ હેક્ટર જમીન ધરાવે છે. સેન્ટ્રિય બેતીના પ્રોત્સાહન માટે રાસાયણિક ખાતરનો વપરાશવાળા વિસ્તારો જેવા કે સૂકી-વરસાદ આધારીત બેતી / દુંગરાળ વિસ્તાર જે વાવેતર વિસ્તારોને ૫૭% હિસ્સો છે તેની મહત્વની ભૂમિકા છે.

આમ વિચારીએ તો રાજ્યનો પૂર્વ ભાગ જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે તેનો મહદુદ ભાગ સેન્ટ્રિય બેતી માટેનો સૌથી યોગ્ય વિસ્તાર છે કારણ કે ત્યાંના ખેડૂતોની આર્થિક સામાજિક સ્થિતિ અને પાક વાવેતરની પરંપરાગત પદ્ધતિ એવી છે કે ત્યાં સહજ રીતે કૃષિ રસાયણોનો ઉપયોગ નહિંવત થાય છે.

રાજ્યની વિવિધ પ્રકારની હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યને ૮ કૃષિ હવામાન વિસ્તારમાં વહેંચવામાં આવેલ છે,

એમાં અનેકવિધ પાકો ઉગાડવાની તક રહેલ છે. પાકોની માહિતી નીચે મુજબ છે જે ખેડૂતો માટે આ બાબતને લક્ષ્યમાં લેતાં સેન્દ્રિય ખેતી માટે શક્ય દિશાસૂચક બની રહેશે.

ક્રમ	કૃષિ હવામાન વિભાગ	જમીનનો પ્રકાર અને વરસાદનું પ્રમાણ	સેન્દ્રિય ખેતી માટે યોગ્ય પાક
૧	દક્ષિણ ગુજરાત (ભારે વરસાદ)	ઉંડી કાળી, પથરાળ, હુંગરાળ, ઢોળાવવાળી જમીન > ૧૫૦૦ મિ.મી	જુવાર, નાગલી, બાવટો, દૂધી, હળદર, આદુ, કાજુ, સીતાફળ
૨	દક્ષિણ ગુજરાત	ઉંડી કાળી, કાંપવાળી (૧૦૦૦-૧૫૦૦ મિ.મી)	જુવાર, શાકભાજી, કઠોળ, કેરી, કેળા
૩	મધ્ય ગુજરાત	કાળી, મધ્યમ બેસર, ગોરાહુ (૮૦૦-૧૦૦૦ મિ.મી)	રાજગરો, કઠોળ, સોયાબીન, કપાસ, સીતાફળ, પપૈયા, શાકભાજી
૪	ઉત્તર ગુજરાત	રેતાળુ, ગોરાહુ થી રેતાળ (૬૨૫-૮૭૫ મિ.મી)	બાજરી, રાજગરો, મગફળી, શાકભાજી, મરચા, ધાણા, મેથી, જરૂ, ઈસબગુલ, પપૈયા, દાડમ, બોર, આમળા
૫	દક્ષિણ સૌરાષ્ટ્ર	છીછરી, મધ્યમ કાળી, ચૂનખડ જમીન (૬૨૫-૭૫૦ મિ.મી)	બાજરી, મગફળી, કઠોળ, તલ, મરચા, ધાણા, લસણ, હુંગળી, કેરી, સીતાફળ
૬	ઉત્તર સૌરાષ્ટ્ર	છીછરી મધ્યમ કાળી (૪૦૦-૭૦૦ મિ.મી)	બાજરી, કપાસ, મગફળી, મરચા, લસણ, ધાણા, જરૂ, દાડમ, પપૈયા, બોર
૭	ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર	રેતાળ અને કારીય (૨૫૦-૫૦૦ મિ.મી)	બાજરી, દિવેલા, ગુવાર, જરૂ, ખજૂર, દાડમ
૮	ભાલ દરિયાકાંઠો	દરિયા કાંઠાની ગોરાહુ મધ્યમકાળી ઓછા નિતારવાળી કારીય (૬૨૫-૧૦૦૦ મિ.મી)	કપાસ દેશી, ભાલીયા ઘઉં, ચણા, કસુંબી, જરૂ, સુવા

આ નીતિ કૃષિ પેદાશની ઉત્પાદન પ્રક્રિયા, પ્રસંસ્કરણ - સંગ્રહ અને વેચાણ વ્યવસ્થા માટે વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત સેન્દ્રિય ખેતીના કૃષિ કાર્યોને ટેકો આપશે. સેન્દ્રિય ખેતીના લાભાર્થી પ્રાકૃતિક ખોતોના ઉપયોગને તાંત્રિક રીતે મજબૂત આર્થિક રીતે પોષણાક્ષમ પર્યાવરણનું જતન કરનારા અને સામાજિક દાખિએ સ્વીકાર્ય વ્યવસ્થાને કેન્દ્રમાં રાકશે. આ નીતિ ખેતી માટે શક્યતા ધરાવતા પાક અને વિસ્તારોને ખેતી માટે શક્યતા ધરાવતા પાક અને વિસ્તારોને સેન્દ્રિય ખેતીમાં પરિવર્તિત કરવા, જમીનની ફળદૂપતાને પોષવા, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા, ઉદ્યોગોના વિકેન્દ્રિકરણ થકી ખેતપેદાશોનું મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માંગે છે. આ નીતિ ખાસ લક્ષ્યાંકન વિસ્તારોને વિશેષ રીતે તૈયાર કરેલ વ્યૂહરચના થકી ‘ઓછુ કમાવી આપતી’ ખેત પેદાશોને વધુ માંગવાળી ‘ઊંચા ભાવની પ્રાન્દ’ માં રૂપાંતર કરવા માટે સેન્દ્રિય

ખેતી માટે શક્યતા ધરાવતા પાક અને વિસ્તારોને સેન્દ્રિય ખેતીમાં પરિવર્તિત કરવા, જમીનની ફળદૂપતાને પોષવા, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા, ઉદ્યોગોના વિકેન્દ્રિકરણ થકી ખેતપેદાશોનું મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માંગે છે. આ નીતિ ખાસ લક્ષ્યાંકન વિસ્તારોને વિશેષ રીતે તૈયાર કરેલ વ્યૂહરચના થકી ‘ઓછુ કમાવી આપતી’ ખેત પેદાશોને વધુ માંગવાળી ‘ઊંચા ભાવની પ્રાન્દ’ માં રૂપાંતર કરવા માટે સેન્દ્રિય

ખેતીપેદાશોની મૂલ્ય સાંકળનો પ્રસ્તાવ મૂકે છે. આ બેઝ લાઈનની સરખામણીમાં આગામી પાંચ વર્ષમાં સેન્ટ્રિય ખેતી હેઠળના વિસ્તારમાં કમશઃ ૧૦ ગજો વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે.

સેન્ટ્રિય કૃષિ નીતિના ઉદ્દેશો :

- ખેત વ્યવસ્થાતંત્રમાં સૂક્ષ્મ જીવો, જમીન અંદરની સજીવ સૂચિને સક્રિય કરીને જૈવિક ચક્કોને સમૃદ્ધ બનાવી જમીનની ફળદુપતાનું જતન કરવું.
- સેન્ટ્રિય ખેતી માટે યોગ્ય પાકો અને વિસ્તારોને ઓળખવા.
- સેન્ટ્રિય ખેતી માટે ખેતીકાર્યોના પેકેજનો વિકાસ કરવો.
- સેન્ટ્રિય ખેતી માટે બીજ મેળવવા આદર્શ સેન્ટ્રિય ખેતર / વાડી તૈયાર કરવા.
- ગુણવત્તા સભર સેન્ટ્રિય ખેત સામગ્રીના ઉત્પાદન અને પૂરવઠાની ખાતરી આપવી.
- નીંદણ-કીટક-રોગ નિયંત્રણ માટે જૈવિક અને યાંત્રિક રીતો સ્વીકાર્ય બનાવવી.
- સેન્ટ્રિય ખેતી માટે પરંપરાગત અને કોઠાસૂઝ સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો.
- સેન્ટ્રિય ખેતી માટે તાલીમ કાર્યક્રમો-જાગૃતતા-નિર્દર્શન-મોડલ ફાર્મ દ્વારા માનવશક્તિનો વિકાસ કરવો.
- ગુણવત્તા સભર ખેતપેદાશો થકી ખેડૂતની આવક વધારવી.
- વિવિધ સેન્ટ્રિય ખેતસમાગ્રી-ખેતપેદાશોની નિયમન વ્યવસ્થા ઊભી કરવી.

- જૂથ પ્રમાણનને પ્રોત્સાહન આપવું.

ખેતર / વાડીના નિવસનતંત્રનું વ્યવસ્થાપન :

સફળ સેન્ટ્રિય ખેતી માટે નિવસનતંત્ર (ઇકોલોજી-Ecology)ની દાખિએ સંતુલિત ફાર્મમાં સ્થાનિક વિસ્તારને અનુરૂપ વાનરૂપતિક જતોને સ્થાપવી એ ચાવી રૂપ બાબત છે. ખેતર / વાડીમાં થતા હોય તેવા-પશુચારા-ઈમારતી લાકું - જૈવ જથ્થાની માંગને પહોંચી વળવા ઉપરાંત પક્ષીઓ, મિત્ર કીટકોને રહેઠાણ માટે વિવિધ વૃક્ષોનું વાવેતર મહત્વનું છે. મિશ્રપાક પદ્ધતિ, કૃષિવાનિકી, મધમાખી પાલન, જીવંતવાડ, જળવિસ્તાર, શેઢે પાળે વૃક્ષનું વાવેતર, સજીવોના રહેઠાણને મહત્વ આપવામાં આવશે.

જમીન પોષણ વ્યવસ્થાપન :

- જમીનની ફળદુપતા જીવી રાખવા માટે આ નીતિ પાકની ફેરબદલી અને સેન્ટ્રિય ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
- જમીનમાં કાર્બન તત્વના સંરક્ષણ અને સંવર્ધન માટે છાણિયુ ખાતર, પોલ્ટ્રી ખાતર, શહેરી કમ્પોસ્ટ, ગ્રામીણ કમ્પોસ્ટ, બાયોગેસ રબડી, વર્મિકમ્પોસ્ટ, એન્જાયમ બેઈજ કોમ્પોસ્ટ જેવા સેન્ટ્રિય ખાતરોના પૂરવઠાની ખાતરી માટે પ્રયત્નો કરવામાં આવશે.
- આ નીતિ પાકના અવશેષના પુનઃચીકરણ અને જમીનમાં તેનો ઉમેરો થાય તે બાબતે પ્રોત્સાહન આપશે. લીલો પડવાશ, પાક અવશેષોના ટુકડા કરનાર યંત્રો, કઠોળ વર્ગના આંતરપાક, જૈવિક ખાતરનો ઉપયોગ તેમજ જમીન-જળનું સંરક્ષણ થાય તે માટે ભાર મુકવામાં આવશે.

- વાતાવરણમાંથી તત્વ રૂપ નાઈટ્રોજનને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવનાર બેકટેરીયા, રાઈઝોબિયમ, એઝેટોબેક્ટર, વામ, બલ્યુ ગ્રીન આદ્વી, અઝોલા જેવા જૈવિક ખાતરોનું માટા પાયે ઉત્પાદન કરવા પ્રોત્સાહન અપાશે. આ માટે ખેડૂતના જૂથો-સંસ્થાઓ-જહેર ક્ષેત્રની સંસ્થાઓ-ઉદ્યોગસાહસિકોને બાયોડાયનેમિક - પદાર્થો - પ્રવાહી - છંટકાવ - દરિયાઈ શેવાળના ચક્કના ઉપયોગને વધારવા ઉત્પાદન કરાતી પ્રયોગશાળા એકમોને ટેકો પુરો પાડશે.
- પંચગય, અમૃતમાટી, જીવામૃત, બીજામૃત, ગોવંશઆધારીત ખેતી, સંકલિત જૈવ પોષણ વ્યવસ્થાપનને પ્રોત્સાહન અપાશે.
- સેન્દ્રિય ખેતી માટે યોગ્ય એવા બીજની ઓળખ-સંરક્ષણ-સંશોધન અને સંવર્ધન ઉપર ભાર મુકવામાં આવશે. આ માટે કૃષિ યુનિવર્સિટી, પ્રમાણન એજન્સી અને બીજ વિકાસ નિગમને જવાબદારી સોપવામાં આવશે. બીજની પરંપરાગત સ્થાનિક જાતો, ખેડૂત પરિવારોએ સાચવેલ જાતો, જર્મિલાજમને ખેડૂતના ખેતરે અને સંશોધન કેન્દ્ર પર જરૂરી સંરક્ષણ સંવર્ધન માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
- ગ્રામ્ય વિસ્તારોમાં ઊર્જા સલામતી હાંસલ કરવા સૂર્ય અને જૈવ જથ્થા ઊર્જના બિન પરંપરાગત અને વૈકલ્પિક સ્વોતો મહત્વની ભૂમિકા ધરાવી શકે તેમ છે. આ અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ યોજનાનો સંપાત-હેઠળ-પગભર એકમો શરૂ કરવા ખેડૂતો, પાંજરાપોળ, ગૌશાળા, ખેત ઉત્પાદન બજાર સમિતિ, ખેડૂત સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
- રોગ-જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત જંતુનાશક દવાઓ, પરજીવી અને પરભક્ષીઓ ઉછેર તથા વિતરણ માટે પ્રમાણપત્ર અપાય તેવા તાલિમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.
- સેન્દ્રિય ખેતીનું પ્રમાણપત્ર મેળવવા ત્રણ વર્ષનો સમયગાળો જોઈએ જે દરમ્યાન ઉત્પાદનમાં ઘટાડો થાય, આર્થિક રીતે ટકાવવા માટે આ સમય દરમ્યાન ઓછા વાજવાળી અને લાંબા ગાળે ભરપાઈ કરી શકે તેવી કૃષિ લોન ખેડૂતોને આપવાનું નક્કી કરેલ છે.
- ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો અને આવક વધારવા સેન્દ્રિય ખેતી વધુ અસરકારક તક પુરી પાડે છે. સેન્દ્રિય ખેતી ટકાઉ ખેતી છે અને સ્થાનિક રીતે પ્રાપ્ય ખેતી-સામગ્રી ઉપર આધાર રાખે છે. આ નીતિ સેન્દ્રિય ખાતરો, કમ્પોસ્ટ, વર્મિકમ્પોસ્ટ, અન્જાયમ બેઈજ કમ્પોસ્ટ વગેરે ખેડૂતો, સ્વસહાય જૂથો, સખી મંડળ દ્વારા ઉત્પાદન થાય તેને ઉત્તેજન અપાશે. ખેત સામગ્રી ગુણવત્તા, નિયંત્રણ તેમજ સગવડ ગુણવત્તા નિયંત્રણમાં કચાશ રહેવાથી અનૈતિક તત્વો - વિવિધ રીતે ગરીબ ખેડૂતોને છેતરવાની તક જડપે છે. આ નીતિ આ બાબતે ખાતરી આપે છે કે પોતાના નેજા હેઠળની તમામ સેન્દ્રિય ખેત સામગ્રીને આવરી લેતી વૈજ્ઞાનિક વ્યવસ્થા અને કાયદેસરનો ઢાંચો અમલમાં મુકાશે. સંશોધન માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, સેન્દ્રિય ખેતી સંબંધી સર્વાંગી સંશોધનો હાથ ધરવામાં આવશે. સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોની માહિતી, વિસ્તાર, પાક, ઉત્પાદન, વેચાણ, નિકાસ, આંકડા, જૈવ, ખેતસામગ્રીના ઉત્પાદનો અને વિતરકો, સ્વૈચ્છિક અને બિનસરકારી સંસ્થાઓ,

- ખેતપેદાશોના ખરીદનારા, વેચાણ કરનાર, સંશોધન પ્રોજેક્ટ્સ, તાલીમ સંસ્થાઓ, ખેત પદ્ધતિઓ, આર્થિક સહાય યોજનાઓની માહિતી એકટી કરવા, અપડેટ કરવા ટેટાબેઝ વ્યવસ્થા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
- સરકાર આ નીતિ અંતર્ગત ગુજરાતમાં સજ્જવ ખેતીનો વ્યાપ વધે તે માટે અનેકવિધ પગલાંઓ ભરશે જેમાં કેટલાક કાર્યક્રમ અને પગલાંઓ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સેન્દ્રિય ખાતરોનું ઉત્પાદન, તપાસણી અને ગુણવત્તા નિયંત્રણ કરશે. સજ્જવ ખેતીના ઉત્પાદન અને ખેતીની પેદાશોના વિતરણ માટે ગ્રામ્યુવક, મહિલા મંડળ, આદિવાસીઓ, ખેડૂત જૂથ, સ્વસહાય જૂથોને વિશેષ પ્રોત્સાહન અને સહાય અપાશે.
 - સજ્જવ ખેતીના લાભનો અભ્યાસ અને તેમાં દસ્તાવેજુકરણ માટે ટેટાબેઝ તૈયાર કરાશે. ખેડૂત ગ્રાહક જાગૃતતાના કાર્યક્રમો આઈ-કિસાન પોર્ટલ સાથે સાંકળવામાં આવશે. સજ્જવ ખેતી શરૂ કરનારા ખેડૂતોને બધલવાના (ટ્રાન્ઝિશન પીરિયડ) દરમ્યાન મદદ માટે આર્થિક મહિલાઓના જૂથોને પ્રોત્સાહન અપાશે. હાલમાં ગુજરાત ઓર્ગેનિક્સ પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી આ પ્રમાણન ક્ષેત્રે કામગીરી કરી રહી છે. નાના સીમાંત ખેડૂતો પ્રમાણનથી વંચિત ના રહે તેવી યોજનાઓ ઘડવામાં આવશે. સજ્જવ ખેતીની પેદાશનું બ્રાન્ડિંગ કરી ગુજરાત ઓર્ગેનિક, ગરવી ગુજરાત અને ઓર્ગેનિક ગુજરાત જેવી બ્રાન્ડ સાથે વેચવામાં આવશે. નિકાસની સાથે સ્થાનિક બજાર પણ ઊભુ કરવામાં આવશે. આ ઉપરાંત સજ્જવ ખેતી કરતાં બાયો વિલેજ (સજ્જવ ગ્રામ) ઊભા કરી એગ્રો-ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.
- વિશેષ :** આણંદ કૃષિ યુનિવર્સિટી, બં.આ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ ખાતે છેલ્લા ચાર વર્ષથી (૨૦૧૦-૧૧) ઓર્ગેનિક ફાર્મિંગ ટ્રેનિંગ કોર્સનું ૫ થી ૧૦ દિવસના સમયગાળા માટે આયોજન કરવામાં આવે છે જેમાં સજ્જવ ખેતીના સંદર્ભે તમામ સૈધ્યાતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે, અત્યાર સુધીમાં ૧૨૦૦ કરતાં વધુ ખેડૂતોએ આ ટ્રેનિંગ મેળવેલ છે અને તેના ફોલો અપ કાર્યક્રમ સર્વેક્ષણની કામગીરી પણ શરૂ કરેલ છે, જેથી ખેડૂતો દ્વારા પ્રત્યક્ષ રીતે પોતાના ફાર્મ પર સજ્જવ ખેતીના આયામોનો ઉપયોગ કરવાથી જમીન ઉત્પાદન-આર્થિક સ્થિતિમાં થયેલ ફેરફાર નોંધપાત્ર જણાયેલ છે.

ખેડૂતો માટે રવી કૃષિ મહોત્સવ

ગુજરાત સરકાર દ્વારા રવી કૃષિ દરમ્યાન ખેડૂતોને રવી પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી રહે તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુથી તા. ૩૧-૧૨-૨૦૧૫ થી તા. ૦૪-૦૧-૨૦૧૬ દરમ્યાન રવી કૃષિ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે. જે દરમ્યાન ગુજરાતના તમામ તાલુકા દીઠ એક રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સદર કાર્યક્રમમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતમિત્રોને રૂબરૂમાં તથા વાતર્લાપ દ્વારા કૃષિ તથા તેને સંલગ્ન વિષયોની તાંત્રિક માહિતી અને માર્ગદર્શન આપનાર છે. તો સર્વે ખેડૂતોએ તેનો લાભ લેવા વિનંતી.

નોંધ : તાલુકા દીઠ રવી કૃષિ મહોત્સવના સ્થળ અને તારીખની વિગત જે તે જલ્લાના જલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક સાધતાં મળી રહેશે.

પાક ઉત્પાદનમાં પિયતની અગત્યતા

શ્રી જે. એચ. ચૌધરી શ્રી એસ. એ. ચૌહાણ શ્રી એમ. એમ. ચૌધરી
 નર્મદા પિયત સંશોધન યોજના, આંણં કૃષી યુનિવર્સિટી
 ખાંધા જિ. વડોદરા પિન : ઉલ્લાસ
 ફોન : (૦૨૬૬૬) ૨૨૦૨૭૮



પિયત/સિંચાઈ એટલે શું ?

પાકની સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂર જળાય ત્યારે પાણી આપવાની પ્રક્રિયાને પિયત અથવા સિંચાઈ કહેવાય છે.

કુલા, તળાવ, નદી, જરણા, આડબંધ, નહેર એ સિંચાઈના પ્રાણિ સ્થાન છે.

પિયત માટે જમીનની પસંદગી :

જમીનની પ્રત અને પોત મુજબ પિયતની જરૂરિયાત બદલાય છે. કમાંડ વિસ્તારમાં બિન વૈક્ષાનિક દ્વારે પિયત કરવાથી કારિયતા અને જળમંજૂનતાના પ્રશ્નો ઉદ્ભવે છે. આથી સિંચાઈની કોઈપણ યોજના શરૂ કરતા પહેલાં જમીનનો અભ્યાસ કરી પિયતની અનુકૂળતા તપાસવી જોઈએ જે માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

(૧) જમીનનો ટાળ પડાણ:

જમીનની ઉપલી સપાટી ઊંચી-નીચી, ખાડા ટેકરા કે ઢાળવાળી હોય તો પાણીનો દુર્બ્યય થાય છે અને ખેતરમાં પાકને એકસરખુ પાણી આપી શકતું નથી પાણીના વહેણ પર કાબૂ રાખી શકતો નથી. જેથી જમીનનું ધોવાણ થાય છે. વધુમાં જમીનના ઊંચાણવાળા ભાગમાં પાકને પૂરતું પાણી નહી નળવાથી તેમજ નીચાણવાળા ભાગમાં પાણી વધુ પ્રમાણમાં એકત્રિત થવાથી પાકની

વૃદ્ધિ સંતોષકારક થતી નથી. આથી પિયત ખેતી માટેની જમીન સમતળ હોવી જોઈએ.

(૨) જમીનની ઊંડાઈ, પોત અને રચના :

સામાન્ય રીતે સિંચાઈ માટેની જમીનની ઊંડાઈ બે થી ત્રણ મીટર હોવી આવશ્યક છે. જમીનની ઊંડાઈ આટલી હોય તો જમીનને સમતળ બનાવી પિયત કરવું અનુકૂળ પડે છે. જમીન હલકી કે છીછરી હોય તો તેમાં પૂરતા પ્રમાણમાં લાંબો સમય સુધી બેજ ટકી શકતો નથી. આથી વારંવાર પિયત કરવું પડે છે જેથી પાણીનો દુર્બ્યય થાય છે અને ખર્ચ વધી જાય છે. બહુ ભારે જમીનમાં લાંબો સમય પાણી ભરાઈ રહે છે આથી જમીનમાં હવા અને પાણી વચ્ચેનું પ્રમાણ જળવાતું નથી.

: પિયતનું મહત્વ :

- પિયત પાકને યોગ્ય સમયગાળા દરમ્યાન પાણીની ખેંચ દૂર કરે છે. ● વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભુ કરે છે. ● વધુ પાક ઉત્પાદન મળવાથી આવક પણ વધે છે. ● પાકની સફળતાની ખાતરી મળે છે. ● ગરમ હવામાન તેજમ ઠડા પવનોની અસર ઓછી થાય છે. ● એક જ ખેતરમાં વર્ષ દરમ્યાન એક મરતા વધુ પાક લઈ શકાય છે. ● જમીનની કિંમત પણ વધે છે. ● વર્ષ દરમ્યાન પૂરતું કામ મળી રહે છે. ● રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે.

ત્રણ જમીનમાં જો સખત પડ કે ભારે ચીકણી માટીનું પડ હોય તો આવી જમીન પિયતની ખેતી માટે યોગ્ય ગણતાની નથી કારણ કે આવી જમીનનો નિતાર નબળો હોય છે જેથી પાણીની સપાટી ઊંચી આવે છે અને જમીન ક્ષારયુક્ત બને છે.

(૩) જમીનની ફળદુપતા :

જેમ જમીનની ફળદુપતા ઊંચી તેમ એકમ દીઠ પાણીના વપરાશથી થતું ઉત્પાદન વધુ હોય છે. આથી પિયત માટ સારી ફળદુપ જમીનને પ્રથમ પસંદગી આપવામાં આવે છે.

(૪) પિયત જમીનની ગુણવત્તા :

પિયતની જમીન કેટલે દરજજે ઉંચી કે નીચી કક્ષાની છે તે જાણવા માટે ખાસ કરીને આવી જમીન માટે પ્રથમ એક મીટરની ઊંડાઈમાં પ્રાપ્ત બેજનો જથ્થો, પાકના મૂળ વિસ્તારની જમીનની નિતારશક્તિ, જમીનના પાણીની સપાટીની ઊંડાઈ, મૂળ વિસ્તારમાં દ્રાવ્ય કારો અને વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ વગેરે બાબતોનો અભ્યાસ કરી તે દરેકની મર્યાદા નક્કી કરવામાં આવે છે. જેની વિગત પિયત માટે જમીનની ગુણવત્તા નક્કી કરવા

માટેના કોઠામાં દર્શાવવામાં આવી છે.

સામાન્ય રીતે જમીનની કક્ષા કયા પ્રકારની છે તેના નિર્ણય માટે સંબંધિત પાયેય ઘટકોના જુદા જુદા ગુણોનો ગુણાકાર કરી જે ગુણનફળ આવે તે પરથી જમીનનું છેવટનું વર્ગિકરણ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ પછી તે જમીન માટે યોગ્ય પિયત પાક અને જમીન વ્યવસ્થાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી પિયતની જમીન પર થતી માઠી અસર નિવારી, લાંબા સમય સુધી સંતોષકારક પાક ઉત્પાદન મેળવી શકાય છે.

પિયત માટે જમીનની ગુણવત્તા માટેના ઘટક અને તેમની મર્યાદા

ગુણવત્તા	પ્રથમ એક મીટરની ઊંડાઈમાં પ્રાપ્ત બેજનો જથ્થો		પાકના મૂળ વિસ્તારની જમીનની નિતારશક્તિ		જમીનની પાણીની સપાટીની ઊંડાઈ		મૂળ વિસ્તારમાં વધુમાં વધુ કારો		મૂળ વિસ્તારમાં વધુમાં વધુ વિનિમય પામતું સોડિયમ	
	મિ. મી.	ગુણ	મિ. મી/કલાક	ગુણ	મીટર	ગુણ	ટકા	ગુણ	ટકા	ગુણ
ઉત્તમ	>૧૭૫	૩	૧૫-૨૫	૩	ક્રાયમ ન્રાણ મીટરથી વધુ ઊંડાઈએ	૩	<૦.૨૦	૩	<૫	૩
સારી	૧૦૦-૧૭૫	૨	૨૫-૫૦	૨	ક્રાયમ બે મીટરથી વધુ ઊંડાઈએ	૨	૦.૨૦-૦.૩૦	૨	૫-૧૦	૨
મધ્યમ	૨૫-૧૦૦	૧	૫૦-૧૨૫	૧	એક મીટરથી વધુ ઊંડાઈએ	૧	૦.૩૦-૦.૪૦	૧	૧૦-૧૫	૧
નબળી	<૨૫	૦	< ૫ અથવા >૧૨૫	૦	એક મીટરની અંદર	૦	>૦.૫૦	૧	>૧૫	૦

પિયતની જમીનનું વર્ગિકરણ

જમીનનો વર્ગ	વિગત	ગુણનફળનો આંક
૧	ઉત્તમ	૮૦ કરતા વધુ
૨	સારી	૫૦-૮૦
૩	મધ્યમ	૧૬-૪૮
૪	નબળી	૨-૧૫
૫	અયોગ્ય	૦-૧

સિંચાઈના પાણીની ગુણવત્તા :

સિંચાઈના પાણીનો ઉપયોગ કરતા પહેલા તે પાક ઉત્પાદન માટે યોગ્ય છે કે નહિ તે નક્કી કરવું

જરૂરી છે. અયોગ્ય પાણીની વપરાશની ખરાબ અસર ફક્ત પાક પર જાણાય છે એટલું જ નહિ પરંતુ લાંબે ગાળો પાક ઉત્પાદન માટે જમીન પણ તદ્દન નકામી બની જાય છે. પાણીની યોગ્યતા નક્કી કરવા નીચે દર્શાવેલ ઘટકો ધ્યાનમાં લેવામાં આવે છે.

(ક) કુલ દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ : પાણીમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ જો વિશેષ હોય તો જમીનમાં ભેજ પૂરતો હોવા છતાં પણ પાકના મૂળ તેની જરૂરિયાત સુઝાય પાણી ચૂસી શકતાં નથી અને પાકને પાણીની બેંચ વર્તાય છે. આ સ્થિતિમાં પાકની સંતોષકારક વધુ થવા માટે બે પાણી વચ્ચેનો ગાળો ખૂબ ટૂંકો રાખવો પડે છે. વધુમાં

મૂળ વિસ્તારમાં કારનું પ્રમાણ ઓછું રાખવા દર પાણીએ જરૂરિયાત કરતા વધુ પાણી આપવું પડે છે.

સિંચાઈના પાણીમાં કલોરાઇડ, સલેક્ટ અને બાયકાર્બોનેટ એ મુખ્ય ગ્રણ આયનો હોય છે જ્યારે કેલ્લિયમ, મેનેશિયમ અને સોડિયમ અ મુખ્ય ઘન આયનો છે. કાર્બોનેટ પોટેશિયમ અને નાઈટ્રોટ આયન પણ સિંચાઈના પાણીમાં ઓછા પ્રમાણમાં રહેલા હોય છે. આ ઉપરાંત કેટલાક સિંચાઈના પાણીમાં ખાસ કરીને ભૂગર્ભ જળ સ્વોતોમાં બોરોન આયન પણ રહેલો હોય છે. પાણીમાં કુલ કારનું પ્રમાણ કેટલું છે તેનું વિદ્યુતવહનશક્તિ (૨૫૦૮૦) ના માપથી જાણી શકાય છે. જો પાણીની વિદ્યુતશક્તિ ૭૫૦ માઈકોમોઝ (લગભગ ૦.૦૫ ટકા કાર) સુધી હોય તો તે પાણી કોઈપણ પાક અને જમીન માટે સહેલાઈથી વાપરી શકાય છે. જો આ પ્રમાણ ૭૫૦ થી ૨૨૫૦ માઈકોમોઝ સુધી હોય તો તે જમીનની જાત પ્રમાણે અને કાર સહન કરી શકે તેવા પાક માટે કાળજીપૂર્વક આ પાણીને વાપરી શકાય પરંતુ જો વિદ્યુતવહનશક્તિ ૨૨૫૦ માઈકોમોઝ (લગભગ ૦.૧૫ ટકા કાર) કરતાં વિશેષ હોય તો ખાસ સંજોગો સિવાય આવા પાણીનો ઉપયોગ ખેતી માટે કરવો તે હિતાવહ નથી. પાણીની વિદ્યુતવહનશક્તિના આધારે સિંચાઈના પાણીનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે.

ક્રમ	વિદ્યુતવહનશક્તિ (માઈકોમોઝ/સે. મી.)	પાણીની કક્ષા
૧	૨૫૦ કરતા ઓછી	ઉત્તમ
૨	૨૫૦-૭૫૦	સારુ
૩	૭૫૦-૨૨૫૦	મધ્યમ
૪	૨૨૫૦ કરતા વધારે	કનિષ્ઠ

(ખ) અન્ય ઘન આયનો સાથે સોડિયમનું પ્રમાણ : સિંચાઈના પાણીમાં વધારે પડતાં સોડિયમના પ્રમાણથી પાક તેમજ જમીન પર માઠી અસર પડે છે. સોડિયમ કારના મૂળ ઉપર સીધી રીતે ઝેરી અસર પેદા કરે છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગાડે છે જેમ કે નિતારશક્તિ,

જમીન ઉપરના પડમાં પોપડી જામી જવી, ઢેઝાં અને જમીન સખત થઈ જવી વગેરે. આમ થવાથી જમીનમાં હવા અને પાણીનો સંબંધ છોડ માટે પ્રતિકૂળ બને છે. સિંચાઈના પાણીમાં સોડિયમ પ્રતિકૂળતા જાણવા માટે સોડિયમ અવશેષજી ગુણોત્તર (સો.અ.ગુ.) જાણવો જરૂરી છે જે વડે કેલ્લિયમ અને મેનેશિયમની સરખામણીમાં સોડિયમનું પ્રમાણ કેટલું છે તે નીચેના સૂત્રથી જાણી શકાય છે.

સો.અ.ગુ.	સોડિયમ	કેલ્લિયમ+મેનેશિયમ	મિલિતુલ્યાંક/લિટર
૨			

સૂત્રમાં દરેક ઘન આયન લિટર દીઠ કેટલાક મિલિતુલ્યાંક છે તે પ્રમાણે ગણવું. આ આંકના આધારે સિંચાઈનું પાણી કઈ કક્ષાનું છે તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે.

ક્રમ	સો.અ.ગુ.	સિંચાઈના પાણીની કક્ષા
૧	૦-૧૦	ઉત્તમ
૨	૧૦-૧૮	સારુ
૩	૧૮-૨૬	મધ્યમ
૪	૨૬ થી વધારે	કનિષ્ઠ

આમ, સિંચાઈના પાણીની ગુણવતા કુલ દ્રાવ્ય તેમજ સો.અ.ગુ. ના આંક એમ બે જુદી જુદી બાબતો જાણી શકાય છે.

(ગ) બોરોનનું પ્રમાણ : બોરોન ધાતુ દરેક પાકને જરૂરી છે પરંતુ સિંચાઈના પાણીમાં તેનું વધુ પડતું પ્રમાણ પાકને હાનિકર્તા છે. બોરોનના પ્રમાણને અનુલક્ષીને સિંચાઈના પાણીનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે.

ક્રમ	બોરોનનું પ્રમાણ ભાગ/દસ લાખ ભાગ (પી.પી.એમ.)	સિંચાઈના પાણીની કક્ષા
૧	૦.૩-૧	ઉત્તમ
૨	૧-૨	સારુ
૩	૨-૪	મધ્યમ
૪	૪ કરતાં વધારે	કનિષ્ઠ

(૪) અવશેષક કાર્બોનેટ : સિંચાઈના પાણીમાં કાર્બોનેટ અને બાયોકાર્બોનેટમાંથી કેલ્ખિયમ અને મેગનેશિયમ (મિલિતુલ્યાંક લિટરે) બાદ કરતા કે આંક આવે તેને અવશેષક કાર્બોનેટ કહેવામાં આવે છે. અવશેષક કાર્બોનેટને આધારે સિંચાઈના પાણીનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે.

	કાર્બોનેટનો આંક (મિલિતુલ્યાંક/લિટર)	સિંચાઈના પાણીની કક્ષા
૧	૦-૧.૨	ઉત્તમ
૨	૧.૨૫-૨.૫૦	મધ્યમ
૩	૨.૫૦ કરતા વધારે	કનિષ્ઠ

વધુ પડતા અવશેષક કાર્બોનેટ જમીનને સખત બનાવે છે તેમજ લોહ જેવી ધાતુ જમીનમાં પાક માટે અપ્રાય બને છે.

ઉપરની ચારેય બાબતો ધ્યાનમાં રાખી સિંચાઈનું પાણી એકંદરે ખેતી માટે ઉપયોગી છે કે કેમ તે નક્કી કરવામાં આવે છે.

(૫) પાકને પાણીની જરૂરિયાત :

પાકને પાણીની જરૂરિયાતનો આધાર મુખ્યત્વે કે તે સ્થળની આભોહવા, પાકનો જીવનકાળ, જમીનનો

પ્રકાર, અતુ અને પાકની ખાસિયત આધાર રાખે છે. બે પાણી વચ્ચેનો ગાળો અને દરેક પિયત વખતે કેટલું પાણી આપવું તે જમીનમાંથી પાક માટે ગ્રાસ ભેજનો મળતો જથ્થો, પાકની મૂળની ઊર્ડાઈ અને જમીનની ભેજ બેચવાની પાકની શક્તિ પરથી જાણી શકાય છે. પાકની એક જ જાત બે જુદી જુદી જાતની જમીન પર સરખા હવામાનમાં ઉછેરવામાં આવે તો પણ બંને પાકમાં પિયતની સંઘા અને દર પિયતે પાણીનો જથ્થો જુદો જુદો હોઈ શકે. તેવી જ રીતે પાકની એક જાત, એક જ જાતની જમીન પર બે જુદા જુદા હવામાન હેઠળ ઉગાડવામાં આવે તો પણ બસેની પાણીની જરૂરિયાત જુદી જુદી હશે. આ પરથી સમજી શકાય કે દરેક સ્થળ માટે પાકને પાણીની કૂલ જરૂરિયાત, પાણીની સંઘા, બે પિયત વચ્ચેનો ગાળો તેમજ દરેક પિયત વખતે આપવાનો પાણીનો જથ્થો જુદો જુદો હોય છે. આભોહવાની દિષ્ટિઝે ગુજરાત રાજ્યના આઠ જુદા જુદા વિભાગ પાડેલા છે. તે દરેક વિભાગમાં થતાં પાકની જરૂરિયાત નક્કી કરવા માટે વિભાગ દીઠ એક કે તેથી વધુ સિંચાઈ-સંશોધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પરથી તેમજ અન્ય સ્થળોથી મળતી માહિતીના આધારે જુદા જુદા પાકને કેટલા પાણીની જરૂર પડે છે તેની માહિતી કોઈમાં આપવામાં આવી છે.

પાક	વિસ્તાર અને જમીનનો પ્રકાર	પાણીની સંખ્યા	સિંચાઈના પાણીની કુલ જરૂરિયાત (મિ. મી.)	પિયત માટેની કટોકટી અવસ્થા
કપાસ (દેશી)	મધ્ય ગુજરાત (ભાલ અને દરિયાકાંદાના વિસ્તાર) (કાળી)	૨	૨૦૦	- કૂલ અવસ્થા - શરૂઆત જુદાની વિકાસ અવસ્થા
કપાસ (હા-એ)	દક્ષિણ અને મધ્ય ગુજરાત (કાળી)	૪-૫	૨૮૦-૩૫૦	- વાનસ્પતિક વૃક્ષ અવસ્થા - ચાંપવા બેસતી વખતે - કૂલ વઅવસ્થા - શરૂઆત જુદાની વિકાસ અવસ્થા - પાકવાની અવસ્થા
દિવેલા	દક્ષિણ અને મધ્ય ગુજરાત (મધ્યમ કાળી અને કાળી)	૪-૬	૩૨૦-૪૮૦	- વાનસ્પતિક વૃક્ષ અવસ્થા - કૂલ અવસ્થા - માળ બેસવાની અવસ્થા

પાક	વિસ્તાર અને જમીનનો પ્રકાર	પાણીની સંખ્યા	સિંચાઈના પાણીની કુલ જરૂરિયાત (મિ.મી.)	પિચત માટેની કટોકટી અવસ્થા
મેથી	(ઉત્તર અને મધ્ય ગુજરાત (ગોરાડુ)	૫	૪૫૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ આવવાની અવસ્થા - દાણામાં ચક્કર બેસવાની અવસ્થા - દાણાની વિકાસની અવસ્થા
મગફળી (ચોમાસુ) મગફળી (ઉનાળુ) મગફળી (જુઅયુજી-૧)	મધ્ય અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર (ગોરાડુ અને કાળી)	૨ ૮ ૧૨	૧૦૦ ૪૦૦ ૬૦૦	- ફૂલ બેસવાની અવસ્થા - સૂચા બેસવાની અવસ્થા - તોડવા બેસવાની અવસ્થા
રજકો	મધ્ય ગુજરાત (ગોરાડુ અને કાળી)	૧૧	૮૮૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ બેસવાની અવસ્થા
બાજરી (ઉનાળુ)	મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર (ગોરાડુ)	૫-૬ ૧૦	૪૦૦-૪૮૦ ૬૦૦	- ફૂટ અવસ્થા - થૂલ/ફૂલ અવસ્થા - દૂષિયા દાણાની અવસ્થા
જુવાર	દક્ષિણ ગુજરાત (કાળી)	૩	૨૫૫	- શરૂઆતના વૃદ્ધિ તબક્કો - ફૂલ અવસ્થા - દૂષિયા દાણાની અવસ્થા
ઘઉં	મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર (કાળી, ગોરાડુ અને મધ્યમ કાળી)	૭ ૮ ૧૦	૪૨૦-૫૬૦ ૪૮૦ ૫૦૦	- શિખમૂળ અવસ્થા - ફૂટ અવસ્થા - ગાંભે પોટેની અવસ્થા - ફૂલ અવસ્થા - દૂષિયા દાણાની અવસ્થા - પોક અવસ્થા
મકાઈ (શિયાળુ)	મધ્ય ગુજરાત (ગોરાડુ અને મધ્યમ કાળી)	૭	૪૨૦	- બિયારણ ઉગવાની અવસ્થા - વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ચમરી અવસ્થા - દૂષિયા દાણાની અવસ્થા
આદુ	મધ્ય ગુજરાત (ગોરાડુ)	૧૪-૧૬	૭૦૦-૮૦૦	- અંકુરણ અવસ્થા - ફૂટ અવસ્થા - ભૂપ્રકંડ રચના અવસ્થાએ
ફળદર	મધ્ય ગુજરાત (ગોરાડુ)	૧૮-૨૦	૮૦૦-૧૦૦૦	- અંકુરણ અવસ્થા - ફૂટ અવસ્થા - ભૂપ્રકંડ રચના અવસ્થાએ
કોણીજ	મધ્ય ગુજરાત (ગોરાડુ)	૬	૪૮૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - દડા અવસ્થાએ
ટામેટા (શિયાળુ)	મધ્ય ગુજરાત (ગોરાડુ અને મધ્યમકાળી)	૧૧	૬૬૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ અવસ્થા - ફળ વિકાસ અવસ્થા

પાક	વિસ્તાર અને જમીનનો પ્રકાર	પાણીની સંખ્યા	સિંચાઈના પાણીની કુલ જરૂરિયાત (મિ.મી.)	પિચત માટેની કટોકટી અવસ્થા
મરચી	મધ્ય ગુજરાત (ગોરાડુ અને મધ્યમ કાળી)	૭	૫૬૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ અવસ્થા - ફળ વિકાસ અવસ્થા
રોંગણી (શિયાળુ)	દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત (કાળી અને ગોરાડુ)	૭ ૧૨	૬૩૦ ૮૬૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ અવસ્થા - ફળ વિકાસ અવસ્થા
કુંગણી (ઉનાળુ)	ઉત્તર અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત (ગોરાડુ અને કાળી)	૧૦ ૬	૬૦૦ ૩૬૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ અવસ્થા - કંદ અવસ્થા
કેળ (બસરાઈ)	દક્ષિણ ગુજરાત (કાળી)	૨૩	૧૩૮૦	- વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા - ફૂલ અવસ્થા - શરૂઆત લૂમ બેસવાની અવસ્થા
શેરડી	દક્ષિણ અને મધ્ય ગુજરાત (કાળી)	૧૪-૧૬	૧૧૨૦-૧૨૮૦	- પીલા ફૂટવા - મહત્તમ વૃદ્ધિ અવસ્થા

વધુ પડતા સિંચાઈના પાણીથી જમીન પર થતી અસરો:

કોઈપણ પાકને તેમજ કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતાં વિશેષ પ્રમાણમાં પાણી આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે ગેરલાભ વિશેષ થાય છે જે ખ્યાલમાં રાખવું જોઈએ. સિંચાઈના વધારે પડતા પાણીથી થતી મુખ્ય અસરો અત્રે દર્શાવેલ છે.

(૧) જમીનની નિતારશક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાઠી પર તેમજ પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના છિદ્રાવકશમાં હવાનું પ્રમાણ નહિંવત રહે છે પરિણામે છોડને ગ્રાણવાયુ પૂરતો નહિં મળવાથી છોડ નબળા રહે છે અને પાક ઉત્પાદન ઘટે છે.

(૨) જમીનના પાણીનું સ્તર ઊંચુ આવવાથી કેશાકર્ષણ નળીઓ દ્વારા જમીનની નીચેના પડના કાર ઉપરના પડમાં જમા થાય છે અને લાંબા ગાળે જમીન ક્ષારયુક્ત બને છે.

(૩) પાણી વધુ વખત ભરાઈ રહેવાથી જમીન ઢંડી પડી જાય છે. જમીનનું ઉષ્ણતામાન જરૂરિયાત કરતાં ઘણું નીચુ જવાથી છોડનો વિકાસ સંતોષકારક થતો નથી.

(૪) જમીનમાંના ઉપયોગી સૂક્ષ્મ જીવાણુંઓના વિકાસ

માટે પ્રાણવાયુ તેમજ નિયત ઉષ્ણતામાનની જરૂર રહે છે. બિનજરૂરી પાણી ભરાઈ રહેવાથી આ જરૂરિયાત પૂરી પડતી નથી જેથી છોડના વિકાસ પર માઠી અસર પહોંચે છે.

- (૫) જમીન જલદી સૂકાતી નથી જેથી વાવણી, આંતરખેડ, નીંદામણ કાપણી વગેરે ખેતીકામ સમયસર થઈ શકતા નથી.
- (૬) પાકના છોડની સરખામણીમાં નીંદાણના છોડની વૃદ્ધિ વધુ ઝડપથી થાય છે અને નીંદાણનો ઉપદ્રવ વધી જાય છે.
- (૭) સેન્દ્રિય પદાર્થની કોહવાણની કિયા મંદ થઈ જાય છે.
- (૮) છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વોની સમતુલ્ય જમીનમાં જળવાઈ રહેતી નથી.
- (૯) વધારે પડતાં પાણીના નિકાલ સાથે પાકને જરૂરી પોષક તત્વો, ખાતર અને જમીનની ફળફુપ માટે ઘસડાય જાય છે. આમ, જમીનની ફળફુપતા ઘટે છે તેમજ જમીનનું ધોવાણ થાય છે.
- (૧૦) લાંબા ગાળે જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે અને તે ખેતી માટે બિનઉપયોગી બને છે.

સજીવ ખેતી અંગે મનોમંથન જરૂરી છે

ડૉ. ડી. એમ. કોરાટ

સંસ્કોધન નિયામકની કચેરી

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦

ફોન : મો. ૯૬૬૨૪૨૭૭૮૪



ભારત દેશમાં આજાઈ પછીના શરૂઆતના વરસોમાં વધતી જતી માનવ વस્તીને ખોરાકની જરૂરિયાત પુરી પાડવા માટે પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનામાં ‘વધુ અનાજ ઉગાડો’ (Grow more food grain)ની ઝુંબેશ શરૂ કરવામાં આવી. સુધારેલ/સંકર બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક રસાયણો અને પિયતની સુવિધાઓ વધતા હરીયાળી કાંતિ (Green Revolution) સર્જઈ. કૃષિ ક્ષેત્રે વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક રસાયણોના અતિરેકને કારણે જમીન, હવા અને પાણીના પ્રદૂષણમાં ઉત્તોતર વધારો થવા લાગ્યો શરૂઆતમાં રાસાયણિક ખાતરો અને સેન્દ્રિય ખાતરોના ઘોંય સમન્વય કરી ખેતી કરવામાં આવતી હતી. ધીરે ધીરે તેમાં બદલાવ આવ્યો. સેન્દ્રિય ખાતરોનો વપરાશ ઓછો થવા લાગ્યો અને રાસાયણિક ખાતરો પર વધારે આધાર રાખવા માંડ્યો. આમ થતા જમીનની ફળહુપતા ઘટવા માંડી. જમીનની તંદરસ્તી જોખમાઈ અને પાકની ઉત્પાદકતા (Productivity) ઓછી થવા લાગી. તે જ પ્રમાણે પાકમાં નુકસાન કરતા રોગ જીવાતના જંતુનાશક પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેને પરિણામે તેની નકારાત્મક અસરો ધ્યાનમાં આવી.

ઉપરોક્ત બસે સમસ્યાના નિરાકરણ માટે કૃષિમાં ‘સંકલિત પોષણ વ્યવસ્થા’ (Integrated Nutrient Management-INM) અને ‘સંકલિત જીવાત વ્યવસ્થાપન’ (Integrated Pest

Management-IPM)નો અભિગમ અસ્તિત્વમાં આવ્યો. આ અભિગમનો મુખ્ય આશય એ હતો કે ખેતીમાં જ્યાં શક્ય હોય ત્યાં કૃષિ રસાયણોનો ઉપયોગ ઓછો કરી કુદરતી ખોતનો મહત્વમાં ઉપયોગ કરવો. છેલ્લા લગ્નભગ જ્યાં દાયકાથી આ અભિગમ અપનાવવા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. છતાં હજુ સુધી તેનો પુરતો અમલ થયો હોય તેમ જણાતું નથી. હાલના સમયમાં ખેતીને ટકાવી રાખવા માટે આ અભિગમ વિષે વિચારવાની ખાસ જરૂર છે.

ઉપરોક્ત વિચારધારાને હજુ ખેડૂતો પુરેપુરા સમજ શક્યાં નથી અને અપનાવી શક્યા નથી. ત્યાં વળી ‘સજીવ ખેતી’ (Organic Farming)નો પવન ફૂકાયો.

સજીવ ખેતીમાં સાંશ્લેષિક રીતે તૈયાર કરેલ (સિન્થેટિક) રાસાયણિક ખાતરોનો ઉપયોગ નિષેધ છે. પાકને જરૂરી પોષક તત્વો માટે ફક્ત સેન્દ્રિય અને જૈવિક ખાતરો પર જ આધાર રાખવો પડે છે. અમુક લાંબા ગાળાના પાકો જેવા કે કપાસ, શેરડી, બટાટા, કેળ અને તમાકુને વધુ માત્રામાં (૨૦૦ થી ૨૫૦ કિલો/ હે.) નાઈટ્રોજન તત્વની જરૂરિયાત રહે છે. આવા પાકનું મહત્વમાં ઉત્પાદન લેવા માટે તેને જરૂરી નાઈટ્રોજનનો જથ્થો મેળવવા છાણિયા ખાતરનો ખુબ જ મોટો જથ્થો જરૂર પડે (કારણ કે છાણિયા ખાતરમાં ૦.૫-૦.૬ ટકા જ નાઈટ્રોજન હોય છે.) આટલા મોટા જથ્થામાં છાણિયા ખાતરની કિંમત ગણીએ તો આંકડો ખૂબ જ ઊંચો જાય. આવા કિસ્સામાં એક બાબત સ્પષ્ટ છે કે દરેક પાકમાં સેન્દ્રિય ખેતી કરવાનો આગ્રહ ન કરતાં ટૂંકા ગાળાના

પાકો અને ખાસ કરીને જેમાં ઓછા જથ્થામાં પોષક તત્વોની જરૂરિયાત હોય તેવા પાકોની સેન્દ્રિય બેતી કરવાથી ફાયદો થાય. શાકભાજના પાકો, કઠોળપાકો, ધાન્યપાકો, સોયાબીન, તલ વગેરે પાકની સેન્દ્રિય બેતી આવકાર્ય છે. તે સિવાય રાજ્યના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક રસાયણોનો વપરાશ થતો નથી અથવા તો ખૂબ જ ઓછો થાય છે દા.ત. ભાલ વિસ્તાર અને દાહોદ, પંચમહાલ, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા વગેરે જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં બેડૂતો ભાગ્યેજ કૃષિ રસાયણોનો ઉપયોગ કરે છે. તેથી સૌ પ્રથમ તો આવા વિસ્તારોની ઓળખ કરી ત્યાં સજીવ બેતી અપનાવવા બેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને ધીરે ધીરે અન્ય વિસ્તારમાં તેનો વ્યાપ વધારવો જોઈએ.

સજીવ બેતીમાં વધુ માત્રામાં સેન્દ્રિય ખાતરો માટે મોટે ભાગે છાણિયા ખાતર પર વધુ આધાર રાખવો પડે. છાણિયું ખાતર મેળવવા પશુપાલનનો વ્યવસાય અનિવાર્ય બને. સજીવ બેતી અને પશુપાલન એ બે અભિનં અંગો છે. પશુપાલન માટે ઘાસચારાની જરૂર પડે. ઘાસચારા માટે અલગથી થોડી વધારે જમીન ફાળવવી પડે. આમ થતાં મનુષ્યો માટેના ખાદ્યાન્ન પાકો હેઠળનો વિસ્તાર ઘટવાની શક્યતા રહે છે. (કૂડ સીક્યુરિટી)નો પ્રશ્ન ઊભો થાય. હાલની તક તે પણ પોષાય તેમ નથી. વસ્તી વધારાની સાથે દિન-પ્રતિદિન વાવેતર હેઠળની જમીન ઘટતી જાય છે. જંગલ વિસ્તાર ઘટતો જાય છે. આવા સંજોગોમાં એકીસાથે મોટા વિસ્તારમાં સજીવ બેતી અપનાવવામાં આવે તો અનાજ અને કઠોળની તંગી સર્જઈ શકે છે. આ પણ એક વિચારવા જેવી બાબત છે.

કોઈપણ સજીવના જનીનિક બંધારણમાં ઇચ્છિત ફરેફાર કરી તૈયાર કરવામાં આવતી બનાવટને સજીવ બેતીમાં વાપરવા પર નિષેધ છે. તેથી સજીવ

બેતીમાં જીએમ (જોનેટિકલી મોડિફાઇડ) પાકના બિયારણને વાપરી ન શકાય. એક બાજુ સરકાર વધુ ઉત્પાદન મેળવવા માટે અમુક શરતોને આધિન કેટલાક જીએમ પાકોના વાવેતર માટે દૃષ્ટાટ જાહેર કરે છે અને બીજી બાજુ સજીવ બેતીનો પ્રસાર-પ્રચાર થાય છે. આ બસે એકી સાથે કેવી રીતે શક્ય બને ?

સજીવ બેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક જંતુનાશકો ન વાપરતા સૂક્ષ્મ જીવાણુંઓ આધારીત બાયોપેસ્ટીસાઇડ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. આપણા દેશમાં વપરાતા કુલ જંતુનાશક રસાયણોમાં બાયોપેસ્ટીસાઇડનું માર્કેટ ફક્ત ૧.૫ થી ૨.૦ ટકા જેટલું જ છે. બેડૂતો બાયોપેસ્ટીસાઇડનો વપરાશ ખાસ કરતા નથી કારણ કે (૧) દરેક વિસ્તારમાં તે બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકતા નથી (૨) તેની અસર ધીમી હોય છે અને (૩) તે પ્રમાણમાં મૌંધા હોય છે. બાયોપેસ્ટીસાઇડના વેચાણમાં જે વધારાના વેરા (ટેક્ષ) લેવામાં આવે છે તે નાબૂદ કરવામાં આવે અને જે બેડૂતો બાયોપેસ્ટીસાઇડનો વપરાશ કરે તેને પ્રોત્સાહિત કરવા સબસિડીના રૂપમાં સહાય કરવામાં આવે તો ચોક્કસ તેનો વ્યાપ વધે. બાકી સજીવ બેતી અંગે ખાલી ભાપણ કરવાથી બેડૂતો અપનાવે નહિ તે સત્ય હક્કિકત છે.

સજીવ બેતીમાં સેન્દ્રિય ખાતરો તરીકે છાણિયું ખાતર, સ્લરી, કમ્પોસ્ટ ખાતર, વર્મિકમ્પોસ્ટ, મરધા-બતકાની હગારમાંથી બનતું ખાતર, કતલખાનાનો નકામો કચરો અને લીલા-પડવાશનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાં માનવ મળમાંથી બનાવેલ ખાતર ખાસ કરીને શાકભાજના પાકોમાં વાપરી શકતું નથી. જમીન સુધારકો જેવા કે જીસ્મ, ચૂનો, મેનેશિયમ રોક, કુદરતી રીતે મળતા પોટેશયમ બનિજ, ફોર્સર્સ, સલ્ફર, કલે, સિલિકેટ વગેરે વાપરી શકાય. અમુક ખાસ કિસ્સામાં તાંબાયુક્ત બનાવટ (કોપર ઓક્ઝિક્લોરાઇડ)

નો મર્યાદિત ઉપયોગ (Restricted use) થઈ શકે. સજીવ ખેતીમાં સેન્ટ્રિય ખાતરોના ઉપયોગ માટે સબસિડી આપવામાં આવે તો નાના ખેડૂતોને ફાયદો થઈ શકે અને સજીવ ખેતીનો વ્યાપ વધે.

સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત થયેલ ખેતીપેદાશના વેચાશ માટેનું યોગ્ય માળખું અને બજાર વ્યવસ્થા જ્યાં સુધી વ્યવસ્થિતપણે ન ગોઠવાય ત્યાં સુધી નાના ખેડૂતો કે જેની સંખ્યા વધુ છે તેઓ માટે સજીવખેતીના યોગ્ય બજારભાવ ન મળે તો આર્થિક રીતે નાના ખેડૂતોને સજીવ ખેતી કરવી પોખાય નહિ તે પણ એક હિક્કટ છે. સજીવ ખેતીની પેદાશનોના વધુ ભાવ ખેડૂતોને મળે તે માટે તેની પરદેશમાં નિકાસ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. આ માટે નાના ખેડૂતોની સજીવ ખેતી પેદાશો વિવિધ ગામેથી એકત્રિકરણ કરવા માટે જો સરકારી કે સહકારી

ધોરણે વ્યવસ્થા કરવામાં આવે, તેનું યોગ્ય રીતે સંગ્રહ જાળવણી કરી, વ્યવસ્થિત રીતે પેકિંગ કરી, પરદેશના બજારમાં અમુક બ્રાન્ડ હેઠળ માલ મોકલવાનું ગોઠવાય, તો જ ખેડૂતોને આર્થિક વળતર મળી રહે.

સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત થતા માલના વેચાશની યોગ્ય સુવિધા હોવી જરૂરી છે. આવી ઉપજ પ્રમાણિત થયેલ હોય તે આવશ્યક છે. રાજ્ય સરકારે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ની રચના કરી છે. તેના દ્વારા ખેતીપેદાશ પ્રમાણિત થાય છે. મોટા અને શિક્ષિત ખેડૂતો કદાચ તેનો લાભ લઈ શકે પરંતુ નાના અને દૂર દૂર ગામડાઓમાં રહેતા ખેડૂત સમૃદ્ધાયનો મોટો ભાગ તેનો લાભ ન લઈ શકે તેથી બધા જ ખેડૂતોને સજીવ ખેતી અપનાવવા માટે તૈયાર કરતા પહેલા પુરેપુર મનોમંથન કરવાની આવશ્યકતા જણાય છે.

DIGITAL AgriMedia CREATIVE MEDIA HOUSE

દિજિટલ એગ્રીમેડિયા
૫૦૫, શાલીન, સેક્ટર-૧૧, ગાંધીનગર
agrimeediafilm@gmail.com
www.digitalagrimedia.in

ક્ર-સાહિત્ય : શિયાળુ પાકોની પેઝાનિક ખેતી અંગેની એગ્રીમેડિયા ફિલ્મ ડીવીડી

કોણ કરીને ઘર લેણા મંગાણો એગ્રીમેડિયા ફિલ્મ ડીવીડી

મો: ૯૮૨૭૪ ૧૮૨૩૫, ૦૭૯-૨૩૨૪૫૬૮૭

રોજીઝ નાર્સરી

(બયુભાઈ અને નરેન્દ્રભાઈની નર્સરી)

અમારે ત્યાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવેલા દરેક જાતના ફૂલછોડની કલમો, શોભાના છોડ, બોગાન વેલની દરેક જાતો, રોડ સાઈડ ટ્રી, શોભાના કીપાર તથા પામ અને જાસુદની વિવિધ જાતો તેમજ ઈંગ્લીશ ગુલાબની વિવિધ જાતો ઉપરાંત નૂતન કલમ પદ્ધતિથી તૈયાર કરેલ આંબાની વિવિધ જાતો જેવી કે લંગાડો, રાજાપુરી, કેસર, હાકુસ વગેરે તેમજ કાલીપટી ચીકુની કલમો, છુટક અને જથ્થાબંધ વ્યાજની ભાવથી જરૂરીયાત પ્રમાણે હાજર સ્ટોકમાં મળશે.

સંપર્ક
અવેરલાલ પી. વર્મા (બયુભાઈ)
મોબાઇલ : ૯૮૭૯૦૧૨૨૫૫
કોર્ન્ : નરેન્દ્રભાઈ ચોકડી,
એન.એચ. નં. ૮,
પોર્ટ સાકરા, નિ. વડોદરા
કોન/કેક્સ : (૦૨૬૫) ૨૮૪૦૪૦૬
કોન : (૦૨૬૫) ૨૮૪૦૪૦૪

સંપર્ક
અવેરલાલ પી. વર્મા (બયુભાઈ)
મોબાઇલ : જોકલાઈ પી. રાહોલ મો. ૯૮૭૯૦૧૨૨૫૫
ઓફિસ અને વેચાશ કેન્દ્ર,
નવાયાર્ડ, છાણીરોડ,
પો. કુટેંગાંજ, વડોદરા
કોન : ૦૨૬૫-૨૮૪૦૨૧૨, ૨૮૪૦૨૧૨
કેક્સ : ૦૨૬૫-૨૮૦૨૧૧
મો. ૯૮૨૫૨૩૪૫૦૩

Website : www.rosesnursery.com

Email : rosesnursery-baroda@gmail.com

પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફળોની ગુણવત્તા સુધારવા ફળો ઉપર કોથળી ચટાવો

ડૉ. કે. પી. કીકાણી

પ્રમુખ, ગુજરાત બાગાયત વિકાસ પરિષદ

આણંદ - ૩૮૮ ૧૧૦

ફોન : મો. ૦૭૮૨૫૫૫૭૪૮



ફળો ઉપર કોથળી ચટાવવાના ફાયદાઓ :

- (૧) ફળો ઉપર કોથળીઓ ચઢાવવાથી ફળોનું વિપરિત પરિસ્થિતિમાં રક્ષણ થતા ફળોને તાજા રાખે છે.
- (૨) બહારથી જીવાતો સૂક્ષ્મ જીવાણુંઓ, ધૂળના રજકણો, ફળો ઉપર લીસોટા પડવા સામે ફળોનું રક્ષણ થાય છે.
- (૩) વધારે પડતી ગરમી/ઠંડી, પવન વગેરે સામે ફળોનું રક્ષણ થાય છે.
- (૪) બેગો ચઢાવવાથી ફળો ઉપરની છાલમાં પિગમેન્ટ સંશ્લેષણ થવામાં ફાયદાકારક છે.
- (૫) ફળો ઉપરની બેગોથી ફળો પાકવાના દિવસો, દેહધાર્મિક કિયાઓ, ઉતાર્યા પછી થતો બગાડ અટકાવવો અને સંગ્રહશક્તિ વધવી વગેરેમાં ફાયદાકારક છે.
- (૬) જંતુનાશક દવાના ઓછા અવશેષો તેમજ પોખણમૂલ્યોમાં ફાયદાઓ જણાયા છે.

ઈતિહાસ :

ફળો ઉપર બેગો ચઢાવવાની શરૂઆત અંદાજે ૨૦૦ વર્ષ પહેલા જાપાનમાં શરૂ થયેલ. શરૂઆતમાં નાના ફળોને રક્ષણ આપવા સીવડ (Sewad) સર્કાર

રેશમી બેગ ચઢાવેલ, જે વધતા-ઓછા પ્રમાણમાં સને ૧૯૮૦ સુધી ચાલુ રહેલ. ત્યારબાદ પ્લાસ્ટિકની બેગોનો યુરોપના દેશોમાં સને ૧૯૭૦ સુધી વ્યાપક ઉપયોગ થવા માંડયો. એશિયન દેશોમાં ફળો ફરતે પેપરની પસ્તી વિટાળવા પ્રથા અમલમાં આવેલ જે ખાસ કરી ફળમાખીના ઉપદ્રવ સામે ફળોનું રક્ષણ

મેળવવા થતી. વ્યાપારી ધોરણે સફરજન, પીચ અને પીયરમાં વ્યાપક ઉપયોગ થયો અને ત્યારે ઓસ્ટ્રેલિયામાં કેરીઓ ઉપર બેગો ચઢાવવામાં આવતી. સાઉથ આફ્રિકામાં લીચીને બેગો ચઢાવવામાં આવતા ગુણવત્તામાં સુધારો નોંધાયેલ. ભારતમાં વ્યાપારિક ધોરણે ફળો ઉપર બેગો ચઢાવવાની કોઈ પ્રથા નથી. પરંતુ હમણાં હમણાં સને ૨૦૧૦ બાદ કેળા, દાડમ, કેરી, લીચી, જામફળ વગેરેમાં નાના પાયે બેગો ચઢાવવાની શરૂઆત થઈ છે જે પૈકી કેળામાં ઘણો સાનુકૂળ પ્રતિસાદ મળેલ છે.

બેગો ચટાવવા માટેની કાળજી :

- (૧) ફળપાકોની હાઈબ્રિડ અને વધુ ઉત્પાદન આપતી અથવા સુધારેલી જાતો રોપવી.
- (૨) બેગમાં વપરાયેલ મટીરિયલ્સ અને તેનો રંગ તપાસવો.

- (૩) બેગો ચઢાવવાનો સમય જાણી લેવો.
- (૪) બેગ કેટલો સમય રાખવાની છે તે જાણવું.
- (૫) ચઢાવેલ બેગો ફળની છાલને અડકે તે રીતે ચઢાવવાની છે.

બેગના ઉપયોગથી થતા ફાયદાઓ :

- (૧) હંડીમાં ઉષ્ણતામાન વધારે અને ગરમીમાં ઉષ્ણતામાન ઓછું રાખે જેથી ફળની તમામ દેહધાર્મિક કિયામાં એકસરખી રીતે ચાલે છે.
- (૨) રોગ-જીવાતને દૂર રાખે છે.
- (૩) જંતુનાશક અવશેષો ઓછા રહે છે.
- (૪) ફળોને વહેલા પકવે છે.
- (૫) બેગથી ફળોને ઈજા થતી નથી.
- (૬) સનસ્કેબ, હિમ અને ચિલિંગ ઈન્જરીથી બચાવે છે.

બેગો કેમ ચટાવવી ?

- (૧) ફક્ત ફળોને જ બેગો ચઢાવવાની છે જેમાં ડાળી-પાંદા, ડાળી અથવા ફૂલો ભેગા લેવાના નથી.
- (૨) પ્રથમથી જ ફક્ત તંદુરસ્ત ફળોને બેગ ચઢાવવી. રોગિએ ફળોને બેગ ચઢાવવાથી કોઈ ફાયદો થતો નથી.
- (૩) રોગ-જીવાત જણાતી હોય તો તેનું નિયંત્રણ કરી બેગ ચઢાવવી.
- (૪) બાંધ કરવાની છે. ઉપરથી બંધ કરવી, ફક્ત કેળા માટે જ્યારે બીજા ફળોમાં બેગો ઉપર નીચે બંધ કરવી. પરંતુ થોડા કાણા પાડવા જેથી હવાની અવર-જવર થાય.

વિવિધ ફળપાકોમાં બેગ ચટાવવાથી થતા ફાયદા અને કચાં તબક્કે બેગ ચટાવવી :

(૧) કેળા :

ફાયદાઓ : (૧) કેળામાં બેગ ચઢાવવાથી સીગાર ઈન્ડ રોટ, એન્ટ્રેન્કનોઝ, ટ્રિપ્સ, માઈટ્સ તથા અન્ય જીવાત સામે રક્ષણ મળે છે. (૨) મીકેનિકલ ઈજા થતી નથી. (૩) ધૂળના રજકણોથી બચાવે છે. (૪) લૂમના દરેક કંચકાનો વિકાસ સરખો થાય છે. (૫) ઉતાર્યા પછીનો બગાડ ઓછો થાય છે. (૬) ૧૦-૧૫ દિવસ પહેલા પાકે છે. (૭) કેળાને વજન અને કદમાં વધતા ઉત્પાદન વધારે છે. (૮) ભૂખરા રંગની ૭ ટકા વેન્ટિલેશનવાળી બેગો ચઢાવવી.

બેગ કચારે ચટાવવી : લૂમો સંપૂર્ણ બહાર નીકળી જાય ત્યારે

(૨) કેરી

ફાયદાઓ : (૧) કેરીમાં સડો//ચાંદી પડવાનું ઘટાડશે. (૨) એન્ટ્રેકનોઝ રોગ ઓછો કરશે. (૩) કેરી વહેલી પાકશે. (૪) ફળમાખીનો ઉપક્રમ ઘટાડશે. (૫) ફળને ભરાવદાર બનાવશે, વજન અને કદમાં વધારશે તથા ગુણવત્તા સુધારશે.

બેગ કચારે ચટાવવી : કેરી વેડવાના ૮૦-૯૦ દિવસ પહેલા એટલે કે ફળો લીંબું જેટલા થાય પછી.

(૩) દાડમ :

ફાયદાઓ : (૧) દાડમાં રસનું પ્રમાણ વધારશે. (૨) પિગમેન્ટ વિકાસ પામતા છાલનો રંગ આકર્ષક બને છે. (૩) ફળમાખીનો ઉપક્રમ ઘટાડે છે. (૪) ફળો ઉપર બેકટેરીયાથી થતા બ્લાઇટનો રોગ ઘટાડે છે. (૫) ફળો ફાટી જવાનું ઓછું થશે. (૬) ગુણવત્તા સુધારશે. (૭) ધૂળના રજકણો ચોટ્ટા નથી.

બેગ કચારે ચઠાવવી : ફળો ઉતારવાના ૮૦ દિવસ પહેલા એટલે કે દાડમ સોપારી કદના થયા બાદ દરેક ફળને અલગ અલગ ચઠાવવી.

(૪) જમફળ :

ફાયદાઓ : (૧) જમફળમાં પરફોરેટ પ્લાસ્ટિક બેગ ચઠાવવાની ફાયદાઓ નોંધાયેલ છે. (૨) ફળમાખીનો ઉપદ્રવ ઘટાડે છે. (૩) મીલીબજસથી બચાવે છે. (૪) ફળોની ગુણવત્તા સુધારે છે. (૫) ફળોને પોચા પડતા અટકાવે છે. (૬) ફળોમાં કુલ શર્કરાનું પ્રમાણ વધારે છે. (૭) ફળો સ્વાદ, સુંગધ અને દેખાવમાં આકર્ષક બને છે.

બેગ કચારે ચઠાવવી : જમફળના સેટીંગ બાદ સોપારી કદના થયા બાદ બેગો ચઠાવવી.

(૫) પોપેયા :

ફાયદાઓ : (૧) ઠંડી ગરમીથી રક્ષણ મળે છે. (૨) રોગ જીવાત ઓછા લાગે છે. (૩) પક્ષીઓથી ફળોનું

રક્ષણ થાય છે. (૪) ધૂળના રજકણો ઓછા લાગે છે અને ફળ ઉપર ડાઘ પડતા નથી.

આ સિવાય દ્રાક્ષ, સફરજન, લીચી, મેંગોસ્ટીન વગેરેમાં બેગ ચઠાવવામાં આવે છે.

અંતમાં હવે વિશ્વસ્તરે ગુડ એગ્રિકલ્યુરલ પ્રેક્ટિચસિસ (GAP)નો વ્યાપક પ્રચાર/પ્રસાર થઈ રહ્યો છે ત્યારે અને ઓછામાં ઓછા જંતુનાશક દવાના અવશેષોવાળા ફળોની માંગ વધી રહેલ છે. ફળો ઉપર બેગો ચઠાવવી એ મજબૂત ઉપાય સાબિત થઈ રહેલ છે. જેના ફળની છાલનો રંગ, બહારનો દેખાવ, ફળોનું વજન અને કદમાં વધવું, ગુણવત્તા સુધરવી અને તે દ્વારા ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી ઉત્પાદન થતા ફળપાકોની ખેતી વિશેષ આર્થિક પોષણક્ષમ બનશે તેથી ફક્ત જાણી લો કે ક્યા ફળને ક્યા તબક્કે, કેવા રંગની, ક્યા માપની, કેવી રીતે બેગ ચઠાવવી. જે આપના ફળપાકોની ખેતીને આપશે ઉદ્યોગનો આકાર.

અનુભવ પ્રવાહી બાયો એન.પી.કે. જેવિક ખાતર સમૂહ (BIO NPK CONSORTIUM)

વિશિષ્ટતા અને ફાયદા

- ◆ વપરાશની અવધિ ૧ વર્ષ
- ◆ ૫૦ કરોડ સૂક્ષ્મભૂલાણું પ્રતિ મિલિ લિટર, પાંચ બેકેટરીયાનો સમૂહ
- ◆ પ્રતિ ડેક્ટર, પાક ફીઠ ૨૫-૩૦ ટકા નાઈટ્રોજન, ૨૫% ફોસ્ફરસ અને ૨૫% પોટાશ આતરની બચત
- ◆ ઉત્પાદનમાં ૧૦% ટકા નો વધારો
- ◆ જમીનનું નૈચેક રસ્સાયાણિક તેમજ ભૌતિક ભંધારણ સુધારે
- ◆ વપરાશ અને વહન સરળ, ટપક પદ્ધતિ અને ગ્રીનહાઉસમાં ખાસ ઉપયોગી છે
- ◆ સેન્ટ્રિય ખેતીનું અનિવાર્ય અંગ, કિફાયતી તેમજ પર્યાવરણ માટે સુરક્ષિત છે
- ◆ વિટામિન તેમજ વૃદ્ધિ વર્ધકો બનાવી છોડને પોષણ ખૂલું પણ હો
- ◆ બિયારણનો ઉગાવાના દર વધારે છે.
- ◆ વધુમાં રોગકારક ફૂગ તથા નીમેટોડથી પાકનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.



પેકિંગ : ૫૦૦ મિ.લિ. કિંમત: ₹ ૨૫૦/-
પ્રાપ્તિ સ્થાન: સૂક્ષ્મજીવાણુશારબ વિભાગ,
બાયોફાર્મિલાઇઝર પ્રોજેક્ટ,
આણંદ કૃષી યુનિવર્સિટી, આણંદ
ફોન નં. ૦૨૬૬૨-૨૬૦૨૧૭/૨૨૮૭૧૩
(રજાના દિવસો સિવાય સમય
સવારે ૬ થી ૧૨ સાંજે ૨ થી ૫)

દૂધ ઉત્પાદન વધારવાની ચાવીઓ

ડૉ. નરેન્દ્રકુમાર એન. પંડ્યા

નિવૃત્ત સહ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી (પશુપાલન)

કૃષિવન સોસાયટી, આણંદ ૩૮૮૦૦૧

ફોન: (૦૨૬૫૨) ૨૬૨૭૮૮



(૧) દૂધાળ પશુના દૈનિક કામકાજમાં નિયમિતતા : (૨) પશુ સાથેના વ્યવહારમાં માયાળુ વર્તન :

દૂધાળ પશુને જે પ્રકારની ટેવ પાડવામાં આવે તે પ્રકારની ટેવ ટેવાયેલાં હોય છે. માટે દૈનિક દૂધ ઉત્પાદનમાં અવળી અસર ન થાય તે પ્રકારની ટવો પાડવી અત્યંત જરૂરી છે. પશુની દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેવા કે પશુને દાણ મૂકવું, ધાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, હાથીયો કરવો, બે વાર દોહન કરવું, કસરત, દિવસમાં ગ્રાણ કે ચાર વખત પાણી પાવું વગેરે. આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. કોઈ ગ્રાણસર પશુપાલકને બહારગામ જવાનું થાય ત્યારે આ કાર્યો નિયત સમયે થાય તે માટેની સઘળી વ્યવસ્થા અગાઉથી ગોઠવીને જવું જોઈએ. નિયમિત રીતે આ કાર્યો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. પણ આ નિયત કાર્યકમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દૂધાળ પશુના દૂધ ઉત્પાદન ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યકમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ જે પશુપાલકની મૂળભૂત ફરજ છે.

દૂધાળ ગાયકે ભેંસને ઘરના કમાઉસભ્યતરીકે ગણવામાં આવે છે કારણ કે પશુપાલનના ધંધામાં ૮૦ ટકા જેટલી આવક દૂધાળ પશુના દૂધમાંથી મળે છે. આ પ્રમાણેની આવક સતત ચાલુ રહે અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે દૂધાળ પશુની દેખભાળ, પશુ પોષણ, પશુ સંવર્ધન અને પશુ રોગો સામે રક્ષણ અંગેની જાણકારી દરેક પશુપાલકે મેળવવી જોઈએ. જો પશુપાલકો તેના તરફ હુલ્કશ સેવે તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, અને પશુઓમાં રોગ દાખલ થવાથી પશુના મૃત્યુનો પણ ભય રહે છે જેથી કુટુંબની દૈનિક આવકમાં ઘટાડો થાય છે અને કિંમતી પશુ ગુમાવવું પડે છે માટે દરેક પશુપાલકે પોતાના પશુઓ પાસેથી દૂધ ઉત્પાદન વધારે મેળવવું હોય, ઉચ્ચકોટીના પશુઓ પેદા કરવા હોય અને પોતાનું આર્થિક પાસુ મજબૂત કરવું હોય તો વધુ ઉત્પાદન મેળવવા માટે પશુ વ્યવસાયને અસર કરતા ૧૨ પરિબળોનો અભ્યાસ કરી તેનો અમલ કરવો અત્યંત જરૂરી છે જેની વિગત આ લેખમાં દરશાવેલ છે.

એક સામાન્ય નિયમ અનુસાર તો બધા જ પશુઓ સાથે માયાળુ વ્યવહાર અવશ્ય રાખવો જરૂરી છે.

પણ દૂધાળા પશુઓ જેવા કે ગાય ભેંસ તરફ સવિશેષપણે અને સભાનપણે ખાસ ધ્યાન રાખીને માયાળુ સ્વભાવથી વર્તાવ કરવો અત્યંત જરૂરી છે. દૂધાળ પશુના દોહન કાર્ય સમયે મોટા અવાજે બોલવું નહિ. પશુને મારવું નહિ આ પ્રમાણે વર્તાવ રાખવામાં આવશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે. પણ આ બાબતો ધ્યાનમાં નહિ લેવામાં આવે તો દોહન કાર્ય વખતે દૂધ ઉત્પાદન પર માઠી અસર પડશે જેથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે. આથી દૂધાળ પશુઓને પ્રેમથી બોલાવવા, પીઠ થાબડવી, પંપાળવાં અને અમી નજરથી પશુને નિહાળવું જોઈએ. માલિકની અમી નજરથી પશુનું દૂધ ઉત્પાદન વધે છે, માટે દૂધાળ પશુ પ્રત્યે માયાળુ સ્વભાવ રાખવો જોઈએ.

(૩) પશુના દૈનિક ખોરાક માટેની જાણકારી :

કુદરતે પશુનો ખોરાક ધાસચારો સર્જથો છે પણ આપણે આપણી જરૂરિયત માટે ગાય-ભેંસ પાળવા માંડી અને જરૂરી ખોરાક આપવાના શરૂ કર્યો ત્યારથી એના દૂધ

ઉત્પાદનમાં ઉત્તરોત્તર અકુદ્ધરતી રીતે વધારો થયો પણ દૂધ ઉત્પાદન માટે જે પોષક તત્વોની અને જરૂર પડે છે, તે માત્ર ધાસચારામાંથી મળી શકતા નથી. આથી ધાસચારા ઉપરાંત પશુને દાણ પડ્યા આપવું પડે છે. આથી દૂધાળાં પશુને સારી ગુણવત્તાવાળો ધાસચારો પેટ ભરાય તેટલો આપવો અને આ ધાસચારામાંથી જે પોષક તત્વો મળે તે કરતાં વધારના જે તત્વો જોઈએ તે દાણ આપીને તે મારફતે પૂરા પાડવા. દૂધાળ ગાય-ભેંસને ધાસચારાની ગુણવત્તા અનુસાર એમના શરીરના ૧.૫ ટકા થી ૩.૦ ટકા જેટલો સૂકો ધાસચારો સામાન્ય રીતે ખાઈ શકે છે હલકી ગુણવત્તાવાળો ધાસચારો ઓછો ખાય અને ઊંચી ગુણવત્તાવાળો ધાસચારો વધુ પ્રમાણમાં ખાય છે. સામાન્ય રીતે પશુને મધ્યમ કક્ષાનો ધાસચારો નિરવામાં આવે તો તેઓ તેમના શરીરના વજનના ૨.૫ ટકા લેખે ખાય છે. પણ આ રીતે ધાસચારાની ગણત્રી કરતાં ધાસચારાની જે જરૂરિયાત થાય તેના ગ્રીજા ભાગનો ધાસચારો લીલા ચારાના કે સાઈલેજના રૂપમાં આપવો જોઈએ. કારણ કે લીલા ધાસચારામાં મુખ્ય પૌષ્ટિક તત્વો ઉપરાંત ‘અજાણ તત્ત્વો’ રહેલા હોય છે જે દૂધાળ પશુના દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે. જો સારી ગુણવત્તાવાળો કઠોળ વર્ગનો ધાસચારો અથવા ધાન્ય વર્ગનો ધાસચારો દૂધાળ ગાય-ભેંસને છૂટથી ખવડાવવામાં આવે અથવા આ બસે વર્ગના ધાસચારાનું રઃઉના પ્રમાણમાં મિશ્ર કરીને છૂટથી ખવડાવવામાં આવે તે ઈચ્છનીય છે. આવા ધાસચારામાંથી કેલિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વિટામિન્સ વગેરે મળી રહે છે. આ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળો ધાસચારો છૂટથી દૂધાળ પશુઓને ખવડાવવામાં આવે ત્યારે દૂધાળ પશુના નિભાવ માટે ૧.૫ થી ૨ કિલોગ્રામ દાણ આપવાની જરૂરિયાત રહેતી નથી.

(ક) દાણ :

પુખ વયના દૂધાળ ગાય-ભેંસને બે મુખ્ય હેતુઓ માટે પોષક તત્વોની ખોરાકની જરૂર પડે છે. પોષક તત્વો જેવા કે નિત્રિલ પદાર્થ (પ્રોટીન), મેંદાવાળા

પદાર્થ, તૈલી પદાર્થ, રેખાવાળા પદાર્થ, ખનીજ કારો અને પ્રજવકોની જરૂરિયાત રહે છે જે ધાસચારામાંથી અને સુભિશ્રિત દાણમાંથી પૂરા પાડવા જોઈએ. દાણ મુખ્યત્વે બે હેતુઓ માટે આપવામાં આવે છે. (૧) શરીરના નિભાવ માટે અને (૨) દૂધ ઉત્પાદન માટે. ઉપર જોઈ ગયા તે પ્રમાણે ઊંચી ગુણવત્તા ધરાવતો ધાસચારો દૂધાળ ગાય-ભેંસને આપવામાં આવે તો શરીરના નિભાવ માટે જરૂરી તત્વો એમને માત્ર ધાસચારામાંથી જ મળી રહે છે આથી નિભાવ માટે દાણ આપવાની જરૂર પડતી નથી. પણ જો ધાસચારો હલકી કે મધ્યમ કક્ષાનો હોય તો શરીરના નિભાવ માટે દૂધાળ પશુ દીઠ રોજનું ૧.૫ થી ૨ કિલોગ્રામ સુભિશ્રિત દાણ ખવડાવવું જરૂરી છે. આ ઉપરાંત વધારામાં દૂધ ઉત્પાદન માટે દૂધાળ ગાય-ભેંસને દૂધ ઉત્પાદનના ૪૦ થી ૫૦ ટકા પ્રમાણે સુભિશ્રિત દાણ આપવું જોઈએ. વાઇરડા-પાડાને ખવડાવીને ઉછેરવામાં આવતાં હોય તો એ જે દૂધ ધાવી જાય તેનો અંદાજ નક્કી કરી તેને જે દૂધ દોડીને કાઢતાં હોઈએ તેમાં ઉમેરી રોજ કેટલું દૂધ દુધાળ પશુ ખરેખર પેઢા કરે છે તે ગણવું અને આ કુલ દૂધ ઉત્પાદન અનુસાર સુભિશ્રિત દાણ આપવાની ગણત્રી કરવી.

(ખ) ખનીજ પદાર્થોઃ :

દૂધાળ ગાય-ભેંસને ચૂનો (કેલિયમ), ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જેવા ખનીજ પદાર્થોની મોટી માત્રામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડિન જેવા ખનીજ પદાર્થોની અલ્ય માત્રામાં જરૂર પડે છે. પણ જો કોઈ ખાસ પ્રદેશની જમીન કોઈ ખાસ ખનીજ પદાર્થની ઉણપ ધરાવતી ન હોય તો દૂધાળ પશુને કેલિયમ (ચૂનો), ફોસ્ફરસ તથા સોડિયમ જેવા તત્વો સિવાય અન્ય તત્વો જરૂરી પ્રમાણમાં એમને કુદરતી ખોરાકમાંથી જ મળી રહે છે. આથી દૂધાળ પશુને માથાદીઠ ૩૦ ગ્રામ મીઠું દાણમાં બેળવીને આપવું જરૂરી છે. આ ઉપરાંત ૩૦ ગ્રામ ક્ષારમિશ્રણ અગર તેટલાં જ પકવેલાં હાડકાંનો ભૂકો (બોનમીલ) આપવો જોઈએ. જો શક્ય હોય તો ભજારમાં

તૈયાર મળતી ચાટણઈટ (કેટલ લીક) પશુની ગમાણમાં મુકવી જેથી પશુ ચાટીને તેમાંથી જોઈતા ખનીજ તત્વો મેળવી શકે.

(૪) દુધદોહન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન :

પશુ વ્યવસ્થાના દરેક કાર્યોમાં દોહવાની રીત સૌથી મહત્વની છે. દોહવું એ એક કળા છે જે કળાને હસ્તગત કરવા માટે જ્ઞાન કરતાં મહાવરાની વધુ જરૂર છે એટલે ખૂબ ચીવટ અને આવડત માંગે તેવું કામ છે. દોહવાનું બરાબર રીતે થાય તો આઉને તંદુરસ્ત અને કાર્યક્ષમ હાલમાં લાંબો વખત જગ્ઘવી શકાય છે. દોહવામાં ખૂલ થાય તો દૂધ ઘટે છે. દોહન કાર્ય જડપથી અને દૂધાળ પશુને અનુકૂળ રહેતે પ્રમાણ ૭ થી ૮ મિનિટમાં પૂરું કરવું જોઈએ.

દોહવાની રીતો :

દોહવાની મુખ્ય ગાણ રીતો છે.

(ક) અંગૂઠો વાળીને મૂઢીની મદદથી દોહવું : આ રીતમાં ગાય-ભેંસના આંચળને મૂઢીના વચમાંથી અંગૂઠાને ઢેકા અને આંગળીઓની વચમાં પકડવામાં આવે છે. પછી આંચળ દબાવીને મૂઢીને ઉપરની નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ કિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે.

આ રીતે દોહવાથી આંચળ ઉપર ઘણું ઘર્ષણ થાય છે અને કેટલીક વાર નખ વાગવાથી આંચળને ઈજા થાય છે, અને આંચળ નબળા થઈ જાય છે તથા બોટલ આકારના થઈ જાય છે. મસ્ટાઈટીસ રોગ લાગુ પડે છે અને આંચળ ચુમાવવો પડે છે. આ કારણને લીધે આ રીતે વાપરવી સહેજપણ ઈચ્છનીય નથી.

(ખ) આંગળીઓ અને હથેળીની મદદથી દોહવાની રીત : આ રીતે દોહતી વખતે આંચળને હથેળીની વચમાં પકડવામાં આવે છે અને મૂઢી ઉઘાડ બંધ કરીને જડપથી



આંચળ પકડીને વાંકો
કરીને દોહવું એ ખોટી રીત છે



ચપટીથી દોહવાની રીત - છેલ્લે ડબકા
વખતે દોહવાની રીત



આંગળીઓ અને હથેળીની મદદથી
દોહવાની રીત
ઉત્તમ રીત છે



અંગુઠી વાળીને મૂઢીની મદદથી
દોહવાની રીત
ખોટી રીત છે

ઉપર નીચે તરફ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે વારંવાર મૂઢી ઉઘાડ બંધ કરીને આંચળ ખૂબ જેંચ્યા વિના દોહવામાં આવે છે. આ રીતમાં મૂઢીને આંચળ પર સરકવી ન પડતી હોવાથી ઘર્ષણ ઘણું ઓછું લાગે છે અને આંચળને ઈજા પહોંચતી નથી માટે આ દોહવાની ઉત્તમ રીત છે.

(ગ) ચપટીથી દોહવાની રીત : પ્રથમ બે આંગળી અને અંગૂઠાની વચમાં આંચળ પકડીને દોહવામાં આવે છે. નાના આંચળવાળા પશુઓ તથા પહેલ વેતરી ગાય-ભેંસને બીજી રીતથી દોહી શકાતી નથી તેથી આ રીતે દોહવું પડે છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદન :

જે દૂધ તંદુરસ્ત પશુના આઉમાંથી દોહવામાં આવ્યું હોય અને જેમાં દેખીતો કયરો, વાળ, છાણ કે રજક્ષોનો ન હોય, તેમાંથી ખાટી કે ખારી વાસ આવતી ન હોય એવા જેમાં રોગજન્ય જવાણું ફૂગ કે વાયરસ ન હોય તેવા દૂધને સ્વચ્છ દૂધ કહેવાય.

સ્વચ્છ દૂધના ફાયદાઓ :

સ્વર્ચ દૂધના ઉત્પાદનથી દૂધ ઉત્પત્ત કરનાર, તેનો ધંધો કે વિતરણ કરનાર અને તેને વાપરનાર ગણેયને ફાયદો થાય છે.

- (૧) સ્વર્ચ દૂધમાં રોગજન્ય જીવાણુઓ હોતા નથી અથવા ઓછાં હોય છે એટલે તેને વાપરવાથી તંહુરસ્તીને હાનિ પહોંચતી નથી અને દૂધના આહાર તરીકેના બધા ફાયદા ઉઠાવી શકાય છે.
- (૨) સ્વર્ચ દૂધ ઉત્પન્ન કરવાથી ઉત્પાદકની આબરૂ વધે છે. તેના દૂધની માંગ વધે છે એટલે ભાવ વધારો મેળવી શકે છે.

સ્વર્ચ દૂધ ઉત્પાદન કરવાના અગાત્યના મુદ્દાઓ :

- (૧) દૂધાળ પશુઓ તદ્દન નિરોગી હોવા જોઈએ કારણ કે પશુઓના કેટલાક રોગના જીવાણુઓ દૂધમાં આવે છે અને તે દ્વારા રોગનો ફેલાવો થતો હોય છે. દા.ત. આઉના ટી.બી.ના જીવાણુઓ.
- (૨) દોહન માટેની કોઢ સ્વર્ચ રાખવી જોઈએ.
- (૩) દૂધના દોહન અને સંગ્રહ માટેના વાસણો જેવા કે ડોલ, પવાલી, કેન, ગરણી વગેરે સ્વર્ચ જોઈએ.
- (૪) દુઃખ દોહન કરનાર સ્વી યા પુરુષ પશુપાલકે સ્વર્ચ કપડાં પહેરવાં જોઈએ અને સ્વર્ચતા જીળવવી જોઈએ. તેમના હાથના નખ કાપેલા હોવા જોઈએ અને દોહન કાર્ય વખતે માથું ફાંકેલું રાખવું જોઈએ.
- (૫) દોહવાનો એક કલાક રહે ત્યાર પછી પશુને હાથીયો કરવો નહીં.
- (૬) દૂધ દોહતા પહેલા પશુના આઉ અને આંચળ હુંકાળ કલોરિના અથવા હુંકાળ પોટેશ્યમ પરમેનેટના દ્રાવણથી ધોવા જોઈએ. ત્યારબાદ ચોઝા કપડાના ટુકડા કે નેપકીન વડે આઉ અને આંચળને લુંધીને કોરા કરી નાખવા જોઈએ.
- (૭) પાને મૂક્યા પછી શરૂઆતના દોહનની ગ્રણ ચાર શેડ અલગ વાસણમાં લઈ નિકાલ કરવો કારણ કે શરૂઆતના દૂધની શેડમાં નુકસાનકારક સૂક્ષ્મ

જીવાણુઓની સંખ્યા વિશેખ હોય છે. જેથી દૂધ બગડી જવાનો સંભવ રહે છે માટે જ ત્યાર પછીના શેડોનું દૂધ વાસણમાં ભેગું કરવું.

- (૮) દોહન સ્થાનની આજુબાજુનો વિસ્તાર શાંત અને ઘોંઘાટ રહિત હોવો જોઈએ તથા અજાણી વ્યક્તિને દોહનકિયા વખતે કોઢ પાસે બોલાવવી જોઈએ નહીં. આ ઉપરાંત કૂતરાનું ભસવું વગેરે બાબતોથી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
- (૯) દૂધને સ્વર્ચ વાસણમાં દોહી લીધા પછી તરત જ તેને દૂધઘરમાં પહોંચાડવું જોઈએ યા દૂધ મંડળીએ દૂધ ભરવા જવું જોઈએ.
- (૧૦) દોહન કાર્ય પૂરું થયા પછી વાસણોને ગરમ પાણી અને સોડાથી સાફ કરી નાંખીને નિતરવા માટે મૂકવા જોઈએ.

(૫) પશુ સંવર્ધન :

સમાન્ય રીતે દૂધાળ ગાય-ભેંસ વિયાયા પછી એકાદ માસ બાદ સૌ પ્રથમ ગરમીમાં (વેતરે) આવે છે. પણ ગભરિશયને મૂળ સ્થિતમાં આવતા લગભગ બે માસ જેટલો સમય લાગે છે. માટે બે માસ પછી જ્યારે પશુ ગરમીમાં આવે ત્યારે ફેણવવું જોઈએ. નફાકારક દૂધ વ્યવસાય માટે પશુના બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૨-૧૩ માસનો હોવો જરૂરી છે માટે વિયાણ પછી મોડામાં મોદું ૮૫ દિવસ સુધીમાં પશુ ગાભણ થવું જોઈએ. જો ફેણવેલ પશુ ફરીથી ગરમીમાં ન આવે તો માનવું કે ગર્ભ રહ્યો છે. ગર્ભ રહ્યા પછી ૬૦ થી ૭૫ દિવસ સુધીમાં ગાય-ભેંસ ગાભણ છે કે ખાલી છે તેની તપાસ પશુચિકિત્સક અધિકારી પાસે કરાવવી જોઈએ. ઘણા પશુઓ સુષુપ્ત ગરમીમાં આવે છે જેથી તેના ગરમીમાં આવવાના લક્ષણો જાણી શકતા નથી. માટે આવા સમયે ‘ટીઝરબુલ’ (નસબંધી કરેલ સાંધ અથવા પાડો) ટોળામાં રાખવાથી તાપે આવેલ પશુ સહેલાઈથી શોધી શકાય છે. દૂધાળ પશુ તાપે આવે ત્યારે કૃત્રિમ બીજદાનથી જ ફેણવવાનો આગ્રહ દરેક પશુપાલકે

રાખવો જોઈએ જેથી પેદા થનાર વાછરડી-પાડીઓ દૂધ ઉત્પાદન વધારો આપશે.

સામાન્ય રીતે દેશી વાછરડી-પાડી ૨-૨ $\frac{1}{2}$ વર્ષે પુષ્ય ઉંમરે પહોંચીને પ્રથમવાર તાપે આવે છે જ્યારે સંકર વાછરડી ૧૬-૨૦ માસની ઉંમરે તાપે આવે છે. પણ તેનો આધાર પરદેશી ઓલાદના લોહીના ટકા કેટલા છે તેના ઉપર રહે છે. પરદેશી શુદ્ધ ઓલાદની વાછરડી સામાન્ય રીતે ૧૦-૧૪ માસે પ્રથમ વખતે તાપે આવે છે.

ઉપરોક્ત તાપે આવવાની બાબત ધ્યાનમાં રાખવા નીચે દર્શાવેલ સમયે વિયાણ થાય તે પ્રમાણે તેમને ફેળવવાં જોઈએ.

- (ક) દેશી વાછરડી પાડીનું ૩-૩ $\frac{1}{2}$ વર્ષે પ્રથમ વિયાણ
- (ખ) પરદેશી વાછરડીનું ૨ $\frac{1}{2}$ -૩ વર્ષે પ્રથમ વિયાણ
- (ગ) સંકર વાછરડીનું ૨-૨ $\frac{1}{2}$ -૩ વર્ષે પ્રથમ વિયાણ

જે વાછરડી-પાડી-ગાય-ભેંસ વારંવાર તાપે આવતી હોય અને ઉથલા ખાતી હોય તેને વેચી દેવી તે સલાહ ભરેલું છે.

(૬) રહેઠાણ :

દૂધાળ પશુને એવી રીતે રાખવા જોઈએ કે જેથી એમને કુદરતી પરિબળો-ઠંડી, ગરમી, પવન, વરસાદ વગેરે સામે પૂરતું રક્ષણ મળી રહે અને એ આરામથી રહી શકે. એમનાં રહેઠાણ સ્વચ્છ, ભેજ વિનાનાં, પરોપજીવી જંતુ, જુવા, ઈતરડી વગેરે ભરાઈ ન રહે તેવા હવા ઉજાસવાળા હોવા જોઈએ.

(૭) દૂધાળ પશુને વસુકાવવું :

દૂધાળ ગાય-ભેંસ વિયાયા પછી દૂધ ઉત્પાદનનો પ્રવાહ બાવલાના અંદરના ભાગમાં રાત દિવસ એક ધાર્યો ચાલ્યા કરે છે અને આ પ્રક્રિયા દસ માસ સુધી ચાલુ રહે છે પણ નીચે દર્શાવેલ કારણોને લીધે દોઢ થી અઢી માસ

જેટલો સમય દૂધાળા પશુને વસુકી નાખી આરામ આપવો જોઈએ.

દૂધાળા પશુને વસુકી નાખવા માટેના કારણો :

- (૧) દૂધ ઉત્પાદન આપતા અવયોને દોઢ થી અઢી માસ આરામ આપવા માટે
- (૨) પશુને આપવામાં આવતો ઓરાક દૂધ ઉત્પાદનના બદલે ભાવિ બચ્ચાના શરીરના વિકાસ માટે વપરાય તે માટે
- (૩) વિયાણ પહેલાં દૂધાળા પશુના શરીર ઉપર ચરબી જમાવવા માટે.
- (૪) દૂધ ઉત્પાદન દરમ્યાન વપરાઈ ગયેલ પોષક તત્ત્વો અને ક્ષારો પાછા મેળવવા માટે
- (૫) નવા વેતરમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવા માટે

ઉપરોક્ત હેતુઓ સિદ્ધ કરવા માટે જે પશુને વિયાએ દસ માસ થઈ ગયાં હોય અને જે સાત માસનું સગર્ભી હોય તેના આઉંમાં દૂધ નિર્માણ બંધ કરાવવાની કિયાને વસુકાવવું કહે છે. આ માટે પશુ તેના દૂધ ઉત્પાદન અનુસાર દોઢ થી માંની અઢી માસ જેટલો આરામ-વસુકેલા દિવસો મળે તો તે પૂરતું છું.

દૂધાળ પશુઓને વસુકાવવાની પદ્ધતિઓ :

- (૧) અધુરું દોહવું.
- (૨) આંતરે દિવસે દોહવું.
- (૩) એકાએક દૂધ દોહવું બંધ કરવું.

આ ત્રણ પદ્ધતિમાંથી ગમે તે રીતે દૂધાળ પશુને વસુકાવવામાં આવે પણ વસુકતા પશુને સૌ પ્રથમ લીલો ચારો અથવા સાયલેજ અને દાણ આપવાનું બંધ કરવાથી વસુકાવવાનું કામ સરળ બને છે. સૂકું ઘાસ પણ હલકી કક્ષાનું અને જે આપતા હોઈએ તેનાથી અડુધ અથવા

પોણા ભાગનું જ આપવું. જો વાછરડી-પાડી-ધાવતી હોય તો વસુકતા પશુને એના બેગું ન થવા દેવું. આમ કરવાથી ઢોર જલ્દી વસુકે છે. આ ત્રણેય રીતોમાં છેલ્લા દોહન પછી આંચળ ધોઈને કોલોડીયનમાં બોળવા. આમ કરવાથી આંચળની નળીકાનો છેલ્લો ભાગ બંધ થઈ જશે જેથી જંતુઓનો આઉંમાં પ્રવેશ થઈ ચેપ લાગશે નહિ.

(ક) અધુરું દોહવું : આ પદ્ધતિમાં વસુકાવવાની શરૂઆતમાં બાવલાંમાં જે દૂધ પેદા થતું હોય તે બધું પૂરેપુરુષ ન દોહી લેતાં થોડું દૂધ બાવલામાં રહેવા દેવામાં આવે છે. આથી બાવલામાં આંતરિક દબાણને લીધે દૂધ ઉત્પાદન થવાનું કાર્ય મંદ પડે છે. ત્યારબાદ પશુને શરૂઆતમાં એક દિવસને આંતરે, પછી બે દિવસને આંતરે, એમ દોહતાં દૂધ ઉત્પાદન તદ્દન ઓછું થઈ જાય એટલે દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.

(ખ) આંતરે દિવસે દોહવું : વસુકાવવાની આ પદ્ધતિમાં સૌ પ્રથમ દોહનનો સમય બદલાવવામાં આવે છે. ત્યારબાદ એક વખત દોહવામાં આવે છે. પછીથી બે દિવસે એક વખત અને દર ત્રણ દિવસે એક વખત દોહન કરવાથી ધીમે ધીમે દૂધ ઉત્પાદન ઘટે છે. દૂધ ઘટી જતા દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.

(ગ) એકાએક દોહન બંધ કરવું : વસુકાવવાની રીતો અંગે થયેલ સંશોધનોને પરિણામે માલૂમ પડ્યું છે કે, વસુકાવવાની આ રીત સૌથી શ્રેષ્ઠ છે. પશુ રોજનું લગભગ ૧૦ લિટર દૂધ આપતું હોય તો પણ એને એકાએક દોહન બંધ કરી દઈને વસુકાવવામાં કોઈ વાંધો આવતો નથી. આ પદ્ધતિમાં ગાય-ભેંસને એકાએક દોહવાનું બંધ કરી દેતાં બાવલામાં દૂધનો ભરાવો થઈ આંતર દબાણ વધે છે. આથી દૂધ ઉત્પાદન થવાની કિયા બંધ પડી જાય છે. નવું દૂધ ઉત્પસ નહીં થતાં બાવલામાં બેગું થયેલું દૂધ ધીરે ધીરે લોહીમાં શોખાઈને પશુ વસુકી જાય છે. આ રીતમાં દૂધ બાવલામાંથી લોહીમાં શોખાતું હોય ત્યારે પશુને દોહવું જોઈએ નહીં.

(૮) પાણીની વ્યવસ્થા :

દૂધાળ પશુ સખ્ય પરિશ્રમ કરનાર પ્રાણી છે. વળી તેઓ જે દૂધ પેદા કરે છે તેની મારફતે પણ ઘણું પાણી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી દૂધાળ પશુને બિન ઉત્પાદક પશુઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની જરૂર પડે છે. પશુને પીવાના પાણીની જરૂરિયાત વાતાવરણનું ઉષ્ણતામાન, ખોરાક દ્વારા મળતાં પાણીનું પ્રમાણ, દૂધ ઉત્પાદનનું પ્રમાણ, પાણીનું ઉષ્ણતામાન અને પાણીની સ્વચ્છતા પર આધાર રાખે છે. સામાન્ય રીતે દૂધાળ પશુ દૈનિક સરેરાશ માથાઈઠ ઉપ-૪૦ લિટર પાણી ઉપરાંત વધારામાં દર એક લિટરે દૂધે બે થી ત્રણ લિટર પાણી પીએ એવો અંદાજ છે. પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલ છે કે દૂધાળ પશુને છૂટથી પાણી પીવડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને મન ફાવે ત્યારે પાણી પીએ તો અવશ્ય દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. આ શક્ય ન હોય તો અવશ્ય દિવસમાં ઓછામાં ઓછું ચાર વાર તો પાણી પીવડાવવું જોઈએ.

(૯) કસરત :

દૂધાળ પશુને દરરોજ એકાદ કિલોમીટર ફેરવીને કસરત આપવી જોઈએ. જ્યાં બીડની વ્યવસ્થા છે ત્યાં પશુને ચરાવીને પણ કસરત આપી શકાય છે. પશુને પ્રમાણસર કસરત આપવાથી દૂધ ઉત્પાદન અને ચરબીના પ્રમાણમાં વધારો થાય છે.

(૧૦) હાથીયો કરવો :

દૂધાળ ગાય-ભેંસને શક્ય હોય તો દરરોજ નવાડીને સાફ રાખવા જોઈએ. આ શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત અવશ્ય નવાડાવવાં જોઈએ. આ ઉપરાંત દૂધાળ પશુને દોહન કાર્ય કરતાં પહેલા હાથીયો કરવો જોઈએ જેથી શરીર ઉપર ચોટેલું છાણ, માટીના રજકણ, વાળ વગેરે દૂર થઈ જાય. આ પ્રમાણે કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે જેથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.

(૧૧) સ્વાસ્થ્ય સંરક્ષણ :

દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ નાના મોટા પશુઓ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. આ માટે દરેક પશુઓને વર્ષમાં એકવાર ક્ષય, ચેપી ગર્ભપાત અને જોન્સ જેવા રોગો માટે તપાસવા જોઈએ. જો કોઈપણ રોગ માલૂમ પડે તો તેવા પશુઓને તુરત ૪ ટોણામાંથી નિકાલ કરવો. વળી ગળસૂંઠો અને ખરવા-મોવાસા જેવા પ્રચલિત રોગો ન આવે તે માટે જે તે રોગ પ્રતિકારક રસી જે તે સમયે અચૂક મુકાવી દેવી. જો સંકર ગાયો કે પરદેશી ઓલાદની ગાયો રાખવામાં આવી હોય તો આવા પશુઓને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસુ પુરુ થયા પછી એક વર્ષમાં બે વાર આંતર પરોપજીવીનાશક ઔષધ આપવાં. આ ઉપરાંત આ પશુઓને જુવા, ઈતરડી વગેરે ન લાગે તે જોવું ખાસ જરૂરી છે.

(૧૨) દૂધાળ પશુઓનું નિરીક્ષણ :

ત્રીજો જમીન તથા પાણી ચકાસણી માટેનો સર્ટીફિકેટ કોર્સ (૨૧ દિવસ)

કૃષિ રસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ત્રીજો 'Certificate Course on Soil and Water Testing for Sustainable Agriculture' તા. ૦૧-૦૨-૨૦૧૬ થી ૨૧ દિવસ માટે શરૂ થનાર હોઈ લઘુતમ લાયકાત ધો-૧૦ અભ્યાસ ધરાવતા અરજદારે તા. ૨૫-૦૧-૨૦૧૬ સુધીમાં ફોર્મ ભરી આચાર્યશ્રી, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ને મોકલી આપવાનું રહેશે. ફોર્મ : www.aau.in અથવા અત્રેના વિભાગમાંથી મળી રહેશે. કોર્સના અંતે યુનિવર્સિટી દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવશે.

નોંધ : અગાઉ પ્રથમ તથા બીજા કોર્સમાં જોણે અરજી કરેલ હોઈ તેણે પણ નવેસરથી અરજી કરવી.

વધુ માહિતી માટે સંપર્ક - ફોન : (૦૨૬૮૮) ૨૨૫૭૪૨ / ૨૨૫૭૪૧

- આચાર્ય અને ડીન, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ

ખેડૂતમિત્રો જોગ

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકના બં.અ. કૃષિ મહાવિદ્યાલયના એચ્રોનોમી ફાર્મ ખાતે ઘઉં જીડબલ્યુ-૪૮૬ (ફાઉનેશન) જાતના બિયારણનું વહેલા તે પહેલાના ધોરણે વેચાણ ચાલુ છે.

સંપર્ક : ફોન : (૦૨૬૮૮) ૨૬૧૭૨૩, ૨૬૨૭૨૩ અને ૨૬૧૦૭૬

-પ્રાધ્યાપક અને વડા, એચ્રોનોમી વિભાગ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ

કપાસની સાંઠીમાંથી વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટ બનાવો

ડૉ. કે. એન. અકબરી ડૉ. જ. એસ. સુતરીયા શ્રી વી.ડી. વોરા

સૂકી ખેતી સંસોધન કેન્દ્ર

જૂનાગઢ કૃષ્ણ યુનિવર્સિટી, તરધીયા (રાજકોટ) - ૩૬૦૦૦૩

ફોન : (૦૨૮૧) ૨૭૮૪૨૬૦, ૨૭૮૪૭૨૨



સંશોધનના પરિણામે કપાસની બીટી જાતોના આગમનથી કપાસના વાવેતરમાં અનેક ગણો વધારો થયો છે. મોટા ભાગના બેદૂતો બધી વીળી પુરી થયા પણી કપાસની સાંઠી સમય અથવા ખર્ચ બચાવવા જેતરમાં જ બાળી નાખે છે અથવા શેઠેપાણે ઢગલા કરી દે છે. બેદૂતમિત્રો, આપશ્રીએ ક્ષોરય વિચાર કર્યો છે કે આપ જેને દિવાસળી ચાંપો છો કે જ્યાં તાં ફેંકી વેડફી નાખો છો તેમાં શું શું છે? હકીકતમાં તે સેન્દ્રિય તત્વ અને પાકને જરૂરી પોષક તત્વોનો અમૂલ્ય બજાનો છે.

કપાસની સાંઠીના બંધારણની વાત કરીએ ત્યારે પાક પોષણની પ્રાથમિક માહિતીની જાણકારી ખૂબ જ જરૂરી છે. જમીન પર ઉગાડવામાં આવતા કોઈપણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ-કૂલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરિયાતની માત્રા અલગ હોય છે. જરૂરિયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે.

(ક) મુખ્ય તત્વો : નાઈટ્રોજન, ફોર્ઝરસ અને પોટાશ કે તેની પાકને વધુ જથ્થામાં જરૂર પડે છે.

(ખ) ગૌણ તત્વો : કેલ્વિયમ, મેનેશિયમ અને ગંધકની મુખ્ય તત્વોના પ્રમાણમાં ઓછા જથ્થામાં જરૂર પડે છે.

(ગ) સૂક્ષ્મ તત્વો : જેવા કે લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન વગેરે. આ બધા તત્વો સામાન્ય રીતે ખૂબ જ અલ્ય જથ્થામાં જરૂરી છે.

આ બધા પોષક તત્વો પાક દ્વારા જમીનમાંથી અવશોષણ થતા હોય છે.

છેલ્લા બે દાયક દરમ્યાન રાસાયણિક ખાતરનો વપરાશ ફૂદકે અને ભૂસકે વધતો જાય છે પરિણામે જમીનની ઉત્પાદકતા ઘટતી જાય છે. જમીનનું ભૌતિક બંધારણ ખરાબ થતું જાય છે તથા જૈવિક કાર્યવાહી મંદ પડતી જાય છે. તેમજ સાથે સાથે રાસાયણિક ખાતરોના ભાવ વધતા જાય છે. આવા સંજોગોમાં રાસાયણિક ખાતરોની અવેજ તરીકે અને જમીનની ઉત્પાદકતા ટકાવી રાખવા આપણી પાસે ખેત ઉત્પાદનની આઉપેદાશનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. જો તેનો વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટ બનાવી સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો છોડને પુરતા પ્રમાણમાં જરૂરી બધા પોષક તત્વો મળી રહે, જમીનનું બંધારણ જાળવી શકાય, સૂક્ષ્મજીવાણું ઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય તેમજ પાક ઉત્પાદન અને જમીનની ફળદુપતા કાયમી રીતે જાળવી શકાય છે.

સમતોલ પ્રમાણનો મુખ્ય સ્વોત સેન્દ્રિય ખાતર છે. આશરે બે દાયક પહેલા તેનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હતો હાલ શહેર તરફની તેમજ ખેતી સાથે પશુપાલન પ્રત્યે નારાજગીને કારણે પશુધનનું પ્રમાણ ઘટતું જાય છે. પરિણામે છાણીયા ખાતરના વપરાશમાં અત્યંત ઘટાડો થયેલ છે. સાથે સાથે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ, વધુ ઉત્પાદન આપતા સુધારેલ અને સંકર બિયારણોના વપરાશ અને બેદૂતો, વિસ્તરણ કાર્યકારો, કૃષિ વૈજ્ઞાનિકોના સંકલિત

પ્રયત્નોના ફળ સ્વરૂપે એકમ વિસ્તારમાં એકમ સમયમાં પાક ઉત્પાદનમાં અનેકગણો વધારો થયેલ છે. જેના પરિણામે જમીનમાંથી બધા જ પ્રકારના પોષક તત્વોનું અવશોષણ પણ અનેકગણું વધી ગયેલ છે. પ્રવર્તમાન સમયમાં પાક પોષણ માવજતનો વિચાર કરીએ તો ફક્ત યુરિયા, ડીએપી, એનપીકે, એમોનિયમ સલ્ફેટ અને કેન વગેરે સાંડ રસાયણિક ખાતરોના વપરાશમાં અનેકગણો વધારો થતો જાય છે. મતલબ કે આપણે ફક્ત નાઈટ્રોજન, ફોસ્ફરસ અને અમુક સંજોગોમાં પોટાશ તત્વા જ ઉમેરીએ છીએ. બેદૂતોની આર્થિક પરિસ્થિતિ સારી હોય અને પાક પોષણ અન્વયે વધુ ખર્ચ કરવાના સંજોગોમાં પણ એકર દીઠ ફક્ત સાંડ રસાયણિક ખાતરના વપરાશમાં વધારો કરે છે. પરિણામે અન્ય ગૌણ અને સૂક્ષ્મ તત્વોની ખામી ઊભી થવાની શક્યતા છે અને પોષક તત્વોની અસમતોલતા ઊભી થાય છે. પરિણામે અવશોષણ ઉપર વિપરીત અસર થાય છે. આવા સંજોગોમાં અન્ય માવજતો સારી રીતે કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં ઘટ પડે છે તેમજ ઉત્તરતી ગુણવત્તાવાળું પાક ઉત્પાદન મળે છે. આથી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બધા જ આવશ્યક પોષક તત્વો સમતોલ માત્રામાં પુરા પાડવા જરૂરી છે. ઉપરાંત સેન્દ્રિય/કાર્બનન્યુક્ટ અવશોષો/સ્ત્રોતો ઉમેરવા જરૂરી છે જેથી છોડ જમીનમાં રહેલ પોષક તત્વોનું સરળતાથી અવશોષણ કરી શકે. જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારી શકાય. ઉપરાંત સેન્દ્રિય તત્વ, પાણીનું અવશોષણ, નિતાર, જમીનમાં હવાની અવર જવર અને છોડને પાણીની લભ્યતા વગેરે બાબતોમાં ખૂબ જ અગત્યનું છે. તેમજ જમીનમાં જરૂરી ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુંઓના ખોરાક માટે અગત્યનો ભાગ બજ્યે છે. ઉપરાંત જમીનનું ભરભરાપણું અને ખેતીકાર્યોની સરળતા માટે સેન્દ્રિય તત્વ ખૂબ જરૂરી છે. ખૂબ જ મહત્વની બાબત એ છે કે આ પદાર્થો સીન્થેટિક રીતે કૃત્રિમતાથી બનાવી શકાતા નથી. તેમજ વ્યાપારી રીતે બજારમાં મળતા નથી. આથી કુદરતી રીતે ઉત્પન્ન થયેલ સેન્દ્રિય પદાર્થ જેવા કે કપાસની સાંઠી અને કચરો

બાળીને અથવા અન્ય રીતે વેડફી નાખીએ નહીં અને તેનો વ્યવહાર ઉપયોગ કરવાનો નિરધાર કરીએ.

બેદૂતમિનોને એક વાત ધ્યાનમાં બેસી જ ગઈ હશે કે જમીનમાંથી કપાસના પાક દ્વારા અવશોષિત થયેલ પોષક તત્વો છોડના બધા ભાગો જેવા કે રૂ, કપાસ, પર્ણો, ડાળી વગેરે સંધળા ભાગોમાં વહેંચાયેલ હોય છે. કપાસ દ્વારા અવશોષિત થયેલ પોષક તત્વોનો (કોઠામાં દર્શાવ્યા મુજબ)નો સામાન્ય રીતે અડધો અડધ જ્યથો સાંઠીમાં હોય છે. બજારમાંથી લાવીને ઉપયોગ કરેલ રસાયણિક ખાતરની જ ગણતરી કરીએ તો બેદૂતો એકરે આશરે ૨૦૦૦-૨૫૦૦ રૂપિયાનું ખાતર વાપરે છે. મતલબ કે આશરે ૧૦૦૦-૧૨૦૦ રૂપિયાનું ખાતર કપાસની સાંઠીમાં હોય છે. ઉપરાંત સલ્ફર, પોટાશ, સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, જસત, કોપર, મોલિઝેનમ, બોરોન અને છોડમાં રહેલ ૮૫ થી ૮૨ ટકા સેન્દ્રિય (કાર્બન, હાઈટ્રોજન અને ઓક્સીજન) તત્વનો છિસાબ બાકી રહે છે. તેની કિમત કરવાની કસરત કરવા બેદૂત ભાઈઓને આહવાન છે. બોલો, હવે સાંઠી બાળવાનો વિચાર ચાલુ રાખીશું? સાંઠી બાળીશું નહિ તો અતે જીણાવેલ ફાયદા મેળવવા કાંઈ તો કરીશું ને? કપાસની સાંઠીનું શું કરીશું? કમ્પોસ્ટ ખાતર બનાવીશું? તો આવો કપાસની સાંઠીમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવીએ.

કમ્પોસ્ટ :

સેન્દ્રિય પદાર્થોનું હવા, ભેજ અને સૂક્ષ્મજીવાણુંઓની હાજરીમાં જૈવિક રૂપાંતર થાય તેને કમ્પોસ્ટ કહેવાય છે.

કમ્પોસ્ટ બનાવવા માટે પાયાન ખોત, કપાસની સાંઠી અને પશુઓના મળમૂત્ર/ગોબર ગેસની રબડી/ઘેટા બકરાની લીંડી/મરધા બતકાની હગાર છે.

કમ્પોસ્ટ કચાં બનાવશો ?

વાડીએ પશુઓની કોઢ અને પાણીના ખોતની

ક્રમ	પોષક તત્વો	કપાસના છોડમાં પોષક તત્વોનું પ્રમાણ (%)	કપાસના પાક દારા એકરે પોષક તત્વોનું જમીનમાંથી અવશોષણ
૧	નાઈટ્રોજન	૨.૨-૨.૫	૧૦૦ થી ૧૫૦ (ક્ર./એકર)
૨	ફોસ્ફરસ	૦.૩૧ - ૦.૪૬	૧૦ થી ૨૦ (ક્ર./એકર)
૩	પોટાશ	૦.૫ - ૧.૨૫	૧૪૦ થી ૨૫૦ (ક્ર./એકર)
૪	ક્રેલિયમ	૧.૨૫-૨.૨૫	-
૫	મેગ્નેશિયમ	૦.૧૫ - ૦.૩૦	-
૬	સલ્ફર	૦.૧૮-૦.૪૦	૧૦ થી ૨૦ (ક્ર./એકર)
૭	મેંગેનીઝ	૩૦-૨૦૦ પીપીએમ	૨૫ થી ૧૦૦ (ગ્રામ/એકર)
૮	લોહ	૪૦-૫૦૦ પીપીએમ	૨૦૦ થી ૮૦૦ (ગ્રામ/એકર)
૯	જસ્ત	૨૦-૪૦ પીપીએમ	૩૦ થી ૫૦ (ગ્રામ/એકર)
૧૦	ક્રોપર	૧૧-૧૭ પીપીએમ	૧૫ થી ૨૫ (ગ્રામ/એકર)
૧૧	બોરોન	૨૧-૮૦ પીપીએમ	૨૦ થી ૩૦ (ગ્રામ/એકર)
૧૨	મોલિઝનમ	૦.૫ - ૦.૬૦ પીપીએમ	૫ થી ૧૦ (ગ્રામ/એકર)

નજીક વૃક્ષો નીચે વરસાદ અને તાપથી રક્ષણ મળે તેવી જગ્યાએ ૧ મીટર ઊંડાઈ, ૧.૫ મીટર પહોળાઈ અને કપાસની સાંઠીની ઉપલબ્ધતા મુજબ ૫ થી ૩૦ મીટર લંબાઈનો ખાડો તૈયાર કરવો.

ક્રમોસ્ટ કઈ રીતે બનાવશો ?

- (૧) કપાસની સાંઠી જેતરમાંથી ઉપાડી તેના ટ્રેકટર/ઇલેક્ટ્રિક મોટર સંચાલિત શેડરથી નાના ૫-૬ સે.મી. લંબાઈના ટુકડા કરો.
- (૨) ત્યારબાદ તૈયાર કરેલ કપાસની સાંઠીના ટુકડાનો ૧૦ થી ૧૫ સે.મી.નાં ઊંચાઈનો પ્રથમ થર કરો. આ થર વ્યવસ્થિત ભીજાય એ રીતે પાણીનો છંટકાવ કરવો.
- (૩) આ રીતે તૈયાર કરેલ સાંઠીના ૧૦ થી ૧૫ સે.મી.ના થરમાં તેના વજન મુજબ ક્રમોસ્ટ કલ્યર ૫૦૦ ગ્રામ પ્રતિ ટન પ્રમાણે + યુરિયા (૦.૫ ટકા નાઈટ્રોજન મુજબ) + ગાયનું છાણા/પશુઓના મળમૂત્ર /ગોબર રબડી / ઘેટાં-બકરાંની લીધી/મરધા બતકાની હગાર/જૂનું ક્રમોસ્ટ ૨૦ ટકા+ રોક ફોસ્ફેટ/સિંગલ સુપર ફોસ્ફેટ ૫ ટકા તથા એરંડી અને લીંબોળીનો ખોળ ત

ટકા પ્રમાણે યોગ્ય ભેજ જળવાઈ રહે તે રીતે પાણી છાંટતા-છાંટતા ઉમેરો.

- (૪) આ રીતે કપાસની સાંઠીની ઉપલબ્ધતા પ્રમાણે પ્રથમ થરનું પુનરાવર્તન કરી ત થી ૪ થર બનાવી ખાડાને પુરેપુરો ભરી દો. છેલ્લો થર જમીનની સપાટી થી ૦.૫ મીટર ઉપર આવે ત્યારે ગોરાહુ માટી/મુરમથી પુરી ઢેવી.
- (૫) લગભગ ૬ થી ૭ દિવસમાં ગરમી ઉત્પત્ત થશે. થોડા દિવસ પછી ૬૦° થી ૭૦° ઉષ્ણતામાન થશે અને આવત્જવી વિઘટન થશે.

- (૬) ઢોઢેક મહિના બાદ ઉપરથી નીચે સુધીનો સરખો આડહેદ લઈ અર્ધકોહવાયેલ પદાર્થો બહાર કાડો અને બીજો ખાડો ખાલી હોય તો તેમાં ઉમેરતા જાઓ અથવા તે જ ખાડામાં ફરીથી ભરો. ત્યારબાદ એક મહિના પછી ફરીથી પદાર્થો બહાર કાઢો. બીજીવાર ભરતી વખતે એઝોટોબેકટર અને ફોર્સ્ફોબેકટર બેક્ટેરીયાના કલ્યરનો ૫૦૦ ગ્રામ પ્રતિ ટન મુજબ છાણાની રબડીમાં મિશ્ર કરી છંટકાવ કરતા જાઓ. તેમજ સાથે સાથે જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ

કરતા જાઓ અને ખાડાને પુરેપુરો ભરી દો. સૌથી ઉપરનાં થરને મોરમ અથવા મારીથી વ્યવસ્થિત ટાંકી દો.

(૭) આમ આશરે ૫ મહિના બાદ કોહવાયેલ પદાર્થો બહાર કાઢો અને જે વેરા ભુખરા રંગના પાઉડર બની જાય છે જે સારું કમ્પોસ્ટ તૈયાર થયાની નિશાની છે. થોડો સમય બહાર રહેવા દો. આમ કરવાથી દુર્ગંધ ઉડી જાય છે. અને સારી સુગંધ આવવા લાગે છે. તથા આ રીતે તૈયાર કરેલ ખાતરને સંપૂર્ણ સુકાવા ન દેતાં તેમાં ૧૫ થી ૨૦ ટકા ભેજ જાળવવો અને ખાતરને ચારણાથી ચાળીને પછી જ ઉપયોગમાં લેવું. ચારણાની ઉપરના અપારિપ્કવ ખાતરને ફરીથી ખાડો ભરતી વખતે ઉપયોગમાં લેવું.



ખેડૂતમિનો, આ વાત મગજમાં બેઠી. અમે આશા રાખીએ કે કપાસની સાંઠિના ખૂમાડા બંધ થશે. હજુ શંકા કુશંકા જેવું કાંઈ હોય તો આવો સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, તરધીયા ખાતે નિવારણ અવશ્ય મળશે.

આ રીતે કપાસની સાંઠિ કે જે પાક પોષણ અને સેન્ટ્રિય તત્વોનો અમૂલ્ય ખજાનો છે તેનો બાળવાને બદલે સદાઉપયોગ કરી ખાતર બનાવીશું અને જમીનની તંદુરસ્તીમાં સુધારો કરીશું.

આ રીતે તૈયાર કરેલ કમ્પોસ્ટ વાપરવાથી જમીનનું બંધારણ સુધરે છે જમીનમાં હવા અને પાણીની અવરજવર વધે છે. મુખ્ય ગૌણ તથા સૂક્ષ્મ તત્વો તેમજ છોડના વૃદ્ધિકારકોની લભ્યતામાં વધારો થાય છે. નાઈટ્રોજન સ્થિરીકરણ અને ફોર્સફરસની લભ્યતામાં વધારો થાય છે. ઉપયોગી સૂક્ષ્મ જીવાણુંઓની કાર્યક્ષમતા વધે છે જેથી જમીનમાં હ્યામસ વધે છે. આ રીતે ભૌતિક, રાસાયણિક તથા જૈવિક પ્રક્રિયાઓ દ્વારા પાકનો વિકાસ સારો થાય છે અને પાક ઉત્પાદન વધે છે. સારી ગુણવત્તા, ઉત્તમ સ્વાદ અને બજાર ડિમાન્ડ નીચી મળે તેવું પાક ઉત્પાદન મળશે જેની નિકાસ માટે માંગ વધે છે. કમ્પોસ્ટ વાપરવાથી ખુબ જ મહત્વનો ફાયદો એ છે કે જમીનની ઉત્પાદકતા કાયમી જળવાઈ રહે છે તથા વાતાવરણમાં પ્રદૂષણો ઘટાડો થાય છે અને પશુ અને માનવીની તંદુરસ્તી જળવાઈ રહે છે.

તંદુરસ્ત જમીન તંદુરસ્તી પાક તંદુરસ્ત પશુ અને માનવી

પશુપાલકોના હિતમાં....

પશુપોષણશાસ્ત્રીઓ દ્વારા ઉત્પાદિત કરેલું વિસ્તાર મુજબનું ‘અનુભવ ચીલેટેડ મિનરલ મિક્સયર’ તમામ વર્ગનાં પશુઓની તંદુરસ્તી, પ્રજનન અને દૂધ ઉત્પાદન માટે સર્વોત્તમ છે. રસ ધરાવતા પશુપાલકો સંશોધન વૈજ્ઞાનિકશી અને વડા, પશુપોષણ વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦ (ફોન : ૦૨૬૮૨-૨૬૩૪૪૦) ખાતેથી વ્યાજબી ભાવે મેળવી શકશે.

નોંધ : વધુ જથ્થામાં જરૂરિયાત હોય તો અગાઉથી નોંધાવી જે તે રકમ ભરી સમયસર મેળવી લેવા ખેડૂતમિનોને વિનંતી.

પશુપાલકો માટેનું વાર્ષિક ક્લેન્ડર

ડૉ. એન.બે.જોધી ડૉ. કે.જે.અંકુયા ડૉ. કે.બી.પ્રજાપતિ

ડૉ. આર.એમ.પટેલ ડૉ. જે.બી.પટેલ

પશુ સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃપિ યુનિવર્સિટી, સરદારકૃપિનગર - ૩૮૫૪૦૯

ફોન : (૦૨૭૪૮) ૨૭૮૪૬૭



(૧) જાન્યુઆરી (પોષ) :

- ◆ દેશી ગાયોનું સિદ્ધ થયેલ આખલા થકી બીજદાન-પ્રજનન કરાવવું (અપગ્રેડેશન)
- ◆ ખરવા-મોવાસા રોગની રસી મૂકાવવી.
- ◆ ખાલી-ગાભણ ચેકઅપ કરાવવું વારંવાર ઉથલા મારતા પશુઓનું ચેકઅપ કરાવવું.
- ◆ યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરી બાબ્ય પરોપજીવીઓનું નિયંત્રણ કરવું.
- ◆ પશુઓનો વિમો લેવો.
- ◆ મકાઈની ધાસચારા માટે વાવણી કરવી.
- ◆ પશુઓનું ઠીઠીથી રક્ષણ કરવું.

(૨) ફેબ્રૂઆરી (મહા) :

- ◆ ખરવા-મોવાસા રોગની રસી મૂકાવવી. જે પશુઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રસી મૂકાવેલ હોય તેવા પશુઓને ફરીથી રસી અપાવવી.
- ◆ બાબ્ય અને અંત:પરોપજીવીનું નિયંત્રણ કરવું.
- ◆ કૂત્રિમ બીજદાન કરાવવું અને ગર્ભધારણ ન કરેલા હોય તેવા પશુઓને પશુડોક્ટર પાસે સારવાર કરાવવી, ગર્ભ પરીક્ષણ કરાવવું.
- ◆ મકાઈ અને મહિનાના છેલ્લા અઠવાદિયા દરમિયાન

ભારતીય બેડૂત કૃપિ અને સામાજિક કામોમાં વ્યસ્ત રહેવાથી સતત દબાણમાં રહે છે જેના કારણે પશુપાલનના કામોની જાણે અજાણે અવગણના થતી હોય છે આનાથી પશુપાલનમાં આર્થિક ફટકો પડે છે એટલે પશુપાલકો દ્વારા આભા વર્ષ દરમિયાન શું શું કરવું તેનું માસિક ક્લેન્ડર રજૂ કરેલ છે. આને વાંચવાથી વારંવાર જોવાથી પશુપાલકો યાદ રહેશે અને યાદ આવશે કે કયાં મહિનામાં શું કરવું છે. પશુઓને લીલોચારો આખ્ય વર્ષ મળી રહે તે ખૂબ જ અગત્યનું હોઈ તે પ્રમાણે આયોજન કરવું. મકાઈ ગણ ઋતુમાં થતો ખૂબ જ પોણીક ધાસચારાનો પાક હોવાથી જરૂરિયાત મુજબ દરેક મહિનામાં વાવી લીલો ધાસચારો મેળવી શકાય. વાર્ષિક ક્લેન્ડરમાં જુદા-જુદા મહિનાઓ દરમિયાન પશુપાલકોને ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વિગતો આ લેખમાં આપેલ છે.

૨૪કાબાજરીની પશુના ચારા માટે વાવણી કરવી.

- ◆ દેશી ગાયોનું સંકરણ કરાવવું તેમજ દેશી અથવા ખરાબ સાંઘનું ખસીકરણ કરાવવું.
- ◆ સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવું.
- ◆ જે લેંસો વેતરે ન આવતી હોય તેની સારવાર કરાવવી.

◆ વધારાનાં ધાસચારાનું સાયલેજ બનાવવું.

(૩) માર્ચ (ફાગાળ) :

- ◆ પશુ રહેઠાણને સ્વચ્છ કરી જંતુમુક્ત કરવું.
- ◆ વાઇરડાઓનું ખસીકરણ કરાવવું.
- ◆ મકાઈ/રજ્કાબાજરી/જુવાર/ચોળીનું વાવેતર કરવું.
- ◆ રજ્કાના પાકને બીજ ઉત્પાદન માટે રાખવો.
- ◆ ખેતાંઓજારોની મરામત કરાવવી.
- ◆ ધઉનું ભૂસું લાવીને સંગ્રહ કરવો.
- ◆ પશુઓને ખનીજ યુક્ત ચાટણ ઈંટ ચટાડવી.

(૪) એપ્રિલ (ચૈત્રા) :

- ◆ ઉનાળું લીલા ધાસચારાની વાવણી કરવી.
- ◆ પશુઓને કૂમિનાશક દવાઓ પિવડાવવી.

- ◆ લીલા ધાસચારા માટે મકાઈ/રજકા બાજરી/જુવાર/ ચોળા વરોરેની વાવણી કરવી.
- ◆ પશુના છાણનો ઉપયોગ કરી જૈવિક ખાતર (વર્મિકમ્પોસ્ટ) તૈયાર કરાવવું.
- ◆ પોતાના ઘરે કે ફાર્મ ઉપર ગોબરગેસની સ્થાપના માટેનો ઉત્તમ સમય.
- ◆ ગર્ભધારણ માટે કૂન્ઠિમ બીજદાન કરાવવાનો આગ્રહ રાખવો. દેશી ગાયોનું વેતર આવવાનું ધ્યાન રાખવું.
- ◆ ઘઉના ભૂસાની ખરીદી કરો.
- ◆ પશુઓમાં બાબ્ય પરોપજીવી જેવાં કે ઈતરડી અને જૂઓનું નિયંત્રણ કરવું.

૫. મે (વેશાખ) :

- ◆ ગણસૂંદો અને ગાંઠીયા તાવની રસી મૂકાવવી.
- ◆ બાયપાસ ફેટ (૨ થી ૩ ટકા) દાણ સાથે ખવડાવવું.
- ◆ પશુઓને પાણી આપવાનું આવર્તન વધારવું તથા નવડાવવું.
- ◆ પશુઓને લૂથી બચાવવા માટે પશુ આવાસનાં પતરાં પર ધાસકુસ ઢાંકવા.
- ◆ પરોપજીવીઓનું નિયંત્રણ કરવું.
- ◆ પશુને દાણ સાથે મીહું પણ ખવડાવવું.
- ◆ લીલા ધાસની અવેજ્ઞામાં સાયલેજ ખવડાવવું.
- ◆ જૈવિક ખાતર (વર્મિકમ્પોસ્ટ) તૈયાર કરાવવું.
- ◆ ઘઉના ભૂસામાં મીઠાનું દ્રાવણ નાખીને ખવડાવવું.
- ◆ પશુઓને ખનીજ યુક્ત ચાટણ ઈંટ ચટાડવી.
- ◆ લીલા ધાસચારાની વ્યવસ્થા માટે જુવાર, મકાઈ, બાજરી, ચોળા તથા હાઈબ્રિડ નેપિઅરની વાવણી કરવી. બિયારણના રજકાની કાપણી કરવી.

(૬) જૂન (જેટ) :

- ◆ પશુઓને લૂથી બચાવવા તેમજ લીલો ધાસચારો

- ◆ પૂરતી માત્રામાં આપો.
- ◆ કૂભિની દવા પીવડાવો.
- ◆ લીલા ધાસચારા માટે મકાઈ, બાજરી, જુવાર, ચોળાની વાવણી કરવી.
- ◆ છાંયડાવાળા વૃક્ષોની રોપણી માટે ખાડા ખોદી તૈયારી કરવા.
- ◆ પશુઓને સાયલેજ ખવડાવવું.

(૭) જુલાઈ (અષાઢ) :

- ◆ ખરીફ ચારાની વાવણી અને તે વિષે જાણકારી મેળવવી.
- ◆ પશુઓને વરસાદ સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરવી.
- ◆ મિનરલ મિક્સર પાઉડર ખવડાવવો.
- ◆ વિયાણમાં આવેલ પશુની કાળજ લેવી.
- ◆ પશુ રહેઠાણ અને વાડાની આજુબાજુ છાંયાદાર વૃક્ષો ઉછેરવા.
- ◆ લીલા ધાસચારા માટે મકાઈ, બાજરી, જુવાર, ચોળા, નેપિયર ધાસ અને સંકર બાજરીની વાવણી કરવી.

(૮) ઓગાષ (શ્રાવણ) :

- ◆ લીવરનાં કૂભિની દવા પીવડાવવી.
- ◆ ગાભણ પશુઓની સારસંભાળ રાખવી.
- ◆ વિયાણ સમય નજીક આવવા થયેલ પશુઓની ખાસ કાળજ રાખવી.
- ◆ વિયાયેલ પશુને અજમો, સુંઠ, ગોળ, સવા ખવડાવો અને દેખભાળ કરવી કે મેલી પડી છે કે નથી પડી.
- ◆ પશુ રહેઠાણને વરસાદથી બચાવવું અને ચૂનો તથા બેડીંગ મટીરિયલનો ઉપયોગ કરવો.
- ◆ વરસાદના પાણીનો સંગ્રહ કરવો.

- ◆ સ્વર્ણ દૂધ ઉત્પાદન માટે કાળજી લેવી.
- ◆ લીલા ધાસચારા માટે જુવાર, મકાઈ અને સૂર્યમુખીની વાવણી કરવી. છેલ્લા અઠવાડિયામાં શક્ય હોય તો સાયલેજ બનાવવું.

(c) સાટેમ્બર (ભાદરવો) :

- ◆ વિચાષ બાદ ૧ થી ૧.૫ કલાકમાં ગાય-ભેંસના બચ્ચાને ખીરુ પીવડાવવાનો સંગ્રહ રાખવો.
- ◆ પાડા અને વાણીઓને કૂમિનાશક દવાઓ પીવડાવવી.
- ◆ નાના બચ્ચામાં સર્ફેટ ઝાડાના નિયંત્રણ માટે પ્રતિજૈવિક દવાઓ આપવી.
- ◆ બાવલાનાં રોગોની તપાસ કરાવી તેની યોગ્ય સારવાર કરાવવી.
- ◆ વધુ દૂધ આપતાં પશુઓની ખાસ કાળજી રાખવી.
- ◆ લીલા ધાસચારા માટે મકાઈ અને સૂર્યમુખીની વાવણી કરવી. જરૂરિયાત મુજબ પ્રથમ પખવાડિયામાં સાયલેજ બનાવવું.

(10) ઓક્ટોબર (આસો) :

- ◆ નવજાત બચ્ચાને ખીરુ પીવડાવો.
- ◆ પશુઓનું સ્વર્ણ પરીક્ષણ કરાવવું.
- ◆ લીલો ધાસચારો (મકાઈ, જુવાર અને અન્ય) વધુ હોય તો સાયલેજ બનાવવું.
- ◆ પરાળને યુરિયા પ્રક્રિયા કરીને પૌણિક બનાવવો.
- ◆ નવજાત બચ્ચાની ઉચ્ચિત દેખભાળ કરો.
- ◆ પશુઓને સ્વર્ણ, જંતુ સહિત, નિર્મળ પાણી પીવડાવવું.
- ◆ પશુઓને ખનીજ ઈંટો ચટાડવી.
- ◆ પશુ રહેઠાણની સફાઈ કરી, ચૂનો લગાડવો.

- ◆ મહિનાનાં છેલ્લા અઠવાડિયાથી ઓટ, બાજરી, મકાઈ, બરસીમ, ૨જકો, સૂર્યમુખી અને ચિકોરીની વાવણી કરવી.

(11) નવેમ્બર (કારતક) :

- ◆ ખરવા-મોવાસાની રસી અપાવવી.
- ◆ કૂમિનાશક દવા પીવડાવવી.
- ◆ પશુઓને સમતોલ આહાર આપવા માટે ૨જકો, ચિકોરી, બરસીમ, સૂર્યમુખી અને ઓટની વાવણી કરવી.
- ◆ પશુઓને ખનીજ મિશ્રણ ખવડાવો અને વારંવાર ઉથલા મારતાં પશુઓની યોગ્ય સારવાર કરાવવી.
- ◆ બાવલાના રોગો માટેની સારવાર કરાવવી.
- ◆ સ્વર્ણ દૂધ ઉત્પાદન કરવું.

(12) ડિસેમ્બર (માગશર) :

- ◆ પશુઓના સ્વાસ્થ્યની તપાસ કરાવવી.
- ◆ નાના બચ્ચાને સમયાંતરે કૂમિનાશક દવાઓ આપવી.
- ◆ વેતરે આવેલ પશુનું બીજદાન કરાવવું.
- ◆ નાના બચ્ચાઓનું ખાસ ધ્યાન રાખવું. બચ્ચાઓને જરૂર્યા પછી ખીરુ પીવડાવવું અને ઢંડી સામે રક્ષણ આપવું.
- ◆ પશુને ઢંડીથી બચાવવા ગોળ ખવડાવવો.
- ◆ કબજ્જાતનાં નિયંત્રણ માટે નાના બચ્ચાને ૨૦-૪૦ ગ્રામ સરસીયુ અઠવાડિયાનાં અંતરે પીવડાવવું.
- ◆ ભેંસોને ગરમીમાં લાવવા માટે ૩૦-૫૦ ગ્રામ મિનરલ મિક્સર પ્રતિ દિન આપવું.
- ◆ લીલા ધાસચારા માટે મકાઈની વાવણી કરવી.

કૃષિમાં તાલીમની અગત્યતા અને તેના ફાયદાઓ

ડૉ. કે. એસ. પટેલ ડૉ. એસ. પી. પંડ્યા ડૉ. કે. એ. ઠક્કર

કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટિક)

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર - ઉત્તે ૫૦૬

ફોન : (૦૨૭૪૮) ૨૭૮૪૩૭



વિશાળ ભારત દેશના વિકાસલક્ષી આયોજન કૃષિવ્યવસ્થા કેન્દ્ર સ્થાને છે. દેશની આશરે ૭૦ ટકા વસ્તી સીધી-આડકતરી રીતે પશુપાલન પર નિર્ભર છે. વધતી જતી વસ્તી સાથે ખેતી નાના ટુકડાઓમાં વહેંચાતી જાય છે. આ નાના નાના ટુકડામાંથી પણ વધુને વધુ ઉત્પાદન મેળવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સંઝેગોમાં ખેતીને વ્યવસાયલક્ષી બનાવવાની જરૂરિયાત છે.

કૃષિ વિસ્તરણ એ નવા સંશોધનોને ખેડૂતો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. કૃષિ વિસ્તરણ સંસ્થાઓ જેટલી સધર હોય તેટલા અંશે ખેતી વિજ્ઞાનના સફળ પ્રયોગો ખેડૂતો, ખેડૂત પત્તીઓ, ખેડૂત પુત્રો અને વિસ્તરણ કાર્યકરો સુધી અસરકારક અને જલ્દીથી પહોંચાડી શકાય છે. ખેતી વિજ્ઞાનના સફળ પ્રયોગો કૃષિ વિસ્તરણદ્વારા પહોંચાડવામાં માટે

ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ખાતા તેમજ ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ પ્રકારની કૃષિ વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓ ખેડૂતોના લાભાર્થી ચાલે છે. કૃષિ સંશોધિત નવી તજજ્ઞતાઓ ખેડૂત સુધી પહોંચાડવા અંગે જે વ્યવસ્થા આપણા દેશમાં ગોઠવાયેલા છે તેમાં વિસ્તરણ શિક્ષણ નિયામકના હસ્તકના વિવિધ કેન્દ્રોનો વિશેષ ફાળો છે.

વધુ ઉત્પાદન આપણી નવી કૃષિ તજજ્ઞતાઓ ખેડૂતો સુધી વખતોવખત પહોંચાડવા માટેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ

પદ્ધતિઓ પૈકી તાલીમનું મહત્વ ઘણું જ હોવાથી, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતુ જુદી જુદી સૈચિદ્ધ અને ખાનગી સંસ્થાઓ દ્વારા રાજ્યના દૂર દૂરના ખૂણાઓમાં કૃષિ તાલીમ કેન્દ્રો ચલાવવાની ભગીરથ કામગીરી કરવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રોમાં ખેડૂતો પોતાના

અમૂલ્ય સમય ફાળવી તાલીમ લેવા આવે છે ત્યારે તેઓને ખૂબ જ અસરકારક રીતે તાલીમ આપવી આપણી ફરજ થઈ પડે છે. એટલું જ નહી પરંતુ તાલીમ કંટાળાજનક ન બને, તાલીમમાં શીખવેલ તજજ્ઞતાઓ લાંબા સમય સુધી ખેડૂતોને યાદ રહે તેમજ તેઓ ગમ્ભીર સાથે જ્ઞાન મેળવી શકે તેવું આયોજન કરવું ખૂબ જ આવશ્યક છે જેને લઈ વધુને વધુ સંખ્યામાં ખેડૂતો કૃષિ તાલીમમાં જોડાવા પ્રેરાય.

દેશની દરેક સંસ્થાઓ પોતાના ક્ષેત્રમાં કાર્ય કરતા દરેક-દરેક વ્યક્તિઓ કાર્યક્ષમતા

વધારવા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ માટે દરેક વ્યક્તિમાં તેનું જ્ઞાન, કાર્યકુશળતા અને વલાણમાં ઈચ્છીત ફેરફારો લાવવા અનિવાર્ય છે. આ માટે જુદા જુદા વ્યક્તિગત, જૂથ અને સામૂહિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેનાથી વત્તા ઓછા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. પરંતુ મોટા પ્રમાણમાં ફેરફાર લાવવા માટે તાલીમનું માધ્યમ આદિકાળથી આદર્શ સિદ્ધ થયેલ છે. કોઈપણ ક્ષેત્રમાં, કાર્યમાં બાબતમાં કિયાઓ કે આયોજનમાં મળેલી સફળતાના પાયામાં તાલીમ પામેલ માણસો જ રહેલા હોય છે એટલે જ તો વિશ્વમાં એવું

કોઈપણ ક્ષેત્ર શોધવું મુશ્કેલ છે કે જ્યાં તાલીમ પાછળ ખર્ચ ન થતો હોય દરેક દરેક ક્ષેત્રના તમામ નવા જુના/નાના મોટા માણસોને તાલીમ આપવી અતિ આવશ્યક છે, કેમ કે કોઈપણ ક્ષેત્રની પ્રગતિનું રહેસ્ય તેમાં કાર્ય કરતા માણસોને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે તેના ઉપર રહેલ છે. વળી એ પણ ભૂલવું ના જોઈએ કે તાલીમ એ સતત પ્રક્રિયા છે તેને કોઈ પૂર્ણ વિરામ હોતું નથી.

તાલીમને વધુ અસરકારક બનાવવા માટે દર્શય શાય સાધનો જેવા કે ચાર્ટ, ફોટોગ્રાફ, સ્લાઇડ, ઓવરહેડ પ્રોજેક્ટ, ટેલિવિઝન કાર્યક્રમ, ઓનલાઈન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં વતા ઓછા પ્રમાણમાં તેના માણસોને તાલીમ આપવામાં આવતી હોય છે. તાલીમ આપવા માટે વિવિધ માધ્યમોનો પણ ઉપયોગ થતો હોય છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અનુભ્વતી કૃષિ નિષ્ણાતો દ્વારા કૃષિ, બાગાયત, પશુપાલન તથા તેના લગતા ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં અનુભ્વતી અને પ્રગતિશીલ બેદૂતોની પણ વિષય નિષ્ણાત તરીકે મદદ લઈને તેઓના અનુભ્વતી શાનનો લાભ આપવામાં આવે છે. બેદૂતની જરૂરિયાત મુજબ જ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત ખેતીપ્રધાન દેશનું ખેતીપ્રધાન રાજ્ય છે. રાજ્યનો વિકાસ રાજ્યની ખેતીના વિકાસ ઉપર આધારિત છે. રાજ્યોની ખેતીનો વિકાસ રાજ્યના નાના-નાના ગામડાઓમાં ખેતી કરતા બેદૂતોની ખેતીના વિકાસ સાથે સીધો સંબંધ ધરાવે છે. તાલીમ પાસેલા બેદૂત ભાઈઓ પોતાની ખેતીનો સારામાં સારો વિકાસ કરીને આર્થિક રીતે સધ્ધર બની શકે છે.

તાલીમ યોજવા માટેના ઉદ્દેશો :

- (૧) ગ્રામ્ય વિસ્તારમાં વસતા બેદૂતોની કુશળતામાં નિપુણતા લાવવા માટે તાલીમ વર્ગો યોજવા.
- (૨) વિસ્તરણમાં કામ કરતા વિસ્તરણ કાર્યક્રમોને તાલીમ

આપી જે તે વિષયમાં નિપુણ બનાવવા.

(૩) બેદૂતોને તાલીમ આપવા તાલીમ વર્ગો અને શિબિરો યોજવામાં આવે છે.

તાલીમથી થતા ફાયદાઓ :

- (૧) માણસની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
- (૨) માણસનો કાર્ય કરવા માટેનો આત્મવિશ્વાસ વધે છે.
- (૩) ઓછા સમયમાં વધુ કામ થાય છે.
- (૪) શક્તિ તેમજ સમયનો બચાવ થાય છે.
- (૫) ભૂલોનું પ્રમાણ ઘટે છે.
- (૬) કાર્યની ગુણવત્તા વધે છે.
- (૭) તાલીમ દરમ્યાન પ્રત્યક્ષ કામ કરવાનો અનુભવ મળે છે.
- (૮) જે તે વિષયને લગતી મૂંજવણો/મુશ્કેલીઓ / પ્રશ્નોના તત્કાલ નિવારણ માટેની તક મળે છે.
- (૯) કૌશલ્યમાં વધારો થાય છે.
- (૧૦) તેમના જીવન ધોરણમાં વધારો થાય છે.

તાલીમના જુદા જુદા તબક્કાઓ :

- (૧) તાલીમની શરૂઆતમાં એકબીજાનો પરિચય કેળવી તાલીમનું વાતાવરણ ઊભુ કરવું.
- (૨) તાલીમ દરમ્યાન આવતા અધરા મુદ્દાઓ/શબ્દો યાદ રખાવવા.
- (૩) તાલીમ દરમ્યાન તાલીમાર્થિઓને શીખવવાની/ વધારવાની થતી કાર્યકુશળતાનો તબક્કો.
- (૪) તાલીમ / પ્રવચનના અંતે તેની ફિડબેક મેળવવી.

તાલીમ આપવાની પદ્ધતિઓ :

તાલીમને વધુ અસરકારક બનાવવા માટે નીચે મુજબની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

(ક) ઉપયોગ પ્રમાણે

વ્યક્તિગત સંપર્ક પદ્ધતિ	જીથ સંપર્ક પદ્ધતિ	સામૂહિક સંપર્ક પદ્ધતિઓ
ઘર મુલાકાત ખેતર મુલાકાત ટેલિફોન વ્યક્તિગત પત્રો	સામાન્ય જીથ સભા વ્યાખ્યાન નાની જીથ સભા નાની ચર્ચા સભા સેમિનાર મોટી જીથ સભા ઝૂબેશ સભા પરિસંવાદ રીત કે પદ્ધતિ નિર્દર્શન નમૂના અને પ્રદર્શન પ્રવાસ પર્યટન મુલાકાતીઓને બોલાવવા રેડિયો કાયકમ સ્ટૈલિષ્ટ અને સ્થાનિક નેતાગીરી પરિણામ નિર્દર્શન	સામાચારપત્રો પરિપત્રો પત્રિકાઓ નાટકો ચલાયિત્રો બુલેટિન ફોલ્ડર પેન્ફલેટ

(ખ) રૂપરૂપ પ્રમાણે

લેખન	બોલી શકાય	જોઈ શકાય	દર્શય અને બોલી શકાય તેવા
લીફ્લેટ	ઘર મુલાકાત	રીત કે પદ્ધતિ નિર્દર્શન	રીત કે પદ્ધતિ નિર્દર્શનો
ફોલ્ડર	ખેતર મુલાકાત	પરિણામ નિર્દર્શન	પરિણામ નિર્દર્શનો
પેન્ફલેટ	કચેરી મુલાકાત	પોસ્ટરો	ટેલિફોન
બુલેટિન	રેડિયો વાર્તાલાપ	ચાર્ટ	ગીતો
ટેલિફોન મુલાકાત	જીથ સંપર્ક	સ્લાઇડર	
સામયિકો		ચલાયિત્રો	
સામાચારપત્રો			
સક્રિપ વાર્તાઓ			
પરિપત્રો			

ખેડૂતમિત્રો, ખેડૂત મહિલાઓ, ખેડૂતપુત્રો આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના વિસ્તરણ કેન્દ્રોના મહત્વ લાભ લે અને તેમનું જીવન ધોરણ સધ્યારે અને પોતાનો આર્થિક અને સામાજિક વિકાસ કરશે.

- વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૫૨) ૨૬૨૩૧૬/૨૬૪૮૮૨૨
- વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૮૬૪૫૦ ફોન : (૦૨૬૩૭) ૨૮૨૦૨૬/૨૮૨૭૦૯
- વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર-૩૮૫૫૦૬ ફોન : (૦૨૭૪૮) ૨૭૮૪૩૬
- વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર-૩૮૫૫૦૬ ફોન : (૦૨૭૪૮) ૨૭૮૪૩૬

સાયબર કાઈમ

ડૉ. કૃષ્ણાલ સી. કમાણી ડૉ. યોગેશ આર. ઘોડાસરા ડૉ. વૈશાલી વી. કનેરીયા
શેઠ મ.છ. તેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આંણંદ કૃષ્ણ યુનિવર્સિટી
આંણંદ - ૩૮૮ ૧૧૦
ફોન: (મો) ૯૮૨૫૪૭૩૨૮૩



ભારતમાં સાયબર કાઈમના ગુનાઓને રોકવા માટે ઈન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ બનાવવામાં આવેલ જેમાં સને ૨૦૦૮માં સુધારો કરી હાલ આઈ.ટી. (એમેડમેન્ટ) એક્ટ-૨૦૦૮ અમલમાં છે તે સાથે સાયબર એપેટેલ ટ્રીબ્યુનલ પણ કાર્યરત છે. આ કાયદો સમગ્ર ભારતને તેમજ ભારત બહાર રહીને આપણા ભારત દેશમાં સજાપાત્ર ગુનો કરેલ હોય તે દરેકને લાગુ પડે છે.

કેન્દ્ર સરકાર
હસ્તકની સેન્ટ્રલ બ્યૂરો
ઓફ ઇન્વેસ્ટિગેશન
(સી.બી.આઈ) નામની
તપાસ એજન્સી હેઠળ કાઈમ
એન્ડ રીસર્ચ ડેવલોપમેન્ટ
યુનિટ કાર્યરત છે જેના
ધ્વારા 'સાયબર ડાયંકેસ્ટ'
નામનું સામયિક પ્રસિદ્ધ
થાય છે. ગુજરાત
સરકારની ગાંધીનગર
ખાતે આવેલી ફોરેન્સિક

કોમ્પ્યુટરની શોધના કારણે વૈશ્વિક ધોરણે,
સામાજિક ધોરણે તથા વ્યક્તિગત જીવનશૈલીમાં
અદ્ભૂત પરિવર્તનો આવ્યાં છે. હાલ ઈન્ફોરમેશન ટેકનોલોજી એટલે કે આઈ.ટી.નો યુગ ચાલી રહ્યો
છે જેમાં કોમ્પ્યુટરની સાથે સાથે મોબાઇલનો વપરાશ
વધતો જાય છે. પરિણામે વ્યક્તિ મોબાઇલ અને માઉસ
વચ્ચે જીવતો થઈ ગયો છે. આઈ.ટી.ને કારણે અનેક
સગવડોમાં વધારો થયો છે. તેના થકી વિશ્વને અનેક
લાભો થયા પરંતુ કેટલીક માનસિક વિકૃતિઓ ધરાવતી
વ્યક્તિઓ મોબાઇલ, કોમ્પ્યુટર અને આઈ.ટી.નો
દૂરઉપયોગ કરી જે ગુનાઓ આચરે છે તેને સાયબર
કાઈમ તરીકે ઓળખવામાં આવે છે.

સાયન્સ લેબોરેટરી (એફ.એસ.એલ.) આ કેતે દેશમાં
પ્રસંશનીય કામગીરી કરે છે. સાયબર કાઈમ આજે
વિશ્વના દરેક દેશ માટે મૂંજવતો પ્રશ્ન છે. વિશ્વના
કોઈપણ ખૂબી બેસીને ગુંજા આચરતા આઈ.ટી.
કેત્રના આરોપીઓ માટે કોઈ કેસ ચલાવવાનો પ્રશ્ન વધુ
મુશ્કેલભર્યો છે.

સાયબર કાઈમના પ્રકાર :

(૧) વાયરસ :

વાયરસથી કોમ્પ્યુટર વાપરનાર સર્વે પરિચિત છે. વાયરસ એ એક એવો પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટરમાં દાખલ થયા પછી આપણી સીસ્ટમ તથા ટેટાને નુકશાન કરે છે. આવા વાયરસના પ્રોગ્રામ બનાવવો કે ફેલાવવો એ એક પ્રકારનો ગુનો બને છે.

(૨) સોફ્ટવેર પાયરસી :

કોઈપણ સોફ્ટવેરની અનવિદ્યુત કોપી વાપરવી એ પણ એક પ્રકારનો ગુનો છે. કંપનીએ મહેનત તેમજ બર્ચ કરી સોફ્ટવેર તૈયાર કરેલ હોય તેની ગેરકાયટેસર રીતે કોપી કરી ઉપયોગ કરવાથી કંપનીને આર્થિક રીતે નુકશાન થાય તેવું કામ કરવું તેને સોફ્ટવેર પાયરસી કહે છે. આઈ.ટી. કાયદા અન્વયે આવી પાયરસી પકડી યોગ્ય દંડ કરવામાં આવે છે.

(૩) સ્પુર્ઝિંગ :

ગુનેગાર પોતાની ઓળખ છુપાવી અન્ય વ્યક્તિનાં ઈમેઇલ આઈ.ટી. મોબાઇલ નંબર અને જે તે કોમ્પ્યુટરનો આઈ.પી એન્ટ્રેસ તરીકે ઉપયોગ કરી ગેરકાયટેસર કામ કરતાં હોય તેને સ્પુર્ઝિંગ કહે છે. તે પણ

એક પ્રકારનો સાયબર ગુનો છે.

(૪) સાયબર પોર્નોગ્રાફી :

અશ્વીલ સાહિત્ય, ફિલ્મ, ફોટો વગેરે જોવા તથા કોમ્પ્યુટરના માધ્યમથી અન્યને મોકલવામાં આવે તેને સાયબર પોર્નોગ્રાફી કહે છે.

(૫) સાયબર સ્ટેક્ઝિંગ :

સાયબર સ્ટેક્ઝિંગ એટલે કે પોતાની ઓળખ ધૂપાવી ટેકનોલોજીનો દૂરઉપયોગ કરી કોઈ વ્યક્તિની પજવણી કરવી. કોઈની માહિતી ચોરવી કે કોઈ કંપનીની માહિતી સાથે ચેડાં કરવા તેમજ જાણ બહાર આવી માહિતી અન્ય કોઈને મોકલવી તે પણ એક સાયબર ગુનો છે.

(૬) ફીસિંગ :

કોઈની ઓરીજનલ વેબસાઇટ જેવી જ બીજી કુલ્પીકેટ વેબસાઇટ બનાવવી. તેનો હેતુ ઓરીજનલ વેબસાઇટકરતને ગેરમાર્ગ દોરવાનો કે તેની અંગત માહિતીની ચોરી કરી તેનો દૂરઉપયોગ કરવો વગેરે પ્રકારની ગુનાહિત કામગીરીને ફીસિંગ કહે છે.

(૭) સાયબર મની લોન્ડરીંગ :

બેંક સાથેના વ્યવહારો હવે ઓનલાઈન બન્યા છે. વ્યક્તિઓ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી દેશના ગમે તે એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડી શકે છે. આ સગવડનો દૂરઉપયોગ કરી કાર્ડના પાસવર્ડ જાણીને કે બેંકના કોમ્પ્યુટર નેટવર્કમાં ગેરરીતી આચરી ગુનેગારો ગમે તેના ખાતામાંથી પૈસા ઉપાડી કે ટ્રાન્સફર કરી શકે છે. આને સાયબર મની લોન્ડરીંગ કહેવાય છે જેનાથી જે તે વ્યક્તિ કે સંસ્થાને આર્થિક રીતે નુકશાન થવા પામે છે.

(૮) સાયબર ટેરરીઝમ :

અંતકવાદી કૃત્ય માટે આઈ.ટી. ટેકનોલોજીનો

ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને સાયબર ટેરરીઝમ કહે છે. વિશ્વમાં મોટા ભાગનાં વ્યવહારો કોમ્પ્યુટર ધ્વારા થવા માંડયા તેમજ અગત્યના દસ્તાવેજોમાં સહી સિક્કાના બદલે ડીજીટલ સહીનો જમાનો આવ્યો છે. ઉત્પાદન, બજાર વ્યવસ્થા, સેવા, સંદેશાવ્યવહાર, બેન્કિંગ, રેલ્વે તથા એર ટિકિટ બુકિંગ, શિક્ષણ, ખેતી, દવા, ન્યાય પ્રાણાલી વગેરે અગત્યનાં ક્ષેત્રોમાં આઈ.ટી.નો ઉપયોગ ફૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેની સાથોસાથ તેને લગતા ગુનાઓનું પ્રમાણ પણ વધવા પામ્યું છે.

કોમ્પ્યુટર કોડ તથા પાસવર્ડ ચોરીને માહિતીની ઉઠાંતરી કરવી તથા તેનો દૂરઉપયોગ કરવો, ખોટા ક્રિલપિંગ ધ્વારા લોટરી લાગ્યાની ઓફરો મોકલી લોકોને લૂંટવા, એમ.એમ.એસ. વીલિયો ક્રિલપિંગ ધ્વારા બદનામી કરવી, હુલ્પીકેટ માર્કશીટ તથા પ્રમાણપત્રો બનાવવા માટે હેક્સ, લોન્ચર્સ, એક્ટર્સ, સ્પેનર્સ, ઓસપોન્જર્સ વગેરે તમામ મેદાનમાં ઉત્તર્ય છે. મોફિંગ ધ્વારા કોઈનાં નગ્ન ફોટો ઉપર અન્યના ચહેરા ગોઠવીને બદનામી કરાય છે. આવા આઈટી ગુનેગારની હેક્સ કલબો પણ બનવા માંડી છે. પરિણામે સામાન્ય લોકોને વ્યક્તિગત નુકશાન તેમજ દેશની આંતરીક સુરક્ષા ઉપર પણ ગંભીર ખતરો ઊભો કરે છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિ પોતે સાયબર કાઈમનો ભોગ ન બને તે માટે કેટલીક ખાસ કાળજીઓ રાખવી જોઈએ :

સાયબર કાઈમથી રક્ષણ મેળવવા માટે રાહવાની કાળજીઓ અને સાવચેતીઓ:

- (૧) કોમ્પ્યુટરમાં સારી કંપનીના એન્ટિ વાયરસ તથા ફાયરવોલનો ઉપયોગ કરવો.
- (૨) કોમ્પ્યુટરમાં નિયમિત પણે એન્ટિ વાયરસ ડિટેક્ટ તથા કલીનર રન કરાવવું.
- (૩) કોમ્પ્યુટરમાં મહત્વની ફાઈલો અને માહિતીનું નિયમિત પણે બેકઅપ લેતાં રહેવું જોઈએ.
- (૪) આપણા પાસવર્ડ જાણી ન શકે તેવો બનાવવો. આવા પાસવર્ડ માટે વિવિધ કેરેક્ટરનો ઉપયોગ

- કરવો જોઈએ.
- (૫) જરૂર ના હોય ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ રાખવી જોઈએ.
- (૬) ચોકક્સ સમયાંતરે પાસવર્ડ બદલવો જોઈએ.
- (૭) સ્પામ મેઇલ ખોલ્યા સિવાય ડિલીટ કરી દેવા જોઈએ.
- (૮) એટેચેમેન્ટ ફાઈલો પુરી ખાતરી થયા બાદ ડાઉનલોડ કરવી જોઈએ.
- (૯) બિનજરૂરી સોફ્ટવેર ડાઉનલોડ કરવાં જોઈએ નહિ.
- (૧૦) કોઈને પણ બેંક કે ક્રેડિટ કાર્ડની માહિતી પુરતી ચકાસણી કર્યા સિવાય આપવી જોઈએ નહિ.
- (૧૧) કોમ્પ્યુટર ઉપર ચેટિંગ કરતી વખતે અજાણી વ્યક્તિને પોતાનો ફોન કે સરનામું આપવું જોઈએ નહિ.
- (૧૨) પોતાની કુટુંબની, મિત્રની કે સંબંધીઓની કોઈ પણ બાનગળી માહિતી કોઈને આપવી જોઈએ નહિ.
- (૧૩) પાસવર્ડ કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ વ્યક્તિને આપવો નહિ.
- (૧૪) પાસવર્ડ કોમ્પ્યુટરમાં સ્ટોર કરવો જોઈએ નહિ.
- (૧૫) કેડિટ કે ડેબિટ કાર્ડ કોઈને પણ વાપરવા માટે આપવું જોઈએ નહિ.
- (૧૬) જે ચીજવસ્તુનો ઓર્ડર ના કર્યો હોય તેવી ચીજવસ્તુ ઓ અંગે ઓનલાઈન આવતી ઓફરો સ્વીકારવી જોઈએ નહિં.
- (૧૭) વાઈ-ફાઈ ઓટો કનેક્ટ મોડ ઉપર રાખવું જોઈએ નહિ.

નોંધ: સાયબર ક્રાઇમનો ભોગ બનીએ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે.

પાતાળનું પાણી... GROUNDWATER...પાતાળનું પાણી

ભૂગર્ભ જળ સંશોધન

ટયુબવેલ લોગોગ

બોર-કુવો બનાવવાના વધારે નાણી ખર્ચતા પહેલાં જ આધુનિક વિજ્ઞાન/ટેકનોલોજીના સાધનો અને પદ્ધતિ દ્વારા ખેતરમાં વધુમાં વધુ પાણી કયાં, કેટલું, ઉકુ તેમજ માટી, રેતી, ખડકોના વિવિધ ભૂસત્તરોનો આધારભૂત અંદાજ મેળવ્યા પછી જ આગળ વધો.

**GROUNDWATER INVESTIGATION SURVEY
For DUG WELL-BORE WELL & WELL LOGGING**

રતીલાલ સુદાણી

ભૂજલશ્રી જિયોટેક કન્સલ્ટન્ટ - ગુજરાત
PO Box: 55, કૃષી યુનિવર્સિટી કેમ્પસ પાસે,
આંધ્રા (ગુજરાત). ફોન : (02692) 263611
ફોન : 9427382368, 9978115968
Email: groundwater.sudani@gmail.com

HO: Dr. Suresh Pawar, Director,
Bhoojalshree, PUNE (Maharashtra)

Groundwater Research & Development : Cell Phone: 09822645787

આધુનિક ટેકનોલોજી પ્રદર્શન

કૃષિ મેળો ડલોએ

સમય: (વડોદરા)
સવારે: ૮-૦૦ થી ૯-૦૦
૯ થી ૯ ફેબ્રુઆરી - ૨૦૧૬

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ગ્રાઉન્ડ,
બસ સ્ટેન્ડની સામે, ડલોએ, જિ-વડોદરા.
મો. : ૯૮૨૫૧ ૭૬૬૪૬, ૯૬૭૮૧ ૮૪૦૦૮


કૃષિ ક્ષેત્ર બજારલક્ષી વિસ્તરણ સેવાઓનો ઉપયોગ અનિવાર્ય

શ્રી જે.ડી. દેસાઈ ડૉ.વી. આર. બોધરા ડૉ. એન.વી. સોની

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦

ફોન : (૦૨૬૫૨) ૨૬૨૭૧૬



Courtesy and credit: KVK, Bhujalek

કૃષિ ક્ષેત્રની પેદાશો પરંપરાગત રીતે અને અત્યતુ પ્રમાણે ઉત્પાદિત થાય છે પરંતુ હવે કૂડ મેન્યુ ફેફર્સ જે ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરે છે તે ખેતપેદાશના કાચા માલનો પૂરવઠો યોગ્ય ગુણવત્તાવાળો અને ઓછા ખર્ચ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા થાય તેવું માગે છે. ગ્રાહકો પોતે પણ યોગ્ય ગુણવત્તાવાળી પેદાશ માગે છે. ગ્રાહક ખેતપેદાશના પોષણમૂલ્ય વિષે સભાન બન્યો છે. ગ્રાહક ખેતપેદાશની પોષક મૂલ્ય પ્રમાણે છે. બજારમાં પણ જે તે ખેતપેદાશની પોષક મૂલ્ય પ્રમાણે

ગુણવત્તા ચકાસવામાં આવે છે. ગ્રાહક સજીવ ખેતી દ્વારા એટલે કે રસાયણોના ઉપયોગ વિના ઉત્પાદિત થયેલ ખેત પેદાશ માંગે છે અને તે મુજબની માંગ જાણી પોતાની ખેતીમાં સજીવ ખેતી અપનાવવા માગે છે. ગ્રાહક અને બજાર ઉદ્યોગ પણ વધારાનો ખર્ચ કર્યા વિના સજીવ ખેત પેદાશ માંગે છે તે પણ ખેતી ક્ષેત્રે એક પડકારજનક બાબત છે. આ પડકારને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રે બજાર વિસ્તરણ સેવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે.

ઉત્પાદનલક્ષી વિસ્તરણ અને બજારલક્ષી વિસ્તરણ

ક્રમ	વિગત	ઉત્પાદનલક્ષી વિસ્તરણ	બજારલક્ષી વિસ્તરણ
૧	હેતુ	ઉત્પાદન માટેની તાંત્રિકતાઓનો પ્રચાર /પ્રસાર કરવો.	ખેડૂત પોતાના એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ આદર્શ વળતર મેળવી શકે
૨	અપેક્ષિત અંતિમ પરિણામ	મોટા ભાગના ખેડૂતો ભલામણ કરેલ ખેતીના કાર્યો અપનાવે તેવો સંદર્શો મળવો.	ખેતીમાં ઊંચું વળતર મળે
૩	ખેડૂતોને કઈ રીતે જોઈ શકાય.	પ્રગતિશીલ ખેડૂત / વધુ ઉત્પાદનકર્તા તરીકે	ખેડૂત એક ઉદ્યોગસાહસિક છે તે રીતે
૪	ભાર મૂકવો	બિયારણમાંથી બીજ ઉત્પાદન ઉપર ભાર મૂકવો.	ખેતીની આવી પ્રક્રિયાને એક ઉદ્યોગ / રૂપિયામાંથી રૂપિયા એટલે કે ઊંચું વળતર આપે તે ઉપર ભાર મૂકવો.
૫	તાંત્રિકતા	ખેત હવામાન વિસ્તાર પ્રમાણે વિવિધ ખેતી પદ્ધતિઓમાં કરેલ ખેતીના કૃષિ કાર્યોનો મોટા વિસ્તારમાં અમલ થવો.	જે તે ખેતી પદ્ધતિઓ અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ ખેતીના કૃષિ કાર્યો થવા.
૬	વિસ્તરણ કાર્યકરોની પ્રતિક્રિયા /આપણે	સંદેશ, તાલીમ વગેરે દ્વારા ભલામણો અંગે અભિપ્રેત કરવા.	જે તે ભલામણ અપનાવવા અંગેના પ્રશ્નો ઉભા થાય તેનું સંયુક્ત રીતે નિરાકારણ કરી યોગ્ય સલાહ આપવી.
૭	જોડાણ	સંશોધન-વિસ્તરણ- ખેડૂત	સંશોધન-વિસ્તરણ- ખેડૂતનું બજાર સાથે જોડાણ

ક્રમ	વિગત	ઉત્પાદનલક્ષી વિસ્તરણ	બજારલક્ષી વિસ્તરણ
૮	વિસ્તરણ કાર્યકરોનો ફાળો	માહિતીની આપ-લે કરવી અને તેના ફીડબેક સંશોધન સુધી પહોંચાડવા	બજાર અને એઓ પ્રોસેસિંગની સ્થાપનાની સાથોસાથ ખેડૂત જૂથોનું સીધુ જોડાણ બજાર અને પ્રોસેસર્સ સાથે થાય તેવી બજાર અંગેની હોશિયારી કેળવવી.
૯	ખેડૂતો સાથેનો સંપર્ક	વ્યક્તિગત	ખેડૂતોના રસ ધરાવતા જૂથો (FIGs)/ ક્રોમોડિટી મુજબ રસ ધરાવતા જૂથો (CIGs)/ સ્વ સહાય જૂથો (SHGs).
૧૦	રેકૉર્ડની જાળવણી	ઉત્પાદન તરફ ભાર મુકાતો હોઈ રેકૉર્ડ જાળવણી ઉપર ભાર કોઈ મહત્વ આપવામાં આવતું નથી.	ખેતીને એક ઉદ્યોગ તરીકે જોવામાં આવતી હોઈ કોઈ ખર્ચ આવક અને નફાનું ગુણોત્તર જાળવા રેકૉર્ડની જાળવણી કરતાં વધુ ફાયદો થાય તે જોવામાં આવે છે.
૧૧	ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)નો ઉપયોગ	આઈટી દ્વારા ઉત્પાદનલક્ષી, તાંત્રિકતાઓ ઉપર ભાર મૂકવામાં આવે.	ઉત્પાદનલક્ષી તાંત્રિકતાઓની સાથો સાથ બજાર પ્રવાહ, બજારની માંગ અને પૂરવઠો, બજાર કિંમતોમાં ફેરફાર, બજાર પદ્ધતિઓ અને સંદેશાવ્યવહાર નેટવર્કના ઉપયોગ દ્વારા બજાર અંગેની હોશિયારી વધે તેવા પ્રયાસો હાથ ધરવા.


બજાર માહિતીની જાણકારી :

ખેડૂતોને નીચે જણાવેલ બજારલક્ષી માહિતી ની જાણકારી હોવી જરૂરી છે, જેવી કે

- (૧) પ્રવ્રતમાન ખેતી અંગેના પ્રવાહ અને જમીનના વપરાશ અંગેની જાણકારી
- (૨) વિવિધ ખેતીપાકો / ખેતી ધંધા હેઠળ ખેડૂતોની જરૂર મુજબની જમીન ધારણ ક્ષમતા
- (૩) નજીકના ભવિષ્યમાં જે તે ખેતી પાકની પેદાશની બજારમાં માંગ
- (૪) જે તે પાકના બજારભાવ
- (૫) ખેતી માટે જરૂરી ચીજવસ્તુઓ (ઇનપુટ્સ) પ્રાત્યતા
- (૬) ઇનપુટ્સનો યોગ્ય ઉપયોગ
- (૭) ધિરાણની સવલતો
- (૮) ગ્રાહકોની જરૂરિયાત મુજબ ખેતીપેદાશોની ગુણવત્તા હોવી
- (૯) સ્થાનિક વિસ્તારનું બજાર માળખું અને વિવિધ બજારોમાં ખેતીપેદાશોના ભાવોમાં રહેલ તફાવત
- (૧૦) સંગ્રહ માટેના કોઠારો અને વેરહાઉસની સવલતો અને તેનું નેટવર્ક

- (૧૧) વાહનવહારની સગવડતાઓ
- (૧૨) બજાર અંગેની નિયમિત જાણકારી મેળવવાની હોશયારી
- (૧૩) ઉત્પાદનલક્ષી તાંત્રિકતાઓ જેવી કે સુધારેલી / સંકર જાતો, સજ્જવ ખેતી, બાયોપેસ્ટીસાઈડ અને જૈવિક ખાતરો, સંકલિત જીવત વ્યવસ્થાપન, સંકલિત પોષણ વ્યવસ્થા, સંકલિત નીછણ વ્યવસ્થાપન, કાપણીની સાચી પદ્ધતિ વગેરેની પુરતી જાણકારી
- (૧૪) કાપણી બાદની વ્યવસ્થા જેવી કે, પ્રોસેસિંગ, ગ્રેડિંગ, પેદાશ સ્ટાન્ડર્ડ, મૂલ્ય વર્ધન, પેકેજીંગ, સંશ્રદ્ધ, પ્રમાણિકરણ (સર્ટિફિકેશન) વગેરેની જે તે પેદાશ (અનાજ, ફળ, શાકભાજી, ઢાંડા, મરચાં વગેરે) મુજબની પુરતી જાણકારી
- (૧૫) કોન્ટ્રાક્ટ ફાર્મિંગ
- (૧૬) ખાનગી આધુનિક ટર્મિનલ માર્કેટ
- (૧૭) ફૂડ રીટેઇલ ચેઈન
- (૧૮) ફૂડ સેફ્ટી અને કર્વાલિટી સ્ટાન્ડર્ડ
- (૧૯) પ્રમાણિકરણ (સર્ટિફિકેશન)
- (૨૦) વિશ્વ વ્યાપારી સંગઠન (WTO)ના નિયમનો

કૃષિમાં બજારલક્ષી વિસ્તરણ માટેનાં પાંચ પગથિયાં



બજારલક્ષી વિસ્તરણ અંગે કૃષિ વિસ્તરણ કાર્યકરોના ઘનિષ્ઠ પ્રયાસો જરૂરી :

ખેડૂતોના હિત માટે કૃષિ વિસ્તરણ કાર્યકરોએ બજારલક્ષી વિસ્તરણ માટે નીચે દર્શાવેલ પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.

- (૧) બજાર અંગેનું પૃથક્કરણ : બજાર અંગેના મજબૂત પાસાં (માંગ, ઊંચી બજારક્ષમતા, સારી કિમત, ઊંચું વળતર વગેરે) નબળાઈઓ (પુરવણાનો ભરાવો, નીચી બજારક્ષમતા, ઓછી કુમત, ખોટ વગેરે), તકો (અન્ય સ્થળોએ પેદાશની નિકાસ, વેચાણ માટેનો યોગ્ય ઉમરો સમય વગેરે) અને ભયસ્થાનો (આયાત, ખેતીપેદાશનો બગાડ, સંગ્રહની ખામી વગેરે)ને જાણી તે મુજબ બજાર વ્યવસ્થાનું પૃથક્કરણ કરવું જોઈએ અને તે મુજબ ખેડૂતના ઉત્પાદન અને બજાર અંગેનું આયોજન ગોઈવવું જોઈએ.
- (૨) ખેત ઉદ્યોગની વ્યવસ્થા મુજબ જે તે ખેતપેદાશમાં રસ ધરાવતા પેદાશની ક્ષમતા મુજબ ખેડૂત જૂથો (FIGs) ની રચના કરવી જોઈએ.
- (૩) આવા ખેડૂત જૂથોને સ્થાનિક રીતે વિવિધ યોજના / કાર્યક્રમો (જેવા કે જળસ્ત્રાવ સમિતિઓ, વપરાશકારના જૂથો, સ્વસહાય જૂથો, જળ વપરાશ મંડળીઓ, ધિરાણ જૂથો વગેરે)માં જોડાઈ તેમની ક્ષમતા વધારી આગળ વધે તે રીતે પ્રયત્નો કરવા જોઈએ. આવા જૂથોને સ્વસહાય જૂથના કાર્ય-પ્રક્રિયાના ફાયદાઓ, મહાવ, જરૂરિયાત અને કામગીરી વગેરે અંગેનું શિક્ષણ પુરુ પાડવું જોઈએ.
- (૪) ખેડૂતો, ગ્રાહકો, વચેટીયા અને સીધા બજાર સાથે સંપર્ક સાધી બજારમાં બાર્જનિંગ કરી બજારની પ્રતિક્રિયા/ફીડબેક મેળવી શકે તેવી સંદેશાવ્યવહારની કુશળતા પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ.

- (૫) ખેડૂત જૂથો, બજાર અને ખાનગી પ્રોસેસર્સ વચ્ચે બજાર અને એગ્રો-પ્રોસેસિંગ અંગે યોગ્ય જોડાણ કરવું જોઈએ.
- (૬) પેદાશના આયોજન અંગે સલાહ: ખેત ઉદ્યોગ અને ખેડૂતની જમીનધારણ શક્તિ અને બજારમાં માંગ પ્રમાણેના પાકની પસંદગી અને જાતની પસંદગી કરવી અત્યંત જરૂરી છે. આ અંગેની માહિતી વિસ્તરણ માળખા દ્વારા પૂરી પાડી શકાય તેમ છે.
- (૭) ખેતીને એક ઉદ્યોગ તરીકેની પ્રવૃત્તિ ગણવા તેમજ તે મુજબ પાક ઉત્પાદનના વિવિધ પાસાઓ અને બજાર અંગે ખેડૂતોને શિક્ષણ આપવું જોઈએ.
- (૮) ખેડૂત પોતે સીધો જ માલ બજારમાં વેચી શકે તે બાબતની જાણકારી પુરી પાડવી જોઈએ.
- (૯) જે તે ખેતપેદાશ માટે રસ ધરાવતાં જૂથો/સમૂહોને જે તે ખેતપેદાશની સુધારેલી ઉત્પાદન પદ્ધતિઓ, કાપણી પછીની પ્રક્રિયાઓ, સંગ્રહ, વહન અને બજાર વગેરે અંગે સંક્ષમ બને તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.
- (૧૦) બજારના વિવિધ પાસાઓ અંગેની જાણકારી બાબતે સંપૂર્ણ હોશિયારી મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
- (૧૧) બજાર હોશિયારી મેળવવા માટે નિયમિત રીતે કોમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરવો.
- (૧૨) સમાચારપત્રો, રેડિયો અને ટેલીવિઝન ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ખેતી બજાર અંગેની માહિતી પ્રકાશિત કરવી જોઈએ.
- (૧૩) સમાન ખેતી કરતાં તેમજ સામાજિક, આર્થિક સમાનતા ધરાવતા ખેડૂતો એકબીજાના સંપર્કમાં આવે અને ખેતી અંગેની જાણકારી મેળવે તે માટે ખેડૂત જૂથોના અભ્યાસ પ્રવાસ ગોઈવવા જોઈએ.
- (૧૪) જે તે ખેતપેદાશમાં સફળ પામેલ ખેડૂતોની સફળ વાર્તાઓ તૈયાર કરી તેની વિડીયો ફિલ્મ બનાવવી જોઈએ.
- (૧૫) કૂણિ વ્યાપાર વ્યવસ્થાપન ક્ષેત્રે સફળતા પામેલ ખેડૂત જૂથોની કામગીરી અંગેની માહિતી ઉપલબ્ધ થઈ શકે તેવી રીતે એક વેબસાઈટ બનાવવી જોઈએ જેથી અન્ય ખેડૂત જૂથો તેવી સફળતા મેળવવા માટે પ્રેરાય.

અમલીકરણ :

બજાર પ્રક્રિયાને સઘન બનાવવા માટે આધુનિક વિસ્તરણ શિક્ષણ સેવાઓ એ એકમાત્ર ઉપાય છે. જો કે વિસ્તરણની પણ કેટલીક મર્યાદાઓ છે તેમ છતાં તે થકી નાના અને સીમાંત ખેડૂતોમાં તેની અસરો દ્વારા આર્થિક પરિવર્તન સંભવ છે.

- (૧) **નવી સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરવી :** સરકારે વિસ્તરણની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એક સમાન હેતુઓ માટે રોકાણ કરવામાં આવે તે માટે સંશોધકો, ખેડૂતો, ખાનગીક્ષેત્ર અને બજાર વચ્ચે યોગ્ય જોડાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
- (૨) **ખેડૂતોની એજન્સી/જૂથો બનાવવા :** ખાનગી ક્ષેત્ર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો દ્વારા કામ લેવાનું હોય ત્યારે આવા ખેડૂતોનું સંગઠન કે એક એજન્સી હોય તે જરૂરી છે. જો જૂથ સંગઠન હોય તો નાણાંકીય વ્યવસ્થા, બજાર, ઉત્પાદન, નવીનતાનો ઉપયોગ વગેરે દ્વારા બજારમાં સફળ રીતે ખેડૂતો જોડાઈ શકે.
- (૩) **બજાર ઉપર ભાર મૂકવો :** નાના અને સીમાંત ખેડૂતોને બજાર સાથે જોડવા માટે વેલ્યુ ચેઇન વ્યવસ્થા મહત્વની છે. તેના દ્વારા બજારની માંગ અને વેપાર માટેની યોગ્ય વ્યવસ્થા મળી રહે છે જેથી પોતાની ખેતપેદાશની વેચાણ કરવાની

યોગ્ય સરળતા સંપરે છે.

- (૪) **બજાર ક્ષેત્ર ઉપર ભાર મૂકવો :** ઘણા દેશોમાં વિસ્તરણ ક્ષેત્ર દ્વારા ફક્ત ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવે તે મુજબની વ્યવસ્થા હોય છે પરંતુ એ વિસ્તરણ ક્ષેત્રની વિવિધ એજન્સીઓ દ્વારા બજાર સાથે ખેડૂતોનું સીધુ જોડાણ થાય અને સારો વેપાર થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેમ થાય તો ખેડૂતો પોતાની પાસે ઉપલબ્ધ જમીન અને જગ્યાનો યોગ્ય ઉપયોગ કરી બજારનો વધુ લાભ મેળવી શકે.
- (૫) **જોખમ સામે રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી :** માંગ મુજબ ઉત્પાદન પેદા કરનાર ખેડૂતોને પાક વીમા દ્વારા કુદરતી જોખમો સામે રક્ષણ તેમજ નાણાંકીય વિરાણ પૂરુ પાડવું જોઈએ.
- (૬) **આઈસીટીનો ઉપયોગ :** વિસ્તરણ એજન્સીઓ દ્વારા ઈન્ફોર્મેશન કોમ્પ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટીના ઉપયોગ દ્વારા અસંખ્ય નાના

ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન તથા સેવાઓ પૂરી પાડવી જોઈએ. વિસ્તરણના નવા એપ્રોચ થકી ખેડૂત, મેનેજર અને આઈસીટી અંગેની સેવા પૂરી પાડનાર સાથે યોગ્ય સહકાર અને જોડાણ હોવું જોઈએ.

- (૭) **જવાબદારી :** તાલીમ, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે પ્રકારની વિસ્તરણ સેવાઓ જવાબદારીપૂર્વક થવી જોઈએ તો જ ખેડૂતો તેમાં વધુ ને વધુ જોડાઈ શકે. દરેક કાર્યમાં પારદર્શિતા હોવી જરૂરી છે કે જેથી વિના સંકોચે ખેડૂતો આવી સેવાઓનો ખરે સમયે લાભ લઈ પોતાની જેતી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી શકે.

ટુકમાં, વિવિધ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વિસ્તરણ સ્ટાફ એ વ્યવસ્થા અને ખેત ક્ષેત્રે તાલીમ મેળવી પોતે નિષ્ણાત બની ખેડૂતો માટે યોગ્ય બજારનો વિકાસ કરી, ખેડૂતો અને બજાર વચ્ચે સીધુ જોડાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.



આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ‘અનુભવ’ બ્રાન્ડ બીજ/પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે સંપર્ક સાધો



આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું ‘અનુભવ’ બ્રાન્ડ બીજ ઉત્પન્ન કરવામાં આવે છે અને વહેલાંના તે પહેલાંના ધોરણે વેચાણ કરવામાં આવે છે.

- ઘાસચારાના પાકોના બીજ અને જડીયા/ચીપા માટે : ઘાસચારા વિભાગ, આણંદ (૦૨૬૮૮-૨૬૧૭૮)
- ફળપાકો અન ફૂલાંદો પ્લાન્ટિંગ માટે : બાગાયત વિભાગ, આણંદ (૦૨૬૮૮-૨૮૦૨૫૦/૨૬૨૩૭૫)
- ઔષધિય અને સુરગંધિત પાકો (ઈસબગુલ, અસાળિયો, અશ્વગંધા, શંખપુષ્પી, કાલમેઘ, કાળજીરી, લીલી હળદર વગેરે) માટે : ઔષધિય અને સુરગંધિત ધોડ સંશોધન કેન્દ્ર, આણંદ (૦૨૬૮૮-૨૬૧૮૧૭, ૨૮૦૨૫૧)

વધુ વિગતો માટે કચેરી કામકાજના ડિવસોમાં ૮-૦૦ થી ૧૨-૦૦ અને ૧૪-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમ્યાન રૂબરૂ અથવા ફોનથી નોડલ અધિકારી (સીડ), વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦ (૦૨૬૮૮-૨૬૦૨૮૮, ૨૬૪૨૩૪) ખાતે સંપર્ક સાધવો.

ખોરાકમાં થતી ભેળસેળથી બચીએ

શ્રી કમલેશ આર. જેઠવા શ્રી જગદીશ જે. ચાવડા
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય
આંણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા-૩૮૮૦૦૧
ફોન : (મો) ૦૮૪૦૮૫૮૨૪૧૫



આપણે રોજું દા જીવનમાં શરીરને કાર્યક્ષમ અને તંદુરસ્ત રાખવા માટે આહાર લઈએ છીએ. જો આપણે યોગ્ય આહાર ન લઈએ તો આપણું તંદુરસ્તી બગડે અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ પક્ષ થવું પડે. આમ ન બને તે માટે આપણે શું ખાવું અને શું ન ખાવું તે બાબતની જાણકારી હોવી જરૂરી છે. આજકાલ ધંધાદારી વેપારીઓ દ્વારા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતી જોવા મળે છે તેથી આપણે તથા આપણા કુટુંબીજનોએ આ ધીમા જેરથી બચવું જરૂરી છે જેથી ખોરાકની ગુણવત્તાની ચકાસણી કરવી મહત્વની છે.

સ્વાસ્થ્યને નુકસાનકરતા રસાયણો :

ભારત સરકારના ભેળસેળ અટકાયત અધિનયમ પ્રીવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ પીએફએ ૧૯૫૪ના કાયદાની કલમ નં. ૨૮ મુજબ ખોરાકની વિવિધ બનાવટોમાં ચોક્કસ પ્રકારના કલ્ટાર કલર શેડ (લાલ, પીળો, વાદળી અને લીલો રંગ) નો ઉપયોગ થાય છે. જો અન્ય કોઈ રંગ ખાદ્યપદાર્થમાં ઉમેરેલ હોય તો લેબલ પર કૃત્રિમ રીતે રંગેલ, નિયમ નં. ૨૪ મુજબ દર્શાવવું ફરજીયાત છે. આ અંગે થયેલ સંશોધનથી જાણવા મળ્યું છે કે અમાન્ય ખાદ્ય રંગોનો વપરાશ કરતા તેની ઝેરી અસર થતાં ચામડી, આંખ, ફેફસા, બરોળ વગેરેમાં વિકૃતિ આવે છે, શરીરની વિવિધ પેશીઓને તેમજ યકૃત, આંતરડા અને મૂત્રાશય જેવા અવયવોને નુકસાન થાય છે. લોહીમાં હિમોગલોઝીનનું

ખોરાકની શુદ્ધતા માટે મહત્વની બાબત તમે શું ખાઓ છો તેના પર નક્કી થાય છે. જો તમને ખાદ્યપદાર્થોમાં કોઈ શંકાશીલ ભેળસેળ લાગે તો તરત જ તમારી નજીકના વિસ્તારના સિવિલ સર્જનને રિપોર્ટ કરો. હંમેશા બ્રાન્ડેડ અને સારા પેંકિગવાળા પદાર્થો ખરીદવા જોઈએ. જો કે તેનાથી ખર્ચ વધુ થાય છે, પરંતુ તેમાં ભેળસેળની શક્યતા નાહિયત હોય છે. આજકાલ ખાદ્યપદાર્થ સાથે સંકળાયેલ વેપારીઓએ પોતાના નૈતિક મૂલ્યો ગુમાવેલ છે. તે ધ્યાને લઈ ભેળસેળ અંગેની જાગૃતિ માટે કેટલીક સામાન્ય વિગતો આ લેખમાં દર્શાવિલ છે.

પ્રમાણ ઘટે છે. શરીરની દેહધાર્મિક કિયાઓમાં અવરોધ પેદા થાય છે તેમજ કેન્સરની ગાંઠ પક્ષ થવાની શક્યતા રહે છે.

બેકરીની બનાવટો :

કેટલીક બેકરીઓવાળા હલકા ખનીજ તેલનો ઉપયોગ કરી બેકરીની ચીજવસ્તુઓ બનાવી ઓછી કિમતે વેચે છે અને આર્થિક નફો મેળવે છે. બેકરીની બનાવટોમાં બગડેલા ઈડા તેમજ હલકા ખનીજ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી વસ્તુઓ બનાવતી વખતે કારીગરોનો પરસેવો ભળવાથી આહાર બગડે છે અને આપણી તંદુરસ્તીને નુકસાન કરે છે.

દૂધ અને દૂધની બનાવટો :

આજકાલ સમાચારપત્રોમાં કૃત્રિમ દૂધ વિષે ધંધું બધું આવતું હોય છે. આવું કૃત્રિમ દૂધ યુરિયા, કોસ્ટિક સોડા, ડિટરજન્ટ અને સોડિયમ સલ્ફેટમાંથી બનાવાય છે. જો ૨૦ ટકા કૃત્રિમ દૂધ સામાન્ય દૂધમાં ભેળવવામાં આવે તો તેને ચકાસવું ધંધું મુશ્કેલ બને છે. તે દૂધ જેવું જ દેખાય છે પક્ષ તેનો સ્વાદ કડવો હોય છે અને તે સાબુવાળું લાગે છે. તેની ચકાસણી કરવાનો સહેલો રસ્તો દૂધને બે હથેળી વચ્ચે અંગૂઠાને આંગળી વચ્ચે ધસવું. જો તેમ ઘસતા દૂધ સાબુવાળું લાગે અથવા સાબુની ગંધ આવે તો તરત જ કહી શકાય કે દૂધ કૃત્રિમ રીતે બનાવેલ છે. આવું કૃત્રિમ દૂધ ખોરાકમાં લેવામાં અંધાપો આવે, આંખે દેખાતું નથી

અને મૂત્રપિંડને નુકસાન થાય છે.

જો આવા કૃત્રિમ દૂધમાંથી પનીર અને ખોયા બનાવાય અને તેનો ઉપયોગ મીઠાઈ કે નાસ્તા બનાવવામાં હલવાઈ દ્વારા થાય તો તેવી બનાવટો ખાનારની તંદુરસ્તી ઉપર ગંભીર અસર કરે છે. કેટલીક વાર મૌઘા દૂધના પાઉડરની સાથે સસ્તો સોપસ્ટોન પાઉડર પણ ભેળવવામાં આવે છે.

કૃત્રિમ દૂધ અને કુદરતી દૂધની સરખામણી

ક્રમ	લક્ષણ	કૃત્રિમ દૂધ	કુદરતી દૂધ
૧	સ્વાદ	ધાળો કડવો	સ્વાદુ, રોચક
૨	રંગ	સફેદ	સફેદ
૩	પી.એચ.	૮.૦ થી ૧૦.૫	૬.૬ થી ૬.૮
૪	બાંધો	બે આંગળી વચ્ચે ધસતા સાખુવાળું લાગે	સાખુવાળું લાગે નહીં
૫	ગંધ	સાખુવાળા દૂધને ઉકાળતા સ્પષ્ટ ગંધ આવે	દૂધ જેવી
૬	યુરિયા ટેસ્ટ	પોઝટીવ	કુદરતી હોવાને લીધે અસ્પષ્ટ બતાવે

રંગની ભેળસેળ :

રંગ દ્વારા કરવામાં આવતી ભેળસેળ એ વારંવાર કરાતી ભેળસેળનો એક પ્રકાર છે. રંગ પોતે કોઈ ખોરાક નથી અને તે ખોરાકના પોષણમૂલ્યમાં કોઈ વધારો કરતો નથી. તે ખોરાકમાં રહેલી ખામીને ઢાકી દે છે પરિણામે હલકા પ્રકારનો ખોરાક ઉત્તમ પ્રકાર જેવો દેખાય છે. કૃત્રિમ રીતે ખોરાકને રંગ આપવાથી કોઈપણ ચીજવસ્તુ સલામત રહેતી નથી. વળી બાળકો માટેના ખોરાકને રંગ આપવામાં ધણા જોખમો રહેલા છે. ઉપરાંત રંગની ભેળસેળથી ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન પહોંચે

છે. રંગ આપવાથી ખોરાકમાં અવળી પ્રતિક્રિયા થાય અને શરીરમાં રહેલ વિષમાં તે પરિવર્તન લાગે છે જેના પરિણામે વિકૃતિ, કેન્સર કે અન્ય વિષજન્ય અસરો પેદા થાય છે.

રંગની ભેળસેળમાં નીચેની બાબતો પર ધ્યાન રાખવું:

- (૧) કોઈપણ પ્રકારના ખોરાક કે પાણીમાં પ્રતિબંધ કરાયો હોય તેવા રંગનો ઉપયોગ ન કરવો.
- (૨) આઈ.એસ.આઈ. (ISI)માર્ક વગરના ગમે તેવા રંગનો ઉપયોગ ન કરવો.
- (૩) કૃત્રિમ રીતે ખોરાકને રંગ આપવાની મનાઈ ફરમાવેલ હોય તેવા ચા, કોઝી, મરીમસાલા, કઠોળ વગેરેમાં રંગનો ઉપયોગ ન કરવો.
- (૪) એક કિલો ખોરાક કે પાણીમાં ૦.૨ ગ્રામ જેટલા ખાદ્ય રંગ ઉમેરવાની પરવાનગીની મર્યાદા છે તેનાથી વધારે પ્રમાણમાં રંગનો ઉપયોગ ન કરવો.

ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લઈ રંગની ભેળસેળથી બચવા માટે પેક કરેલ અને સીલ કરેલા બીએસઆઈ કે એગમાર્કવાળો ખોરાક ખરીદવો જોઈએ.

અન્ય પદાર્થોમાં ભેળસેળ જાણવાની રીત :

અને બજારમાં વેચાતા કેટલાક પદાર્થો અને તેમાં થતી ભેળસેળની વિગતો જાણવા માટેની પદ્ધતિ વિષે ટૂંકમાં કોઈમાં માહિતી દર્શાવેલ છે.

ગ્રાહક અદાલતો ગ્રાહકોને ખરાબ માલ સામે રક્ષણ આપે છે. જો તમારી પાસે માલની ખરીદીનું બીલ હોય અને તેમાં ભેળસેળ માલૂમ પડે તો તમે ગ્રાહક અદાલતમાં ખોરાકનો નમૂનો અને ખરીદીના બિલની નકલ આપી તમે તેની સામે યોગ્ય નાશાંકીય વળતર મેળવ શકો છો. સરકારી કાયદા અનુસાર કોઈપણ વેપારી કે હુકાનદાર જેરી અને ભેળસેળવાળો ખોરાક કે માલ વેચી શકે નહીં.

ક્રમ	પદાર્થ	ભેગસેળ	ચકાસથી
૧	ચાની ભૂકી	ચાના પાનને સુકવી દળી, કૃત્રિમ રંગ કરેલ હોય	ભીના પેપરની સપાટી પર મૂકતા પીળા, ગુલાબી કે લાલ રંગના ડાઘા જોવા મળે તો તેમાં કૃત્રિમ રંગ ઉમેરેલ છે.
૨	કઠોળ અને દાળ	પોલિશ માટે કોલટાર ડાય	કઠોળમાં ઉકળતુ પાણી નાખી હલાવતા પાણી રંગવાળું બને છે.
૩	ખાદ્યતેલ	તીવ્ર ઝેરી	હાઈડ્રોક્લોરિક એસિડમાં ફેરિક કલોરાઇડનું દ્રાવણ ઉમેરતા લાલાશ કે કથ્થાઈ રંગ દેખાય છે.
૪	જરૂ	ધાસના બી જેને ચારકોલ ઉસ્ટથી રંગ કરેલ હોય છે.	હાથ પર ઘસતા આંગળીઓ કાળી થાય છે.
૫	ધાળાનો પાવડર	ધોડાની લાદ અને લાકડાનો પાઉડર ભેળવેલ હોય છે.	સાવચેતીરૂપે આખા ધાળા ખરીદી ઘેર પાઉડર બનાવવો હિતાવહ છે.
૬	હળદર	(૧) ઘઉં, ચોખા કે જુવારનો લોટ (૨) ટેલકમ પાઉડર, ઈટોનો ભૂકો, લેડ	સાંક્રિત હાયડ્રોક્લોરિક એસિડ હળદરના દ્રાવણમાં ઉમેરતા સાથે ગુલાબી રંગ આપે છે. જો હળદર એકલી હોય તો ગુલાબી રંગ મળતો નથી.
૭	મરચાંની ભૂકી	લાકડાનો ભૂકો અને રંગ	પાણી ભરેલા ગલાસમાં મરચું છાટતા લાકડાનો વ્હેર ઉપર તરશે અને પાણીમાં રંગ ઓગળશે.
૮	હિંગ	સુગંધિત અને રંગ કરેલ રેજિન કે ગુંદર	શુદ્ધ હિંગને પાણીમાં ઓગળતા દૂષિયું સફેદ દ્રાવણ મળે છે
૯	કેસર	રંગ અને સુગંધિત કરેલ મકાઈના સૂક્ષ્મ તાંત્રણા	કુદરતી કેસર કદળ હોય છે જ્યારે કૃત્રિમ તાંત્રણા બરડ અને જલ્દીથી ભાગી જાય છે.
૧૦	રવો	વજન વધારવા માટે લોહન ઇજકણો	રવામાં લોહચુંબક ફેરવતા લોહના રજકણો ચોટે છે.
૧૧	ખાંડ	વોશિંગ સોડા	હાઈડ્રોક્લોરિક એસિડ સાથે ઉભરો આપે છે
૧૨	ગોળ	ગોળમાં મેટાનીલ યલો	હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરતા મેજેન્ટા રેડ રંગ આપે છે
૧૩	સાંખુદાણા	રેતી, ટેલ્કમ પાઉડર	મૌમા મૂકતા રેતી હોય તો કરકર લાગે છે

N E W S

સમાચાર

સંકલન : ડૉ. વી. આર. બોધરા

સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, વિ.શિ.નિ. શ્રીની કચેરી, યુનિવર્સિટી ભવન, આ.કુ.યુ., આણંદ - ૩૮૮ ૧૧૦
ફોન : (૦૨૬૫૨) ૨૨૫૮૮૮ • ઈ-મેઈલ : boghravr@yahoo.com

□ સમગ્ર ગુજરાત અને ગુજરાતની પ્રજાની મહેનત હંમેશા રંગ લાવી છે. વિવિધ કેતે વ્યાપારી બુદ્ધિકુશળતા ધરાવતા આ પ્રજાજનોએ ખેતીમાં તો પોતાનું નામ વિશ્વભરમાં રોશન કર્યું જ છે પરંતુ સાથે સાથે સહકાર અને સહયોગની ભૂમિકા સાથે પણ અમૃત જેવી વિશ્વ કક્ષાની દૂધ ઉત્પાદક સંસ્થાઓ ઊભી કરીને ગુજરાતનું નામ અગ્રેસર રાખ્યું છે જેના પરિણામે ગુજરાતના ખેડૂતોના ચેહેરા સ્મેટ સાથે ગૌરવાન્નિત હેઠાં તેમ સર્વત્ર ભાસી રહ્યું છે તેમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું.

ખેડા જલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ, આણંદ દારા તા. ૩૦-૧૧-૨૦૧૫ના રોજ કપડવંજ તાલુકાના કાપડીવાવ ખાતે અશિયાખંડના પ્રથમ સ્વયં સંચાલિત ઉત્પાદન અને માલસંગ્રહકર્તા અત્યાધુનિક પશુઆધાર પ્લાન્ટનું ઉદ્ઘાટન માન. રાષ્ટ્રપતિશી પ્રણવ મુખરજીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે અમૃતલના આજે ઉચ્ચ કક્ષાના ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો મને મોકો મળી રહ્યો છે. ગુજરાતમાં હું અનેક વખત આચ્યો હું અને ગુજરાતની આંશિક, સમાજિક સુદૂરથી હું હંમેશા પ્રેરિત થયેલો હું ગુજરાત હંમેશા વિકાસના ક્ષેત્રમાં અગ્રેસર રહેલું છે. આજાદીકાળ પૂર્વે પણ ભરૂચ અને ખંભાત જેવા શહેરો દેશની શાન હતાં. આ ગુજરાતે ભારતની આજાદીમાં પણ મહત્વનો ફાળો આચ્યો છે. સમગ્ર આજાદીના પ્રણોતા પૂર્ણ મહાભાગ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના છે અને હું ગુજરાતમાં પધાર્યો હું ત્યારે તેઓને યાદ કર્યા વિના કેમ રહી શકું. ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, નિભાવેદાન કાકા, ડૉ. વગ્દાસ કુરિયને અમૃતલના વિકાસ માટે આપેલા ફાળાને યાદ કરીને હું તેઓને પુષ્પાંજલિ અર્પણ કરું હું. ૧૯૪૭માં અમૃતલનું રજિસ્ટ્રેશન થયું ત્યાર માત્ર ર૫૦ લિટર દૂધ ભરાતું હતું. ૧૯૪૮માં એક વર્ષ બાદ ૪૪૨ સભાસદો દ્વારા ૫૦૦૦ લિટર દૂધ ભરાયું હતું ત્યાર બાદ કમશા: દૂધ ઉત્પાદન વધતું જ ગયું અને આજે ઉદ્ધારાયે ખેડૂતો ભારતભરમાંથી વિવિધ પ્રકારનાં મિલક માર્કેટિંગ ફેડરેશનનો સાથે જોડાપ્યેલા છે.

આ પ્રસંગે અમૃતલના ચેરમેન રામસિંહ પરમારે ફીડ પ્લાન્ટની વિશેષતાઓ અંગે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટની પશુઆધાર ઉત્પાદન ક્ષમતા ૧૦૦૦ મેટ્રિક ટન પ્રતિ દિવસ છે જે ૨૦૦૦ મેટ્રિક ટન સુધી વધારી શકાય છે. આ પ્લાન્ટ ૨૪ એકરમાં વિસ્તરેલો છે. ભારતમાં પ્રથમ વાર જ આ પ્રકારની

ટેકનોલોજી જોવા મળશે. ઉત્પાદન અને માલસંગ્રહ માટે વિવિધ વિભાગોની રચના સમગ્ર અશિયામાં પ્રથમ વખત જ આ ફીડ પ્લાન્ટમાં જોવા મળશે.

□ જમીન-મારીને વધુ તંહુરસ્ત અને આરોગ્યપ્રદ બનાવવામાં આવશે એ પ્રકારના આપેલા વચનનું પાલન કરતાં વધાર્યાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ હેઠળ ખેડૂતોને 'સોઈલ હેલ્થ કાર્ડ' આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

'વર્દ્ધ સોઈલ કાર્ડ' નિભિતે દેશની જમીન-મારીને વધુ તંહુરસ્ત અને આરોગ્યપ્રદ બનાવવાની અમે ફરી પ્રતિક્રિયા લઈએ છીએ એમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો અને અધિકારીઓને શુભેચ્છા આપી હતી. આ રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ અંતર્ગત ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ ઉપરાંત અન્ય માહિતીઓ પણ પૂરી પાડવામાં આવશે. સોઈલ હેલ્થ કાર્ડ સરકારનો જમીનનું આરોગ્ય સુધારવાનો અને ખેડૂતોને જમીન સંબંધિત સુદૂરાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો એક પ્રયાસ છે, એમ તેમજે કહ્યું હતું. મારીની કથળતી જતી ગુણવત્તા ચકાસવા અને ખેતીવાડીની ઉત્પાદન ક્ષમતા વધારવા ફેલ્ખુંઆરીમાં શ્રી મોદીએ સુરતગઢ અને રાજસ્થાનમાં સોઈલ હેલ્થ કાર્ડની યોજના શરૂ કરી હતી.

આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં દેશના ૧૪.૫ કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનો પ્રસ્તાવ છે. કાર્ડમાં પાક પ્રમાણે ખેતીવાડીની જમીન માટે જરૂરી ખાતરની ભલામણ હશે અને એ રીતે ખેડૂતને જમીનના આરોગ્ય અંગે માહિતી મળશે જેથી કરીને તે જમીન માટે એ મુજબનાં પોષક તત્વોનો ઉપયોગ કરી શકશે.

વર્ષ ૨૦૧૫-૧૬ના નાણાંકીય વર્ષમાં મારીના ૧.૦૨ કરોડ નમૂના એકડા કરવાનું સરકારનું લક્ષ્ય છે. કૃષિ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ ગાય મહિના સુધીમાં મારીના પંચાવન લાખ નમૂના એકડા કરી લેવામાં આવ્યા છે તેમ જ તેમાંથી ૩૧.૪૩ લાખ નમૂનાનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે અને સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

ગાય વર્ષના જુલાઈ મહિનામાં પ્રથમ બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન શ્રી અરુણ જેટલીએ આ મહત્વાકંશી યોજનાની જાહેરાત કરી હતી.

(સહકાર તા. ૧૭-૧૮-૧૫માંથી સાભાર)

Published on 25th day of every month
Posted on 1st Day of every month at Anand Agril. Institute Post Office
"KRUSHIGOVIDYA" Magazine : January 2016



આ માસનું મોતી લક્ષ્મીનો સદૃપ્યોગ

રાજ્ઞિ ભોજ ધણા ચતુર અને વિદ્વાન હતા. તે હંમેશા ઈચ્છતા કે પોતાના નગરની પ્રત્યેક વ્યક્તિ વિદ્વાન હોય. વિદ્યા માટે રાજ્ઞિ ભોજ હંમેશા ઉદાર રહેતા. પોતાનો ખજાનો વિદ્યાના વિકાસ માટે કોઈપણ સમયે ખુલ્લો રાખતા હતા. આ જોઈને એક દિવસ વજ્ઞરને વિચાર આવ્યો કે જો આવું ને આવું ચાલ્યા કરશે તો આ સમુદ્ર ખજાનો પણ એક વખત તળિયું બતાવશે! લક્ષ્મીનો ઉપયોગ વિવેકપૂર્ણ થવો જોઈએ. પણ રાજ્ઞિ ભોજને આ વાત કહેવી કઈ રીતે? હોશિયાર વજ્ઞરે રાજ્ઞિ ભોજના રોજ ફરવા જવાના બગીચામાં એક ભીતિ ઉપર સંસ્કૃત પદ્યમાં લખ્યું, 'આફિત કાળમાં કામ આવે તે માટે લક્ષ્મીનું એટલે કે ધનનું રક્ષણ કરવું જોઈએ.' ચતુર વિદ્વાન રાજ્ઞિ ભોજ તરત જ સમજ ગયા કે આ વાત પોતાને ઉદ્દેશીને જ લખાઈ છે. તેમને તરત જ પેલી પંક્તિની નીચે જવાબમાં બીજી પંક્તિ લખી: 'લક્ષ્મીનો સદૃપ્યું કરનાર સજજનને આફિત આવે જ શાની? એટલે કે લક્ષ્મીનો સદૃપ્યોગ કરવાથી સર્વે આફિતો ટળે છે.' આ જોઈ વજ્ઞરે નીજી પંક્તિ લખી. 'લક્ષ્મી ચંચળ છે એ ગમે ત્યારે નાશ પામી શકે છે, એવે સમયે સંગ્રહ કરેલી લક્ષ્મી જ ઉપયોગમાં કે કામમાં આવે છે!' રાજ્ઞિ ભોજે પણ એનો જવાબ આપતા લખ્યું 'જો લક્ષ્મી ચંચળ જ હોય ને જતી જ રહેવાની હોય તો પછી સંગ્રહ કરેલી લક્ષ્મી પણ શરીરી રીતે ટકશે?'

વજ્ઞરને હવે લાગ્યું કે રાજ્ઞિ ભોજની વાત પોતાની વાત કરતાં વધારે સાચી છે. એ તરત જ રાજ્ઞિ ભોજ પાસે પહોંચી ગયો ને કહ્યું, 'મહારાજ આપ ખરેખર વિદ્વાન અને ચતુર છો. વિદ્યાને મહત્વ આપીને આપ સહુનું કલ્યાણ કરો છો. લક્ષ્મીનો સંગ્રહ આજ સુધી હું અનિવાર્ય સમજતો હતો, પરંતુ હવે લાગે છે કે એનો પરિગ્રહ તો વ્યક્તિની માત્ર પામરતા જ મગટ કરે છે. ખરેખર! લક્ષ્મીની શોભા તો તેના સદૃપ્યોગમાં રહેલી છે !'

- 'ક્ષાણે ક્ષાણે ચિંતન'માંથી સાભાર

If not delivered, Please return to :

Office of Posting :
Anand Agricultural Institute
Pin : 388 110

Regd. Newspapers
Printed Matter

પ્રતિશ્રી,

કૃષિગોવિદ્યા

રવાના :

વિસ્તરણ વિકાસ નિયામક શ્રીનિવાસ કચેરી
'કૃષિગોવિદ્યા' પ્રકાશન વિભાગ, યુનિવર્સિટી ભવન
આણંદ કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી
આણંદ ક્રિ. આણંદ પિન : ૩૮૮ ૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૨૫૮૮૮૮

Printed by Bhagirath Shah Published by Dr. P.P. Patel on behalf of Anand Agricultural University
and Printed at Papu Print, Ahmedabad and Published at Anand Editor : Dr. N.V. Soni
Subscription Rate : Annual ₹ 150